https://archive.org/details/bk099/page/n0/mode/1up

1933-12-21 -Twarikhe Pirzada ImamShahi (99)

All Items on https://archive.org/details/realpatidar

Full Library on https://realpatidar.com/library

:૭૮૬

તવારીખે
પીરઝાદા ઇમામશાહી

(ઉર્દુ ઝબાન ઔર ગુજરાતી હુરૂફોંમેં).

મુસન્નિફ
સૈયદ આબિદઅલી બાપુમીયાં પીરઝાદા.
મુ. પો. પેટલાદ (વાયા આણુંદ).
ઠે. મલાવ ભાગોળ, સૈયદોની ખડકીમાં.

ઇ. સ. ૧૯૩૩. હી. સ. ૧૩૫૨

કિંમત સિર્ફ ૦-૮-૦
ડાક ખર્ચ બઝીમે ખરીદાર.

[બેઇજાઝત છાપલેનેકી કીસીકો ઇજાઝત નહીં હય].

આ પુસ્તક શ્રી ભારતવિજય પ્રીન્ટીંગ પ્રેસ, વડોદરામાં પરભુલાલ શિવલાલ ઠક્કરે પ્રકાશક માટે છાપ્યું. તા. ૨૧-૧૨-૩૩.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk099/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk099/page/n2/mode/1up

realpatidar.com

:૭૮૬

તવારીખે
પીરઝાદા ઈમામશાહી

(ઉર્દુ ઝબાન ઔર ગુજરાતી હુરૂફોંમેં).

મુસન્નિફ
સૈયદ આબિદઅલી બાપુમીયાં પીરઝાદા.
મુ. પો. પેટલાદ (વાયા આણંદ).
ઠે. મલાવ ભાગોળ, સૈયદોની ખડકીમાં.

ઈ. સ. ૧૯૩૩. હી. સ. ૧૩૫૨

કિંમત સિર્ફ ૦-૮-૦
ડાક ખર્ચ બઝીમે ખરીદાર.

[બેઈજાઝત છાપલેનેકી કીસીકો ઇજાઝત નહીં હય].

આ પુસ્તક શ્રી ભારતવિજય પ્રીન્ટીંગ પ્રેસ, વડોદરામાં પરભુલાલ શિવલાલ ઠક્કરે પ્રકાશક માટે છાપ્યું. તા. ૨૧-૧૨-૩૩.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n3/mode/1up

realpatidar.com

દીબાચા.

બિસમિલ્લા હીર રહેમા નીર રહીમ

સબકે સબ તારીફેં ઉસ ઝાતે પાક કો ઝેબા હેં, જો સબસે અફઝલ ઓર કાયમો દાયમ અપને બંદોંપર અહેશાન ફરમાતા હય. તમામ સાહબાં ઇઝ્ઝુતો અઝમતસે ઉસકી હમ્દ કરતે હેં, ઓર ઝમીનોં આસમાનો માશીહા મેં વોહી ઇબાદતકે લાયક હય.

ઓર હમેં હર ઉસ શખ્સસે મેહફુઝ રખ્ખા હય, જો હમેં ઉસકી ઝાતસે ગુમરાહ કરે. ઉસને હમકો અપના ગુલામ ઓર બંદા બનાકર અપને કલામે પાકસે મોઆઝઝ ફરમાયા હય. ઓર અપને હબીબ (સ. અ.) કી તકલીદકી તવફીક અતા ફરમાઈ. હમ અગર તમામ જહાં કે દરખ્તોં કો કલમ બનાએં, ઓર તમામ સમંદરોંકે પાનીકી સ્યાહી બનાએં, ઓર સબકે સબ મીલકર તા કયામત, ઉસ ઝાતે પાકકી તારીફો સુક્રીયા અદા કરતે રહેં, ફીરભી એક ઝર્રાહ બરાબરભી શહી તારીફો સુક્રીયા અદા નહીં કર સકતે; ઓર અદા કરનેકી હમમેં તાબભી નહીં હય.

હમસબ ઇસબાતકી ગવાહી દેતે હેં કે, સિવાએ ઉસકે ઓર કોઇ મઆબુદ બરહક નહીં, વોહ વાહિદ હય, લા શરીક હય.

ઓર અગર ઉસકે વુજુદમેં ગોર કરેં તો વોહી વોહ હય. હમ ઇસ અમ્રકે ગવાહ હેં કે, હઝરત મોહંદ મુસ્તુફા સલ લલ્લાહ અલય હે વ આલે-હીવ સલ્લમ ઉસકે બંદા ઓર રસુલ હેં. ઓર હુઝુર (સ. અ.) ને જો કુછ ફરમાયા હય, હક હય. લોગોંકી તર્ફભી આપને, અપને તુરકી શ્રઆઉંસે realpatidar.com

https://archive.org/details/bk099/page/n4/mode/1up

realpatidar.com

ગુમરાહીકી આગકો બુઝાદીયા, ઓર તમામ મખલુકભી અલ્લાહપાકને આપકેહી તુફેલ પેદા કી, અગર આપ ન હોતે તો કુછભી ન હોતા.

હકતઆલા આપ, ઓર આપકે આલો અસહાબપર લા તાદાદ દુરૂદો સલામ નાઝીલ ફરમાએ, જબતકકે લુત્ફકા આફતાબ મસરીકસે તુલુઅ કરતા રહે, ઓર ઇનાયતકી બીજલી હિદાયત કે બાદલોંસે ચમકતી રહે; ઓર જબતક નાતેકાહ સિદ્દક કલેમા હક કેહતા રહે.

વ સલ લલ્લાહો તઆલા અલા ખયરે ખલકેહી, વનુરે અરશેહી મોહં-મદીંવ વ આલે વ અસ્હાએહી અજમઇન અમ્માબાદ.

મેં એક છોટીસી તવારીખમેં જીનબુઝુગોં કે કુછ હાલાત દરજકરના ચાંહતા હું સિર્ફયેહી ગર્ઝસે કે, ઇલાહેદા, ઈલાહેદા બહોતસે, બુઝુગોં કે હાલાત દેખનેમેં આતે હેં, મગર યેહભી એહલે કરામત બુઝુર્ગવાર હેં, કે જો પીરકે તખલ્લુસસે મશહુર હેં, ઇનકે હાલાત બહોત તારીકીમેં હેં. (ફારસી, ઉર્દુમેં થોડે બહોત હેં) ઇસલીયે યેહ હઝરાતોં કે કુછ, સચ્ચે હાલાત ઉર્દુ ઝબાન ઓર ગુજરાતી હુરૂફોંમેં લીખુંગા તો ગેર મુનાસિબ ન સમઝા જાયગા.

યેહ હઝરાતોંને ખાસકર "સુફી" તરીકસે ઇશાઅતે ઇસ્લામ મેં કોશીષ કી હય, ઓર કામિલ દરંજ્જેકી કામયાબી હાસિલ કરકે ઇસ્લામી તવારીખોં મેં અપની અપની શોહરતકા સુબુતકર દીખાયા હય, ગેર મુસ્લીમભી આપકે અજીબોગરીબ કારનામે સુનકર ઓર સુબુતી દેખકર દંગ રેહ જાતે હેં.

"સુફી"* યેહ લફ્ઝકે યું તો ઇલાહેદા ઇલાહેદા બહોતસેં મઆની હેં. મગર અસલ ઇસ લફ્ઝકી ગ્રીક " સોફાયા " સે હય, "સુફી" યાની તત્ત્વજ્ઞાની યેહ "લફ્ઝ" ગ્રીક સોફાયા (ઇલ્મ) લફ્ઝપરસે નીકલા હય.

---

* ઉનકા કપડા પહેનનેવાલા, દીલકો ગેરહકકે ખ્યાલસે સાફ કરનેવાલા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n5/mode/1up

realpatidar.com

સુફી વોહ હય, જીન્હોને દુન્યવી ચીજોં કો (જો અલ્લાહસે દૂર રખતી હૈં) દીલસે તરક કરદીયા ઔર દુનિયા પર કામયાબી હાંસિલકી જીન્હોંકા દીલ રોશન હો ગયા, ઔર તકબ્બુરકો નિકાલકર અલગ કરદીયા. ઔર જીન્હોંકો કોઈભી બાતમેં ખુશી યા ગમી જેસા કુછભી ન રહા, ઔર જીન્હોંને સુખ યા દુ:ખ કો એકસા માન લીયા. ઔર સોના ઔર મીટ્ટી જીન્કે નઝદીક યકસાં હય, ઔર અયસેહી અલ્લાહવાલે, કે જીનકો એકહી એક નેઝર આતા હય; વોહી સચ્ચે સુફી હેં.

ખાસકર ઇન હઝરાતોંને "સુરયેફતહ" (ઇન્ના ફતહના લક ફતહનમુબીના) કી, સચ્ચે ઉસુલોંસે ઔર બઝરીયે દુઆકે પેરવીકી. યાની ગેર મોમીનોંમે મીલઝુલકર, ઉનકે મઝહબકી તાલીમસે ઔર ઉનકે મઝહબી ઉસુલોંસે વકફીયત મીલાકર, પાક ઇસ્લામકે સચ્ચે ઉસુલો અરકાન ઔર સદાકતકી મહોરેં લગાકર ગેરમોમનોંકો સચ્ચે દીન (ઇસ્લામ) કી તાલીમ દી, ઔર સચ્ચે દીનસે મુશર્રફ કીયે.

ઇન હઝરાતોંને ઇસ્લામી અકાયદ કો ફિલસુફીસે મુતાબિક કરકે પેશ કીયે હેં, ઔર દાવતે ઇસ્લામકા આલાદરજ્જેકા ફર્ઝ અદા કીયા હય, યેહી સબબ હય કે મુસલમાન મુવર્રિખોંને ઇન હઝરાતોંકી બહોત મુખાલિફતકી હય, ઔર ઇનકે તરીકો દાવતકો એસે અંદાઝ ઔર હિકમતસે બયાન કીયા હય, જો શરીઅત પુરસ્ત મુસલમાનોં કો ખિલાફે શરીઅત માલુમ હો ઔર સિવાએ એતેરાઝ કે કુછ દીખાઇ ન દે. મગર ખાસ અલ્લાહ વાલે હરગીઝ કોઇ કામ ખિલાફેશરીઅત નહીં કરતે, જબ અલ્લાહ ઔર રસુલ (સ. અ.) કે પાક ફરમાનોં કે ખિલાફ કામ કરેં તો ફીર અલ્લાહ વાલે કયું કર કેહલાએં, ઔર અપના મકસુદભી કેસે અદા કરશકતે હેં. એસે વલી અલ્લાહકી કાર રવાઇઓંકા મોઆએના હસદકી આંખોંસે ઔર

realpatidar.com

https://archive.org/details/bk099/page/n6/mode/1up

realpatidar.com

શુમંરાહ નફસસે કબ હો સકતા હય અબ યેહભી બતાના જુરૂરી હય, કે જબ યેહ તવારીખમેં પીરોંકાહી યા સુફીયાએ કિરામકાહી ઝીક્ર હય તો ફીર ઇસ તવારીખકા નામ તવારીખે પીરઝાદા ઇમામશાહી કયું રખ્ખા.

મગર ઇસકી વજાહ યેહ હય કે, હઝરત ઇમામ જાફર સાદિક (રદી) સે શરૂ કરકે આખિર તકકે તમામ હઝરાત, હઝરતપીર ઇમામુદ્દીન (રેહ) કે રીસ્તેદારહી હેં, કોઇ જદ્દ હેં, કોઈ અવલાદ હેં તો કોઇ ખલીફા વગેરા હેં ઓર ઇસ ગિરોહ કે વસ્ત હિસ્સેમેં આપભી બહોત મશહુર ઓર ઝબરદસ્ત બુઝુર્ગ ગુઝરે હેં. ઓર જો તરીક અગલોંકા થા આપકાભી હય. ઓર આપકો અપને જદ્દ બુઝુર્ગવાર હઝરત ઇમામ જાફર સાદિકસે રૂહાની ફેઝભી હાસિલ થા. ઇસકે ઇલાવા આપકેહી લકબસે એક ગિરોહ મવજુદ હય, જો આપકી અવલાદ હય, ઓર "સાદાતે ઇમામશાહી" યા પીરઝાદા "કે લકબસે મશહુર હય." યેહી સબબ હય કે યેહ છોટીસી તવારીખકા નાંમ, " તવારીખે પીરઝાદા ઇમામશાહી રખ્ખા.

હાં, યું તો જીતનેભી મુસન્નિફ હુવે હેં, હર એકપર કુછ ન કુછ એતેરાઝતો હોતાહી ચલા આયા હય, કયું કે ઇનસાન ખતાવાર હય. (બમિસ્દાક આયત કે, અલ ઇનસાનો મુરકકબુન મઅલખતાએ વનનીસીયાન) ઇસલીયે મેરેમેંભી ખતાઉંકા હોના મુમકીન હય.

ફીરભી જહાંતક મેરેસે બનસકા, સહી હકીકતકી તલાસકી હય, કીસી જગે વિલાદત વિસાલકે સન મેં ફર્ક નઝર આયા હય, ઓર યેહ મામલા, હઝરત લાલશહેબાઝ કલંદર (રેહ) કે બાબમે આપકો નઝર આયગા; ઇન હઝરાતોં કે ચાંદ કલામાતભી લીયેહેં જો ગુજરાતી ઓર પુરાની હીંદી ઝબાનમેંહી કાયમ રખ્ખે હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n7/mode/1up

realpatidar.com

મુઝે યેહભી ન ચાહીએ કે ઇસ તવારીખમેં ઝુરૂરી વકફીયત દેનેવાલોં કો ફરામોશ કરદું. નવસારીવાલે "હઝરત સૈયદ સદરૂદ્દીન એસ. દરગાહવાલે" સાહબને મુંઝે ઇસ તવારીખમેં ઝુરૂરી વાકેઆતકી અચ્છી વકફીયત દીહય. ઓર જીસ વકત મેં આપ કે પાસ ઝુરૂરી હકીકત કે વાસ્તે ગયા, બહોત ખુશ તરીકસે પેશ આએ હેં અપના ઝુરૂરી વકત ઝાએ કરકે ગોયા મેરે ઉપર એહશાન કીયા હય, જીસસે ઇન હઝરતકા મેં અહેશાનમંદ હું.

આખિરી અર્ઝ યેહી હય કે બુઝુર્ગાને દીન કે આશિક, મેરી યેહ અદના કોંશીષ કે લેહાઝસેભી મુઝે દરગુઝર ફરમાએં.

નાચીઝ

સૈયદ આબિદઅલી બાપુમીયાં પીરઝાદા.

realpatidar.com

realpatidar.com

તવારીખે પીરઝાદા ઈમામશાહી

સુલતાન મીલ્લતે મુસ્તફવી દલીલે હુજ્જતે નબ્વી, સીદ્દીકે આમીલ, દીલ અવલીયા, જીગર ગોશએ અંબીયા નાકીદે અલી મુર્તુઝા (રદી) વારિસે નબી સલ લલ્લાહો અલયહેવ આલેહીવ સલ્લમ, આશિકે અબુ મોહંમદ ઇમામ જાફર સાદિક રદીઅલ્લા તઆલા અનહો,

હઝરત ઇમામ જાફર સાદિક (રદી.)

મેં કેહતા હું કે અંબીયા વ અલેહીસ્સલામ વ એહલે બયત વ સહાબા (રદી.) વગેરાકા ઝિક્ર કરેં તો એક ઇલાહેદા કિતાબકી ઝુરૂરત હય, મગર યેહ છોટીસી કિતાબ શિર્ફ એક ગિરોહ એહલે બયતકે લીયે લીખના ચાહતાહું કે જો આપહીકી નસલસે હેં, ઓર અકસરોંને તો આપસે રૂહાની ફેઝભી હાસિલકીયાં હય, ઓર આપકેહી ઉસુલોંકી પેરવીકી હય, સબબ તબર્રૂકન આપસેહી શરૂ કરતા હું.

આપ એહલે બયતસે હેં ઓર હઝરત મૌલાઅલી મુર્તુઝાસે છઠ્ઠે ઇમામ હેં, ઇસલીયે તરીકત કે બારેમેં આપકે બહોતસે ઇરશાદાત હેં. ઔર બહોતસી રિવાયતેં ઇન્સે મરવી હેં, ઇસલીયે ચંદ કલેમાત ઇન્કે લીખ્ખે જાતે હેં. કયું કે આપ એહલે બયતમેંસે હેં. જબ્બુઇન્કા ઝીક્ર કરદીયા ગયા તો ગોયા સબકા મઝકુર હુવા. કયા આપ નહીં જાનતે કે એક ગિરોહ ઇન્કા મઝહબ રખતા હય. ઓર ઇન્કા મઝહબ દો અઝ દેહ ઇમામકા મઝહબ* હય. યાની બારા એક હેં, ઓર એક બારા હય, મેરી ઝબાન ઓર ઇબા-

* દેખો તઝકેરતુલ અવલીયા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n9/mode/1up

realpatidar.com

રતમેં ઇન્કી તારીફો તવસીફકી તાકત નહીં, કયું કે વોહ બિલાતકલ્લુફ તમામ ઉલુમેં ઇશારાતસે વાકિફથે, વોહ તમામ મેશાએખોકે સરદાર હે હર શખ્સ ઇનપર ઇતબાર કામિલ રખતા હય. વોહ મુકતેદાઓ મુતલીકથે વોહ ઇલાહીયું કેભી શેખથે, મોહંમદીયોંકેભી ઇમામથે, ઓર એહલે ઓર કેભી પેશરૂથે ઓર એહલે તહકીકે પેશ્વાથે, આબિદીકે મોકદમ ઓર ઝાહિદોં કે મુકર્રમ થે.

હકાયકમેં સાહબે તસનીફથે ઓર લતાઇફ તફસીરો તનઝીલમેં બે નઝીર થે.

આપને હઝરત મોહંમદ બાકિર (રદી,) સે બહોતસી બાતેં રિવાયતકી હેં, મેં ઉનલોગું પર હયરાનહું, જો યેહ ખ્યાલ કરતે હેં કે, એહલે સુન્નત વલ જમાઅતકો, એહલે બયતસે કુછ સુઅઝન હય. ઓર હકીકત યેહ હય કે, એહલે સુન્નતહી એહલે બયત હે. મેં હયરાન હું કે વોહ શખ્સ કીસ ખયાલે બાતીલકો લીયે હુવે હેં, જો હુઝુર સલ લલ્લાહ અલયહે વ આલેહીવ સલ્લમ પરતો ઇમાન રખતે હેં, લેકિન આપકે ફરઝંદોસે મોહબ્બત ન રખ્ખે.

ઇમામ શાફઇ (રદી.) એહલે બયતસે ઇસકદર મોહબ્બત રખતે થે કે, લોગોંને આપપર રાફ્જી હોનેકા ગુમાનકીયા, ઓર આપકો ઇસી વજાહસે કેદ કર ડાલા ગયા. ઓર આપને ઇસબારેમેં શએર કહા હય, ઓર ઉસી મઆની યેહ હેં. કે અગર આલે મોહંમદ સલ લલ્લાહ અલયહે વ આલેહી વ સલ્લમકી દોસ્તી રફ્જ હય, તો તમામ જીન્નો ઇન્સ મેરે રફ્જકી ગવાહીદેં, ઓર અગર હુઝુર સલ લલ્લાહ અલયહે વ સલ્લમકી આલ ઓર અસહાબકા જાનના ઉસુલે ઇમાન નહીં હય, તો બયત ફુઝુલ હય કે કામ નહીં આતા. ઓર અગર તુમ જાનતે હોતો જાનનેમેં કુછ નુકશાન નહીં. કયું કે જબ આપ હઝરત રસુલલ્લાહ સલ લલ્લાહ અલયહે વ સલ્લમકો બાદશાહે દો જહાં સમઝતે હો, તો આપકે વઝરા ઓર સહાબા કોભી દરજા

https://archive.org/details/bk099/page/n10/mode/1up

મદરજા જાનતા ચાહીએ. ઓર આપકી અવલાદકોભી હસ્બે મરતબત પહેચાનના ચાહીએ. ઓર જો ઉસ બાદશાહતકે સાથ તઆલ્લુક રખતે હેં, ઉનસે મુતકારે ન કરના ચાહીએ.

મનકુલ હયકે મનસુર અબ્બાસને એક ઇરશાદ અપને વઝીરસે કીયા કે ઇમામ જાફર સાદિકકો લાવ, તાકે મેં ઉસે કત્લ કરૂં વઝીરને કહા ઉસકો, જો ગોશએ તનહાઇમે બેઠા હય, ઓર ઇઝલત અખત્યારકી હય, ઓર દુનિયાકો છોડકર ઇબાદતે ઇલાહીમેં મશગુલ હય.

યેહ સુનકર ખલીફા વઝીર પર રંજીદા હુવા ઓર કહાકે નહીં ? ઝુરૂર લાવ, તાકે ઉસે કત્લ કરદું, વઝીરને મના કીયા લેકિન કુછ અસર ન હુવા આખિરકાર વઝીર આપકો બુલાને ગયા ખલીફાને મુલાઝીમોંસે કહા કે, જબ સાદિક આએ, ઓર મેં સરસે ટોપી ઉતારૂં ઉસ વકત સાદિકકો કત્લ કરદેના.

આખીર જબ હઝરત ઇમામ જાફર સાદિક તશરીફ લાએ, ખલીફા મનસુર જલદીસે ઉઠા. ઓર નિહાયત આજેઝીસે આપકી તાઝીમકી. ઓર આપકો તખ્તપર બીઠાયા ઓર ખુદ નિહાયત મુઅદબાના તરીકસે આપકે સામને બેઠા. ગુલામ યેહ હાલ દેખકર ઉસપર તઆજ્જુબ હુવે. મનસુરને પૂછા, હુઝુરકો કયા હાજત હય. આપને ફરમાયા, બસ યેહી કે તૂ દોબારા મુઝે અપને પાસ ન બુલાના, ઓર મુઝે જાનેદે તાકે મેં ઇબાદતે ઇલાહીમેં મશગુલ રહું.

પસ ખલીફાને ખીલઅત વગેરા દેકર નિહાયેત આજેઝીસે આપકો રૂખસત કીયા. ઓર ઉસી વકત મનસુરકો લરઝ હોને લગા. ઓર બેહોશ હો ગયા. ઓર તીન દિન ઇસી હાલતમેં રહા, (બાઝોકે નઝદીક તીન કલાક બેહોશ રહા) જબ હોશમેં આયાતો વઝીરને પૂછા કયા હાલત હય ? ખલીફા મનસુરને કહા કે જબ સાદિક દરવઝેમેં દાખિલ હુવા, તો મેંને

https://archive.org/details/bk099/page/n11/mode/1up

realpatidar.com

એક અઝદહાકો ઇસકે સાથ દેખા. કે ઇસકા એક લબતો ચબુતરે કે નીચે ઓર ઉસને ઝબાને હાલસે કહા કે, અગર તૂ ઇનકો સતાએગાતો મેં તુઝે ઇસ ચબુતરેસે નીચે ખેંચ લુંગા. મેં ઇસ અઝદહા કે ડરસે ન સમઝ સકા કે કયા કેહ રહા હું. ઓર મેંને ઉનસે મુઆઝેરતકી ઓર ઇસી તરાહ મે હોશ હોગયા.

નકલ હય કે એક દફા હઝરત દાઉદતાઇ (રહે) હઝરત સાદિકકી ખીદમતમેં હાઝિર હુવે, ઓર કહા કે અય રસુલલ્લાહ (સ૦ અ૦) કે ફરઝંદ મુઝે કુછ નસીહત કર, કે મેરા દીલ સ્યાહ હો ગયા હય, આપને ફરમાયા, અય અબાસુલેમાન તૂ ઝાહિદે ઝમાના હય, તુઝે મેરી નસીહતકી કયા હાજત હય ? હઝરત દાઉદને કહા, અય ફરઝંદે પયગંબર, અલ્લાહને આપકો હમસબ પર ફઝીલતદી હય, ઓર આપપર વાજિબ હય કે સબકો નસીહત કરે. આપને ફરમાયા, અય અબા સુલેમાન મેં ઇસ બાતસે ડરતાહુ કે, કયામતકે દિન મેરી જદ્દ મુઝસે પુરશીશ કરે કે તૂને કયું મેરી મુતાબેઅતકા હક અદા ન કીયા. ન જાત નસબશહીહ પર મોકુફ નહીં હય. બલ્કે અચ્છે આ માલ પર હય હઝરત દાઉદ યેહ સુનકર, હક તઆલાકે હુઝુરમેં રોયા. ઓર કહાકે બારે ઇલાહી યા કે જીસ શખ્સકા ઝાહિર તીનત ઓર તરકીબે તબીઅત નબુવ્વત કે પાનીસે હય, ઓર જીસકા નાના રસુલ (સ. અ.) હય, ઓર મા બતુલ હય, વોહ ઇસકદર હેરાન હય, તો દાઉદ કયા હય, અપને લીયે નાઝ કરે.

નકલ હયકે એક દિન આપ, અપને ગુલામોમેં બેઠે હુવે થે. આપને કહા આવ હમસબ બયત કરે ઓર ઇસમેં કરાર બાંધે, કે જો કોઇ હમસબમેંસે કયામત કે દિન રિહાઇ હાસિલ કરે, વોહ બાકી દુસરોંકી શફાઅત કરે. ગુલામોંને જવાબ દીયા, અય ફરઝંદે રસુલ (સ. અ.) આપકો હમારી શફાઅતકી કયા હાજત હય જબકે આપકા નાના તમામ મખલુકકા

realpatidar.com

https://archive.org/details/bk099/page/n12/mode/1up

realpatidar.com

શરી હય, આપને ફરમાયા મેં અપને અફઆલસે શર્મ ખાતાહું કે ઈસ હાલત મેં કયામતકે દિન અપને નાનાકે ચેહરે મુબારિકકી તર્ફ દેખું.

નકલ હય કે જબ હઝરત ઇમામ જાફર સાદિક (રદી.)ને ખીલવત અખ્તયાર કરલી, ઔર બાહિર તશરીફ નલાએ, હઝરત સુફીયાન સોરી આપકે પાસ આએ, ઔર અર્ઝકી કે, અય ઈબ્ને રસુલલ્લાહ (સ. અ.) લોગ આપકે ઈરશાદાતે કૂદસીયાસે મેહરૂમ હો ગએ હેં. આપને કયું ગોશા-નશીની અખત્યાર કરલી આપને ફરમાયા અબમેરા મુંહ એસાહી હય.

નકલ હય કે લોગોંને હઝરત સાદિકકો નિહાયત એશઆ લિબાસમેં દેખા, તો કહા કે, અયઈબ્ને રસુલલ્લાહ (સ. અ.) યેહ લિબાસ તો આપ કે ઘરકા માલુમ નહીં દેતા, આપને એક સખ્સકા હાથ પકડકર આસ્તીન મેં લગાયા, તો ઉસ વકત માલુમ હુંવા કે આપ ટાટ પેહને હુવે હેં. જો હાથોંકો છીલની કરતા હય, ઔર ફરમાયાકે, યેહ લોગોં કે દિખાને કે લીયે હય, ઔર વોહઅલ્લાહકે લીયે.

નકલ હય કે હઝરત સાદિક (રદી.) ને ઈમામ અબુહનિફા (રેહ) સે પૂછા કે અકલમંદ કોન હય ? આપને જવાબદીયા, જો ખયરો શરમેં તમીઝ કરે, તાકે વોહ દો ખયરોંમેંસે બેહ્તર ખૈરીનકો અખત્યાર કરે, ઔર દો શરોંમેંસે કમ શરકો અખત્યાર કરે.

નકલ હયકે લોગોંને હઝરત સાદિક (રદી.)સે કહાકે, આપમેં સબ હુનર હેં. આપ ઝાહિદભી હેં, ઔર કરીમભીહેં ઔર ખાનદાનકે કુર્રતુલ અયનભી, લેકિન મુતકબ્બિરભી; આપને ફરમાયા મેં મુતકબ્બિર નહીં હું લેકિન મુઝે કીબ્રીયાઈ હાસિલહય, કે જબ મેંને અપને સરસે તકબ્બુર નિકાલદીયા, તો ઉસ ઝાતે વાહિદકી કીબ્રીયાઇ મુઝમેં સમાગઈ. આપને ફરમાયા, તકબ્બુરસે તકબ્બુર ન કરના ચાહીએ, ઉસકી કીબ્રીયાઇસે કીબ્ર-ઝેબા હય.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n13/mode/1up

realpatidar.com

નકલ હુય કે એક શખ્સકી રૂપીઓંકી થેલી જાતી રહી. વોહ શખ્સ હઝરત સાદિકકો ઝગડને લગાકે તૂને ઉઠાઈ હય, ઓર આપકો ન પહેછાના કે આપ કોન હેં. આપને પૂછા ઉસમેં કિતની રકમથી, ઉસને જવાબ દીયા, એક હઝાર દીનાર પસ ઉસે આપ ઘર લે ગએ, ઓર દો હઝાર દીનાર દે દીયે. ઓર બાદમેં ઉસ આદમીને અપને રૂપીઓંકો એક દુસરી જગે પાલીયા. ઓર હઝરતકે દીયે હુવે રૂપીઓંકો વાપિસ લે ગયા. ઓર અર્ઝ કરને લગાકે, મેંને ગલતી કીથી, આપને ફરમાયા અબ વાપિસ ન લુંગા. બાદમેં ઉસને એક શખ્સસે પૂછા કે યેહ કોન હઝરત હેં. ઉસને જવાબ દીયાકે હઝરત ઇમામ જાફર સાદિક (રદી.) હેં. વોહ શખ્સ ઇસબાત પર શરમીંદા હુવા. ઓર ચલા ગયા.

નકલ હયકે એક દિનકા ઝિક્રહય કે, આપ અકેલે એક રાસ્તે પર જા રહેથે. ઓર અલ્લાહ અલ્લાહ કેહતેથે. ઓર એક જલા હુવા આદમીભી આપકે પીછે પીછે જા રહા થા. ઓર અલ્લાહ, અલ્લાહ, કેહતાથા. આપ ફરમાતેથે, અલ્લાહ મેરે પાસ કપડા નહીં હય, ઓર મેરે પાસ એક ઝબ્બાભી નહીં. આપકો ઉસી વકત એક પાકીઝા કપડા મીલ ગયા. આપને પહેન લીયા. વોહ જલા હુવા શખ્સ આપકે સામને આયા, ઓર અર્ઝ કરને લગા. અય ખ્વાજા, મેંભી અલ્લાહ, અલ્લાહ, કેહનેમેં તુમ્હારા શરીકથા. અબ વોહ પુરાના કપડા મુઝે દેદો. આપકો યેહ બાત પસંદ આઇ. ઓર વોહ પુરાના કપડા આપને ઉસે દે દીયા.

નકલ હય કે, એક શખ્સ આપકે પાસ આયા, ઓર કેહને લગાકે મુઝકો અલ્લાહ દીખા દીજીએ. આપને ફરમાયા કયા તુને નહીં સુના કે હઝરત મુસા (અ૦ સ૦) કો કહા ગયાથા કે, " લન તરાની " યાની તુમ મુઝકો ન દેખ સકોગે. ઉસને કહા હાં લેકિન યેહતો " મિલ્લતે મોહંમદી " હય, કે એક શખ્સ ફર્યાદ કરતા હય, (કે મેરે દીલને પરવરદીગારકો દેખા,

realpatidar.com

https://archive.org/details/bk099/page/n14/mode/1up

realpatidar.com

દુસરા નક્કારા લગાતા હય, મેંને ઉસ પરવરદીગારસે એોહદ નહીં કીયા, જીસકો દેખા નહીં.) આંપને હુકમ દીયા કે, ઇસકો,બાંધકર દરીયાએ દજલામેં ડાલદો. લોગોંને ઉસે બાંધકર દજલામેં ડાલ દીયા. પાની ઉસે નીચે લે ગયા, એોર ફીર ઉપર લાયા. ઉસને કહા, અય ઇબ્બન રસુલુલ્લાહ (સ૦ અ૦) અલગયાસ, અલગયાસ, આપને ફરમાયા અયપાની ઇસે ફીર નીચે લેજા ? ફીર વોહ દુસરી બાર ઉસકો ઉપર લાયા, હત્તાકે વોહ ઉસકો ઇસીતરાહ નીચે લે જાતાથા, એોર ઉપર લે આતાથા, એોર વોહ હઝરત સાદિકસે પનાહ તલબ કરતાથા, એોર જબ દજલામેં ગર્ક હોગયા તો, ઉસને લોગોં સેં ઉમ્મીદ મુનકેતા કરલી. એોર જબ ફીર પાનીને ઉસકો બાહિર ઉછાલા તો ઉસને કહા, ઇલાહી અલગયાસ, અલગયાસ, આપને લોગોંસે કહાકે ઇસે બાહિર નીકાલો. લોગોંને ઉસે બાહિર નિકાલા. એક સાઅત ઉસકો ઇસીતરાહ રેહનેદીયા. તાકે ઉસકે હવાસ ઠિકાને આજાએં. ફીર આંપને પુછા, કયા તુને હકતઆલા કો દેખા ? ઉસને કહા, જબ તક મેં ગેરકી પનાહ ચાહતાથા. ઉસ વકત તક હિજાબથા. જબ મેંને પુરે તોર પર ઉસકી (અલ્લાહકી) પનાહ ચાહી. એોર એકરાર હુવાતો, મેરે દીલમેં એક રૂઝનકુશાદા હો ગયા ફીર મેંને વહાંસે દેખા, યહાંતક કે મેરી એકરારી દૂર હો ગઈ. ફીર આપને ફરમાયાકે જબતક તૂ સાદિકકો ભુલાતાથા જુઠાથા. અબ ઇસ રૂઝન કો નિગાહ રખ. એોર ફરમાયાકે, જો શખ્સ યેહ કહે કે, અલ્લાહ કીસી ચીઝપરહય, યા કીસી ચીઝસે હય, વોહ કાફિર હય. એોર ફરમાયાકે, હર વોહ ગુનાહ જીસકે અવ્વલમેં ખોફહો, એોર આખિરમેં ઉઝર વોહ બંદેકો હકતઆલાકે નઝદીક કરતા હય. એોર વોહ ઇબાદત જીસકે અવ્વલમેં અમનહો, એોર આખિરમેં ગુરૂર, વોહ બંદેકો હકસે બાઝ રખતા હય, એોર મુતકબ્બિર ઇતાઅત કરનેવાલા આશીહય, એોર આશી ઉઝરકે સાથ ઇતાઅત કરનેવાલા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n15/mode/1up

realpatidar.com

લોગોંને આપસે પુછાકે દુરવેશ સાબિર ફઝીલત રખતાહય, યા તવંગર શાકીર. આપને ફરમાયા, દુરવેશ સાબિર, કયું કે તવંગરકા દીલ દવલતકી જાનિબ હોતા હય, દુરવેશકા અલ્લાહકી તર્ફ.

ઓર ફરમાયા ઇબાદત બિલાતોબા કરનેકે દુરસ્ત નહીં હોતી. કયું કે અલ્લાહપાકને તોબાકો મુકદમ બનાયા હય, જયંસા કે હકતઆલા કા ઇર-શાદ હય. (કે તોબા કરનેવાલે ઇબાદત કરનેવાલે હેં.) ઓર ફરમાયા, અલ્લાહપાકકે ઝીક્રમેં તોબાકા ઝીક્ર કરના ઝીક્રસે ગાફિલ રહેનાં હય. ઓર હકીકતમેં અલ્લાહતઆલા કો યાદ કરના એસા હય કે, ઇસકે મુકાબિલેમેં તમામ અશ્યાકો ફરામોસ કર દેં કયું કે હકતઆલા. ઉસકે લીયે તમામ અશ્યાકા એવઝ હય, ઓર ફરમાયા કે મોમીન વોહ હય કે, જો અપને ન ફસકે સાથ મુકાબલા કરે. ઓર આરિફ વોહ હય, જો અલ્લાહતઆલા કે સાથ કાયમ રહે. ઓ ફરમાયા કે જો શખ્સ નફસકો નફસકે લીયે મુઝા-હેદા મેં ડાલતાહય, વોહ અલ્લાહતઆલા કે કરામત તક પહોંચ જાયગા. ઓર ફરમાયા કે ઇલહામ મકબુલોંકિ વસ્ફમેં સે હય. ઓર બિલાઇલહામ ઇસ્તદલાલ કરના, સન્દ હે દરગાહ કી અલામત હય. ઓર ફરમાયા, શાયદ અલ્લાહ તબારક બંદેમેં ઇસસેભી ઝયાદા પોશીદા હય, જીતનાકે અંધેરી રાતમેં સ્યાહ પત્થર પર ચ્યુંટીકા ચલના. ઓર ફરમાયા ઇશ્કે ઇલાહી, ન મઝમુમહય ન મેહમુદ. ઓર ફરમાયા, દેખનેકા રાઝ ઉસવકત મુઝપર સાબિત હુવા, કે દીવાનગીકા ખત મુઝપર ખીંચા ગયા. ઓર ફરમાયા આદમીકી નેક બખ્તી ઇસમેંભી હય, કે ઉસકા દુશ્મન અકલમંદ હો. ઓર ફરમાયા પાંચ લોગોંકી સોબતસે પરહેઝ કરો. (૧) જુઠે આદમીસે, કયું કે ઉસકે સાથ હમેશાં ગુરૂરમેં રહોગે. (૨) અહમકસે, કે વોહ હરચંદ તેરા ફાયદા ચાહેગા, લેકિન નુકશાન કરેગા, ઓર નજાનેગાકે નુક-શાન કીયા. (૩) બખીલસે, કયું કે વોહ સબસે અચ્છા વકત [illegible]

realpatidar.com

https://archive.org/details/bk099/page/n16/mode/1up

realpatidar.com

કરેગા. (૪) બુઝદીલ આદમીસે, વોહ જુરૂરતકે વક્ત તુઝે છોડ દેગા. (૫) ફાસિકસે, કે વોહ તુઝકો એક લુકમેં કે એવઝ ફરોખ્ત કર ડાલેગા. ઓર લુકમેંસે કમકી તમા કરેગા. ઓર ફરમાયા હકતઆલાને દુન્યામેં એક બહેસ્ત ઓર દોઝખ પેદા કીયાહય, બહેસ્ત તો આફિયતહય, ઓર અઝીય્યત દોઝખ હય. બહેસ્ત યેહ હય, કે અપના કામ અલ્લાહ કે સુપુર્દ કરે, ઓર દોઝખ યેહ હયકે અપના કામ નફસકે હવાલે કરે. ઓર ફરમાયા અગર દુશ્મનકી સોબત અવલીયા અલ્લાહ કે લીયે મુઝીર હોતી તો આસિયાકો ફિરઓનસે ઝરર પહોંચતા. ઓર અગર અવલીયા કી સોબત આદા કે લીયે નાફે હોતી, તો હઝરત નુહ ઓર હઝરત લુત (અ. સ.) કી ઓરતોં કો ફાયદા પહોંચતા. લેકિન યેહ તંગી કુશાદગીસે પેહલે નહીં હોતી. હઝરત કે ઇરશાદાત તો બહોત હેં, યેહ નાચીઝ બંદે કી કયા મઝાલ કે તમામ ઓર શહી તારીફ કર સકે, સિર્ફ યેંહી ગર્ઝસે કુછ હાલાત લીખના પડેકે મેં જીન હઝરાતોં કે બારેમેં કુછ લીખના ચાહતા હું વોહ આપહી કી અવલાદ સે હેં, ઓર બાઝોંકો તો આપંસે રૂહાની ફેઝબી હાસિલ હય.

હઝરત સૈયદ મોહંમદ (રેહ)

હઝરત ઇમામ જાફરસાદિક (રદી.) કે બડે સાહબઝાદેકા નામ હઝરત ઇમામ ઇસ્માઇલ થા. આપ હઝરત ઇમામ જાફર સાદિક (રદી.) કી તમામ અવલાદમેં નઝીબબી થે. યાની ઇનકી વાલિદા સાહબાબી ફાતમી થીં. જીનકા નસબ નામા ઇસ્તિરાહસે હય, હઝરત ફાતેમા બીન્નતે હશન બીન હઝરત ઇમામ હશન (રદી.) બીન અમીરૂલ મોમેનીન હઝરત અલી કરમલ્લા વજહુ.

હઝરત ઇમામ ઇસ્માઇલકો તમામ ઝાહિરી વ બાતિની નેઆમતે અપને વાલિદ બુઝુર્ગવાર હઝરત ઇમામ જાફર સાદિક (રદી.) સે હાસિલથીં આપને અપને બાદ તમામ કરામાતેં આપકે સાહબઝાદે હઝરત સૈયદ

realpatidar.com

https://archive.org/details/bk099/page/n17/mode/1up

realpatidar.com

મોહંમદકો બખ્શીથીં. હઝરત ઇમામ જાફર સાદિક કે વિસાલ કે બાદ ઇમામતકે વાસ્તે ઇખ્તિલાફ મામલા પેશ આનેકી વજાહસે હઝરત સૈયદ મોહંમદ (રેહ) ને મુલ્ક "રય" કી તર્ફ સફર કીયા. ઉસ વકત ઇરાનમેં ફીલસુફી ઓર અકલકા બહોત ઝોર થા. ઇસલીયે ઇસ્લામી અકાયદકો ફિલસુફીસે મુતાબિક કરકે દાવતે ઇસ્લામ કે લીયે પેશ કીયા જાતા થા. ઓર યેહી વજાહ હય કે મુસલમાન મુવર્રિખોંને ઇનકી બહોત મુખાલેફત કી હય, ઓર ઇનકે તરીકો દાવત કો એસે અંદાઝ ઓર હિકમતસેં બયાન કીયા હય, જો શરીઅત પુરસ્ત મુસલમાનોંકો ખિલાફે શરીઅત માલુમ હો. મુવર્રિખોંકી યેહ કોશીષસયાસી હસદકી બીના પરથીં. કયું કે અબ્બાસી ખિલાફતકા દોરદોરા થા, ઓર તમામ મુવર્રિખ, અબ્બાસીયા ખીલાફતકે દસ્તેનગર (માતેહત) મેં થે. ઓર અબ્બાસી નહીં ચાહતે થે કે બની ફાતેમાકી ખીદમતે ઇસ્લામી શહીતોર પર તારીખોંમેં લીખ્ખી જાય, કયું કે વોહ બની ફાતેમાકો અપની સલતનતકા દાવેદાર ઓર હરીફ સમઝતેથે. માલુમ હોતા હય કે સૈયદ મોહંમદ (રેહ) એ ર આપકી અવલાદને ખુરાસાનો કંદહાર વ હિંદુસ્તાનકે અલગ અલગ હિસ્સોંમેં જાકર ગેર મુસ્લીમ કોમોંમે ઇશાઅતે ઇસ્લામકા કામ નિહાયત ઉંમદગીસે કીયા. (દેખો ફાતેમી દાવતે ઇસ્લામ.)

હઝરત પીર સૈયદ મોહંમદ (રેહ) ને મુલ્કે "રય" કી તર્ફસે હિંદુસ્તાનકા સફર કીયા ઉંસ વકત હિંદુસ્તાન મેં સિદ્ધરાજ જયસિંહકા ઝમાનાથા આપકા ઇસ્મ મુબારક સૈયદ મોહંમદ થા મગર લોગ આપકો સૈયદુસ્સાદાત કેલકબસે પહેછાનતેથે, ઓર નવમુસ્લિમ મુરીદ લોગ આપકો "સત ગોર નૂર મોહમદ" કેહતે થે. મખલુકકી ઇબતેદાસે આપકે બુઝુર્ગ બડી બડી કરામાતોંવાલે ગુઝરે હેં.

તમામ મખ્લુકકે દાદા ઓર અવ્વલ પેગંબર હઝરત આદમ અલય

realpatidar.com

https://archive.org/details/bk099/page/n18/mode/1up

realpatidar.com

હીસ્સલામસે લેકર આખેરી પેગંબર હઝરત મોહંમદ મુસ્તુફા સલ લલ્લાહે અલયહે વ સલ્લમ તક યકે દીગર પેગંબર અલયહીસ્સલામ, ઓર અવ-લીયા અલ્લાહ, જો જો હુવે હેં. વોહ મરાતીબ ઓર બુઝુર્ગી આપકે જદ્દો અમજદકો હય. ઓર સચ્ચી ગવાહીકે લીયે દુન્યાકી તવારીખોંમેં સુન્હેરી હુરૂફોંમેં સદહા બલકે હઝારોં કીતાબેં શાએ હો ચુકી હેં.

આપ હિંદુસ્તાનમેં તશરીફ લાએ, ઉસ વકત લોગોંમેં બેહુદા હરકતેં, બુતપુરસ્તી, હસદ, વગેરા વગેરા બહોતસી બુરી રસુમેં જારીથીં. ફિલસુફી ઓર જાદુ વગેરાકા દોર દોરાથા.

એસે બારીક વક્તમેં યેહ ઝબરદસ્ત અવલીયા અલ્લાહને ગેર મુસ્લીમોં મેં મીલઝુલકર ઉનકે મઝહબકે કાનુનો ઉસુલસે વકફીયત મીલાકર ઇશાઅતે ઇસ્લામકા કામ શુરૂ કર દીયા. દીને ઇસ્લામકી સદાકત ઓર આપકી કરામાતોંકા વોહ અસર દીખાયાકે હઝારહા લોગ ઝોક ઝોક ઇસ્લામમેં આને લગે. ઓર આપકો ફતેહમંદી હુઈ.

આપકા ઓર આપકી અવલાદકા મંઝીલે મકસુદ યેહીથા, કે મુલ્કમેં સચ્ચેદીનકી તાલીમ દીજાય, જીસકે સબબ બુતપુરસ્તી, હસદ વગેરા બાતેં ખુદબખુદ મિટ જાય. યેહ બાતેં દુર કરાકર ઇસ્લામમેં લાના, હંસીખેલ નહીંથા. બલકે બહોત મુશ્કિલ કામ થા. કયું કે બુરાઇયોકાં બાઝાર ગર્મ થા. લોગોંકો નએ મઝહબકી તર્ફ રગબત દીલાના થા. બહોતસે મઆબુદોં કે પંજેસે છુડાકર એકહી મઆબુદ (કે જો સચ્ચા હય, વાહિદહય, લા શરીક હય.) કી તર્ફ દાવત દેનેકી ઝુરૂરતથી.

મગર ઇન્શાઅલ્લાહ યેહ હઝરાતોંને જેસા મરીઝ, વયસેહી તરીકકી દવા દેકર રફતા રફતા ઇસ્લામમેં બહોતસી ઝયાદતીકી. ઓર હરતર્ફ ઇસ્લામ ફેલાયા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n19/mode/1up

realpatidar.com

આપકા ઇશાઅતે ઇસ્લામકા તરીક સમઝનેકો બહોત ઇલ્મકી ઔર ઇન્સાફકી ઝુરૂરત હય, વર્ના હસદકી આંખોંસે એતેરાઝ માલુમ હોગા. આપને ઔર આપકે ફરેઝંદોંને ઇસ્લામ ફેલાનેમેં સુફીયાના તરીકસે કામ લીયા હય, જો અપને અપને મોકેપર કલામાત દેખનેસે માલુમ હો જાયગા.

અગર વકતકી બારિકી ઔર ઉસ વકતકી રસુમોંકા ખ્યાલ રખકર યેહ તરીક કો સમઝેં તો ઇન્સાફકી ખાતિર ઝુરૂર કહેના પડેગા કે સુબ્હાનલ્લાહ "ઇસ્લામકી ઝયાદતી કરનેકે લીયે" કયા અચ્છા તરીક હય. જીસસે ગેરકોમકો ઇસ્લામકી તર્ફ રગબત હોતી ચલી. ઔર ચારોં તર્ફ "લા ઇલાહા ઇલ લલ્લાહો મોહંમદુર્ રસુલુલ્લાહ." કી ધુન મચ ગઇ.

હઝરત સરવરે કાએનાત, આકાએ નામદાર મોહંમદ મુસ્તુફા (સ૦ અ૦) કે વારિસોંકો અગર કોઇ કામ સુપુર્દ હય, તો ખાસ કર યેહી હય કે ઇસ્લામકી રવનક બઢાના. (ઇખલાસો સદાકતસે, ઇસ્લામ બઢાના.)

યેહી સબબ હયકે હઝરત સૈયદ મોહંમદ (રેહ) ને ઔર આપકી અવલાદને ઇખલાસો સદાકત ઔર હકપુરસ્તીસે લાખોં લોગોંકો ઇસ્લામસે મુશર્રફ કીયા ઔર ઇસ્લામકી તાલીમદી.

આજ હિંદુ–મુસલમાનો કો ઇત્તેફાકકી તાલીમ દી જાતી હય, ઔર એક દીલી કરનેકો કંઇ અકાબરે કોમ કોશીષ કર રહે હેં. લેકિન યેહ કોશીષ તો યેહ ઝબંરદસ્ત વલી અલ્લાહને સવાઆઠસો સાલસે કી હુઇ હય. ઔર કામયાબી હાંસિલ કી હય. ઔર આજભી સુબુતી કેલીયે હઝારોં મુરીદ હિંદુઓં મેંસે ઔર હઝારોં મુરીદ મુસલમાનોંમેંસે મવજુદ હેં, હિંદુ–મુસલમાનકા ઇત્તેફાક કરાનેકી યેહી દલીલેં કાફી હેં.

હઝરતપીર નૂરમોહંમદ (રેહ) કે બાબમેં "તવારીખે નવસારી" કે મુંસન્નિફ મી. શો. મ. દેસાઇ એક કોન્ફરન્સમેં કેહતે હેં કે, મુઝેતો માલુમ હોતા હય કે હિંદુસ્તાનમેં "સુફી" મત કી, શરૂઆત હઝરત નૂરમોહંમદ સેહી હુઇ હય, ઇસમેં ઝરાભી શક નહીં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n20/mode/1up

realpatidar.com

આપ મુલ્કે "રય" સે હિંદુસ્તાનકી તર્ફ તશરીફ લાએ ઉસ વકત રાજા સિદ્ધરાજ જયસિંહકા ઝમાનાથા આપ ગુજરાત કે શહેર પટ્ટનમે તશરીફ લાએ. ઓર ફીરસે ફીરતે રાજાકે મંદરમેં ગએ. ઉસ વકત મંદરકે પૂજારીને આપકો અંદર દાખિલ હોને કે લીયે મના કીયા. ઓર કહા કે તુમતો મુસલમાનહો, ઇસલીયે મંદરમેં નહીં જા સકતે હમારા મંદર નાપાક હો જાય.

આપને ફરમાયા તુમ્હારે દેવ પાકસાફ ઓર સચ્ચે હેં, તો ઉન્હેં કહો કે અપની કરામત બતલાએ. પૂજારીને કહા કે પત્થરકી મૂર્તિ કૈસે બોલ શકતી હય. આપને ફરમાયા જરા સબર કરો ઓર દેખો બોલતી હય યા નહીં. ફીર આપને તમામ મૂર્તિઓંકો નાચ કરનેકો કહા. આપકે ફરમાતેહી તમામ મૂર્તિએં નાચને લગીં. યેહ કેફીયત જબ પૂજારીને દેખીતો મુતાજજુબ હુવા. ઓર ફોરન રાજા સિદ્ધરાજકો ખબર દેદી. કે એક શખ્સ મુસલમાન આએ હેં જીન્હોંને એસી બાતેં કી.

રાજા સિદ્ધરાજકો જબ યેહ ખબર હુઈ, તો જાનીપા જોગીઃ નામી રાજ-ગુરૂથા ઉસકો સાથમેં લેકર આ પહોંચા કયા દેખતા હય, કે તમામ મૂર્તિએં નાચ રહી હેં.

રાજા સિદ્ધરાજકો, આ ગયા દેખકર આપને ગણેશકી મૂર્તિકો નઝદીકકે તાલાબસે, વુઝુકે લીયે પાની ભરલાનેકો ફરમાયા. આપકે ફરમાન કે મુતાબિક ગણેશકી મૂર્તિ પાની ભરનેકો તાલાબ પર ગઇ. ઓર દેખતે દેખતેમેં પાની ભર કર આ ગઈ.

યેહ હાલ દેખકર સબકેસબ બડી ફિક્ર કરને લગે, કે અબ કયા કિયા જાય, ઓર ઇધરતો યકાયક મૂર્તિએં લોગોંકી તર્ફ મુખાતીબ હોકર કેહને લગીં, કે "અય ગફલતકી નિંદમેં આરામ કરનેવાલે લોગો, હર એક ઇન્શાનકો ચાહીએ કે એકહી અલ્લાહકીઇબાદત કરે, સબબ કે વોહી ઝાતે પાક, વહદહુલા શરીક, ઇબાદતકે લાયક હય."

realpatidar.com

https://archive.org/details/bk099/page/n21/mode/1up

realpatidar.com

યેહ હાલ અપની મૂર્તિઓંકા દેખકર રાજા સિદ્ધરાજ બહોત ગુસ્સેમેં આયા ઓર લાલપીલા હો ગયા. ઓર રાજગુરૂ જાનીપા જોગીસે કેહને લગા, કે તુમભી કુછ કરામાત દીખલાઓ, ઓર યેહ મર્દે મુસલમાનકો કાઈલ કરો.

અબ જાનીપા જોગીને અશા (દંડ) આસ્મનકી તર્ફ ફેંકા, ઓર હઝરતકો કેહને લગા, કે અગર આપમેં કરામત હય તો ઇસ દંડકો વાપિસ બુલાઓ. હઝરતને આપકી ખુડામ (પાવડી) કો ફરમાયા કે જાઓ, જોગીજીકા દંડ લા દો. ફરમાન હોતેહી વોહ ખુડામ આસ્માનકી તર્ફ રવાના હુઇ. ઓર જોગીજીકે દંડકો લાકર ઉન્કે સામને ફેંકા.

ફીરતો જાનીપા જોગીને અપને એક શાગીર્દકો બુલાયા, ઓર જાદુકે ઝોરસે ઉસકો એક સાંપનીંગલવાયા, ઓર સાપકો કહા, કે જહાંતક હમ હુકમ ન કરે વહાંતક બાહિર ન નિકલના. અબ હઝરત કો કેહને લગા કે, આપ ઇસ નીંગલેહુવે સાપકો બાહિર નીકાલો તાકે મેં આપકી કરામતકા કાઇલ બનું.

જો શાગીર્દને સાપ નીંગલાથા ઉસકે કરીબ જાકર હઝરતને કુછ કલામ કહે. વોહ સાપ ફોરન બાહિર નિકલ આયા. ઇસી તરાહ જોગીને જાદુકી બહોતસી બાતેં દીખાઈ. લેકિન ફતેયાબ ન હુવા.

. આખિરકાર રાજાને હિંદુ ધર્મ કે બડે બડે પંડિતોં કો ઓર ગુરૂઓંકો બુલવાએ. ઓર મઝહબી મામલેમેં ઉનકે સાથ બહેસ કરનેકો હઝરતકો કહા. ઉસ વક્ત જો તકરીર ચલીથી, ઓર સવાલો જવાબ હુવેથે વોહ તમામ આપકે નવ મુસ્લિમ મુરીદોંમે "યોગવાની" કે નામસે આજભી મવજુદ હય.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n22/mode/1up

realpatidar.com

આખિર તકરીરકા નતીજા યેહ હુવા, કે સબકેસબ ઇસ્લામકી સદાકત ઓર પાક ઉસુલોંસે કાઇલ હુવે. ઓર* સિદ્ધરાજ વગેરા સબકે સબ ઇસ્લામસે મુશર્રફ હુવે.

યેહ રાજા આમતોરપર જયસિંહકે નામસે મશહુર થા. મગર હઝરત-પીર સૈયદ મોહંમદ (રહ) કે હાથપર ઇસ્લામસે મુશર્રફ હોનેકે બાદ, હઝરત ને ઉસકો સિધ્ધ+રાજ સિદ્ધ યાની કામિલ ઓર રાજ યાની રાજા મીલાકર કામિલરાજા યું કહા, કયુંકે ઉસને, ઇસ્લામકી સચ્ચાઇ ઓર કરામાતેં દેખકર કમાલ પેદા કર લીયા. ગર્ઝ કે ઇસ્લામમેં આ ગયા. (કયા યેહ કુછ કમ બાત હય, કે સચ્ચાદીન નસીબ હો) જબસેહી યેહ રાજા સિદ્ધરાજ ઇસ્લામકો દીલોજાનસે ચાહતા થા, ઇસકી સુબુતીકે લીયે એક નમુના દરજ કરતા હું.

સિધ્ધરાજ કે ઇસ્લામલાનેકે બાદ, એક વકત શહેર ખંભાતમેં હિંદુ-ઓંને મુસલમાનોંકી મસ્જીદ શહીદ કર ડાલીથી. ઉસ વકત સિધ્ધરાજકા દોર થા. મસ્જીદ શહીદ કર દીગઇ; યેહ કેફીયત સિધ્ધરાજ કો માલુમ હોતેહી બઝરીયે અફસરોંકે ગુનાહગાર હિંદુઓં કો કેદ કર દીયે, ઓર દંડભી કીયા ઓર મસ્જીદકો અઝશરેનવ, અપની તર્ફસે તામીર કરાદીયા. યેહ ઇસ્લામ પસંદગીકે નમુનેકી દલીલ હય.

પટ્ટનમેં જબ રાજા સિધ્ધરાજ ઇસ્લામ લાયા તો ઓરભી બહોત લોગ ઇમાન લાએ. આપને તમામકી જનોઇએં ઉતાર લીં, ઓર એક અલ્લાહ ઓર રસુલ (સ. અ.) કી ઇતાઅત કરનેકી નશીહત ઓર સખ્ત તાકીદ કી ઓર આપ ધારાનગરી તશરીફ લે ગએ.

---

* જૈન લોગ માનતે હેં કે સિધ્ધરાજ જયસિંહ જૈન ધર્મ પાલતા થા. મુસલમાન ચંદ મુવર્રિખ માનતે હેં, કે ઈસલામ ઝુરૂર લાયા થા; બાદમેં મુલહિદ હો ગયા થા. કુછભી હો મગર હઝરતકી એસી ઝબરદસ્ત કરામાતેં દેખકર સિધ્ધ-રાજ કે ઈસ્લામલાનેમેં જરાભી શક નહીં રેહતા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n23/mode/1up

realpatidar.com

આપ ધારાનગરીં (નવસારીકે કરીબ ગાંવ હય,) તશરીફ લાએ. યહાં કે રાજા સુરચંદ્રકે યહાં એક લડકીથી, જીસ્કા નામ પાલન દેવી થા. ઓર જીસકે લીયે નજુમીઓંને પેશીનગોઇ કીથી. " કે યેહ લડકી તુમ્હારી નજાત કરાએગી. " રોઝબરોઝ યેહ લડકી બઢી હોતી ચલી.

યહાં તકકે ઉમર લાયકભી હો ગઇ. જબ રાજાને ઉસકી શાદીકા બિચાર કીયા. ઓર લડકીસેભી ગુફતગુકી લેકિન લડકીને જવાબ દીયા, કે મેરા ખાવિંદ ખુદ થોડેહી દિનોમેં યહાં આ જાયગા. લડકીકી યેહ કેફીયત સુનકર રાજાને ઉસકો એક ઇલાહેદા મકાન રેહનેકો દીયા ઓર ઉસીમેં રેહનેકો કહા.

અબ કુંવરી ઇલાહેદા મહેલમેં રેહને લગીં. ઓર ઉસને યેહ તરીક રખ્ખા થા, કે દરરોઝ સવાશેર હિરનકા ગોસ્ત મંગાકર ઉસકો પકાકર ઉસકે સુબમેં (સોરવેમેં) શિર્ફ એક ઉંગલી લગાકર લબકો લગાતી.

હઝરત જબ ધારાનગરીમેં તશરીફ લાએ ઓર શબો રોઝકે દસ્તુર કે મુઆફિક કલામેપાકકી તિલાવતમેં મશરૂફ હુવે, તબ જંગલ કે તમામ જાનવર કલામેપાક સુનનેકો જમે હુવે. આપકી યેહભી બહોત ઝબરદસ્ત કરામતથી. ઓર ખુશઇલહાન થે કે જબ આપ કલામેપાકકી તિલાવત કરતે થે, મએ પંરદોં કે તમામ જંગલ કે જાનવર જમે હોકર સુના કરતે થે, યહાંભી એસાહી મામલા હુવા.

ઇસદિન વોહ શિકારી, કે જો રાજા સુરચંદ્રકી કુંવરીકે લીયે હિરનકા ગોસ્ત લાતે થે, વોહ શિકારકે લીએગયે મગર કહીં હિરન દેખનેં મેં ન આએ હિરનોંકી તાલાસમેં ફિરતે ફીરાતે જહાં હઝરત તિલાવત કર રહે થે વહાં જા પહોંચે ઓર દેખને લગે કે એક બહોત બડે બુઝુર્ગીવાલે અવલીયા અલ્લાહ બેઠે કુછ પઢ રહે હેં. ઓર તમામ જંગલ કે જાનવર ઓર પરંદ જમે હોકર સુન રહે હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n24/mode/1up

realpatidar.com

હઝરત જબ કલામે પાકકી તિલાવતસે ફારિગ હુવે. તબ આપને શિકારીકી તર્ફ મુખાતિબ હોકર ફરમાયા. " કયા હિરનકા ગોસ્ત લેને આએ હો ? " યું ફરમાકર એક હિરનકી જાંઘ કાટકર દેદી. ઓર હિરન કે વોહ કટે હુવે પાઉંપર અપના હાથ ફેરા આપકે દસ્તે મુબારિક કે તુફેલ હિરનકા પાઉં અવ્વલસા હો ગયા.

શિકારી યેહ તમામ કેફીયત દેખકર ઓર હિરનકા ગોસ્ત લેકર કુંવરીકે પાસ આયે, ઓર તમામ મામલા કુંવરીસે બયાન કીયા. કુંવરીને ઉસકો પકાયા ઓર દસ્તુરકે મુઆફિક સોરવેમેં ઉંગલી લગાકર લબ પર લગાઇ, કે એકદમ અપને આપકો કરામાતોંસે ભરી હુઇ પાને લગીં. કુંવરીને અપને બાપ સુરચંદ્રસે તમામ કેફીયત કેહ સુનાઇ ઓર હઝરતકે સાથ ખુદકી શાદી કરદેનેકો કહા રાજા સુરચંદ્રને કહા, બેટા, અપને તો રાજપુત હેં, ઓર યેહ, કે જો તૂ કેહતી હય, મુસલમાન હેં. ભલાતૂ કહે ઇનકે સાથ મેં તેરી શાદી કેસે કર શક્તા હું. અપને રીસ્તેદાર કયા કહેંગે ? વગેરા બહોતસી નશીહતકી મગર તમામ બેશુદ, કુંવરીકે ખ્યાલ રોશન હો ગએ થે, જહાલત કે અંધેરેકી જગે રોશની હો ગઇથી, વોહ અબ કેસે સમઝ શકતી હય.

ઉસને કહા, જો કુછ હય સો યેહી હય. ઓર સિવાએ હઝરત કે ઓર કીસી કે સાથ મેં શાદી ન કરૂંગી ઓર અગર મેરી બાત ન માનોગે તો અંજામ બુરા હોગા. મુઝેતો મેરે લાયક મેરા ખાવિંદ યેહી નઝર આતા હય, ફીર આપકા જી ચાહે સો કરો.

રાજા સુરચંદ્રને ખ્યાલકિયા, કે લડકી નહીં સમઝેગી જીસસે આજીઝ હૂવા, ઓર કેહને લગા, બેટા તૂં ખાતિર જમા રખ મેં ઇસ મર્દે મુસલમાનકા ઇમ્તેહાન કરૂંગા અગર કામિલપાયા તો ઝુરૂર તેરી શાદી કરદુંગા. યેહ કેહકર જહાં હઝરત મુકીમથે વહાં ઇમ્તેહાનકી ગર્ઝસે રાજા સુરચંદ્ર ગયા ઓર આપકો નમનકીયા, આપને રાજા કે સરપર હાથ ફેરા જીસકે તુફેલસે, રાજાકે "કોડ" કી બીમારી જો બચપનહીસે થી અલ્લાહને આરામ કરદીયા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n25/mode/1up

realpatidar.com

જબ યેહ કરામત રાજાને દેખી તો બહોત ખુશ હોગયા. ઓર ગાંવમેંસે ડોલી મંગવાકર ઉસમેં બીઠાકર આપકો દરબારમેં લે ગયા, ઓર અપની નેક દુખ્તર પાલનદેવીકી શાદી આપકે સાથ બડી ધામધુમસે કરદી.

આપકી શાદીકે વક્ત, આપકી કરામતકે તુફેલ આપકે મુકામસે સાત-મીલ તકકે ગેબી રોશની નમુદ હુઇ (જહાં અભી ગનદેવી હય.) યંદુઇ મઆને રોશની કેહેં. લોગ બોલતેથે ચલો યંદુઇ દેખને. યંદુઇ ઉપરસે ગંદુઈ હુવા. ઓર ગંદુઇ ઉપરસે ગનદેવી હોગયા. જો અભીભી યેહી નામસેં મશહુર હય. ઓર **શ્રીમંત સરકાર સયાજીરાવ મહારાજા સાહબકી** રિસાયતમેં એક મહાલ ઓર કશ્બા ગીના જાતા હય.

શાદીકી ખુશાલીમેં લેગોંકે પાંની પીનેકે વાસ્તે દો તાલાબ મુકર્રર કીયે થે. ઓર એકમેં શરબત ભરાથા, ઓર દુસરેમેં દુધ જો આજભી સરબતીયા ઓર દુધીયા તાલાબકે નામસે નવસારીમેં મશહુર હેં. ઓર ઇસ બાતકી ગવાહી દે રહે હેં.

આપ શાદીકેલીયે નૌશા બનકર આયેથે વાસ્તે (નૌશા+આરાઇ=નૌશા આરાયસ્તન.) નવસારી× નામ પડા હય અભી નવસારીમેં આપકા મઝારશરીફ હય. યહાં એેક બહોત કામિલ સાધુ રેહતાથા. ઓર વોહ "યોગ-શાસ્ત્ર " મેં પુરા કામિલ થા, યેહ સબબસે ઉસકે બહોતસે ચેલે બને હુવેથે, વોહ હર પુનમકો ઉસકે પાસ નશીહત લેનેકો આતેથે. આપકો યેહ સાધુકી જગે બહોત પસંદ આઈ ઇસલીયે આપ સાધુકે પાસ ગએ ઓર ફરમાને લગે, કે યેહ જગે મુઝે પસંદ હય. ઓર હમેશાકે લીયે મેં યહાં રેહના ચાહતા હું. ઓર મેરે અલ્લાહપાકકાભી એસાહી હુકમ હય. યેહ કેફીયત સુનકર સાધુ કેહને લગા, કે મેં આપકા યેહ કેહના સચ કેસેમાનું. આપ અપની કરામત બતલાઇએ તાકે મે મેરી જગે આપકો સુપુર્દ કરનેકો ખુશ હોજાઉં.

× દેખો તવારીખે નવસારી.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n26/mode/1up

realpatidar.com

આપને સાધુસે કરારકીયા, કે અપને દોનોં તાલાબમેં ડુબકી મારેં, ઔર તીન દિનકે બાદ જો ઝીંદા રહે, ઔર બાહિર નીકલે વોહ યેહ જગેકા મુખ્તાર રહે. સાધુને યેહ બાત કુબુલકી. ઔર જુમાકે રોઝ દોનોંને તાલાબમેં ડુબકીએં મારીં. ડુબકી મારને કે બાદ, સાઠ કલાકતક સાધુ કે શંખકી સદા આતી રહી. ઔર હઝરત કે અઝાનકી સદા કામિલ બોતેર ઘંટે તક આતી રહી. આખિર તીસરે રોઝ સાધુ મરા હુવા પાનીસે નીકલા, ઔર આપ સહીસલામત પાની કે બાહિર આએ, ઔર બમુજબ કરાર કે યેહ ખુશનુમા જગે આપ અપને કબ્ઝેમેં લેકર મુકીમ હુવે.

પુનમકે રોઝ હમેશકે રિવાઝકે મુઆફિક સાધુકે દર્શનકો ઉસકે ચેલે આએ. ઔર અપને સાધુમહારાજકે એવઝ હઝરતકો દેખકર સવાલ કરને લગે.

ચેલોંને—હમારે ગુરૂમહારાજ કહાં હે ?

હઝરતને—ગુરૂમહારાજકા કયા કામ હય ?

ચેલોંને—વોહ હમારે ગુરૂ હેં. ઔર હમસબ ઉનકે ચેલે હેં, ઔર હમકો હરપુનમકો ઉપદેશ કરતે હેં ઇસલીયે હમ આએ હેં.

હઝરતને—જબ આજસે હમ ગુરૂબનકર ઉપદેશ કરેંગે.

ચેલોંને—ઇસતરાહ ? બગેર ચમત્કારકે હમ તુમકો ગુરૂ કીસતરાહ માને. કુછ ચમત્કાર બતલાઇએ.

હઝરતને—કહા, અચ્છા તુમ આજ ગુરૂસે કયા લેને યા પુછને આએથે ?

ચેલોંને—હમ સબ દ્વારિકાકી જાત્રાકો જાને વાલે હેં. ઇસલીયે રજા લેને આએ થે.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n27/mode/1up

realpatidar.com

હઝરતને—દ્વારિકા કો કીસલીયે જાના હોતા હય ?
ચેલોંને—દર્શન કરનેકે વાસ્તે જાતે હેં.
હઝરતને—હમ તુંમકો દ્વારિકાકે દર્શન યહીં કરાવેં તો કૈસા ?
ચેલોંને—જબતો હમ આપકો સચ્ચે ગુરૂ સમઝેં.
હઝરતને—તુમને દ્વારિકાકી જાત્રા અવ્વલ કભી કી હય ?
ચેલોંને—બહોતસી દફા જાત્રા કી હય.

આપને કુછ સવાલોજવાબકે બાદ બઝરીયે તસવ્વુફ કે, આપકે પેહ-રનકી આસ્તિનમેં દ્વારિકા દીખલાઈ સબકે સબને કનૈયાજીકી મૂર્તિ ઓર દ્વારિકાનગરીકો દેખા. જીસસે તમામકો યકીન હુવા ઓર આપપર ઇમાન લાકર બોલ ઉઠે. " લા ઇલાહા ઇલલલ્લાહો મોહંમદુ રંસુલુલ્લાહ. " ઓર ઇસ્લામસે મુશરંફ હોકર આપકે મુરીદ હુવે. યેહ મુરીદ લોગ આપકો " સત ગોર નૂર " કે નામસે પહેચાનતે થે.

આપને થોડે અરસેકે બાદ અરબસ્તાનમેં જાનેકા કસ્દ કીયા. ઓર યહાંસે તશરીફ લેગએ. લેકિન આપને મુરીદોંસે વસીયત કીથી, કે ફુલાને રોઝ મેરી લાશ જલાલપુરકી (નવસારીકે કરીબ કસ્બા હય.) નદીમેં આએગી. ઉસકો તુમ લે આના. ઓર યહાં લાકર મદફુન કરના.

બમુજબ આપકે ફરમાને કે આપકી લાશ જલાલપુરકી નદીમેં બત-લાએ હુવે વકતપર આગઈ જીસકો મુરીદ લોગ બડી તાઝીમકે સાથ લે આએ. ઓર જહાં અભી આપકા મઝારશરીફ હય, વહાં આપકો મદફુન કીયે. આપકે પાસ એક મેના ઓર એક પોપટ થા. જીસકો આપ નવસારી અપને મુકામપર રખકર અરબસ્તાન ગએ થે. જબ આપકી લાશ મુબારિક કો દેખાતો દોનોંને અપની જાનેં કુરબાન કરદીં. યેહ દોનોંકી કબરેંભી હઝરતકે દાએં બાએં અભીતક મવજુદ હેં.

realpatidar.com

realpatidar.com

આપકે વફાતકી તારીખકા પતા લફ્ઝે "લાયમુત" સે ચલતા હય. ઉસકે અરબી અબ્જદ કી ગીનતીસે હી. સ. ૪૮૭ નીકલતા હય. અભી હી. સ. ૧૩૫૨ ચલતા હય ઇસલીયે આપકી વફાતકો ૮૬૫ સાલકા ઝમાના હુવા.

આપકા ઉર્સ સવ્વાલ મહીનેકી તા. ૪–૫–૬ તક ભરતા હય, ઉસમેં દૂર દૂરસે બહોત લોગ આતે હેં. ખુદ નામદાર શ્રીમંત ગાયકવાડ મહારાજા સાહબકી તર્ફસેભી પાંચ બજે આપકી બુઝુર્ગી કેલિહાઝસે નવસારીકે સુબાસાહબ, વગેરા અમલદાર સાહબ હાથીકે ઉપર બેઠકર સવારીકે સાથ સલામીકો આતે હેં જીનકો હઝરતકે સજ્જાદાનશીનકી તર્ફસે ફુલપાનકી ઇઝ્ઝત દી જાતી હય. બાદમેં સવારી વાપિસ થાનેમેં જાતી હય.

શ્રીમંત સ્વર્ગવાસી મહારાજા ખંડેરાવ બહાદૂરકી તર્ફસે હઝરતકી ઇઝ્ઝત ઓર માન મરતબેકી ખાતિર દરસાલ સજ્જાદાનશીનકો ઉર્સકે વકત સેલા, ઓર રૂા. ૫૦) નકદ દીવાબત્તીકે ખર્ચકે લીયે દીયે જાતે હેં. ઇસી તરાહ **શ્રીમંત સ્વર્ગવાસી મહારાજા મલ્હારરાવ સાહબકી તર્ફસે** એક બેશ કીંમતજર્રીન ગિલાફ દેનેમેં આયા હય. ઇતનાહી નહીં બલ્કે શ્રીમંત ગાયકવાડ મહારાજાઓં મેંસે, હઝરતકે મરતબેકી ખાતિર બહોતસોંને પરવાને (હક્ક) દીયે હેં. જીસમેંસે દો પરવાનોંકી મતલબ દરજ કરનેમેં આતીહય.×

(મહોર)

શ્રીમંત સરકાર રાવશ્રી માનાજીરાવ ગાયકવાડ સેના ખાસખેલ શમશેર બહાદુર.

કસ્બે નવસારીકે પીરઝાદા સૈયદ હાસિમશાહ. દીગર કસ્બે મોસુફમેં પીર પેઢીકી તુમ્હારી ચલન હમેશાં જેસી હોવે, વેસી રખના. તુમકો કોઈ તરાહકી ગેર મુનાસિબ હરકતેં નહીં હોને પાએગી. સંવત ૧૮૪૬ માગશર વદ ૩

realpatidar.com

× દેખો તવારીખે પીર.

https://archive.org/details/bk099/page/n29/mode/1up

realpatidar.com

શ્રીમંત સરકાર રાવશ્રી શીઆજીરાવ ગાયકવાડ
સેનાખાસ ખેલ શમશેર બહાદુર
વિદ્યમાન રાજેશ્રી જીવાભાઈ દેશાઇભાઈ
સરસુબા પરાંત સુરત અઠ્ઠાવીસી

મહોર.

કસ્બે નવસારીકે સૈયદ બાપુ વલદે પેઆરામીયાં દીગર તુમને સરકારમેં આકર ઝાહિર કીયા હયકે, હમારે વાલીદ પેઆરામીયાંસે દરગાહ શરીફકા કારોબાર નહીં હોતા ઓર જમાઅત વાલે મુરીદ લોગ હમારે વાલીદસે રાઝી નહી, જીસસે હમારી આમદાનીમેં ફર્ક આતાહય. ઇસલીયે સરકાર મહેરબાન હોકર તુમકો દરગાહ શરીફકી ગદ્દીપર બીઠાતી હય, વાસ્તે તુમ ખાતિર જમે રખકર અપના કારોબાર બમુજબ ગુઝસ્તાકે કરતે રેહના, ઉસમે કોઈ ગેર મુનાસિબ હરકત કરેગા નહીં. સંવત ૧૮૮૭ કા માહ સુદ ૨ (ગુજરાતી ઉપરસે નકલ.)

પી ઝમાનેકે શ્રીમંત સરકાર ફરઝંદે ખાસ દવલતે ઇંગ્લીશીઆ મહારાજા સયાજીરાવ ગાયકવાડનેભી, અવ્વલકે મહારાજાઓંકે કદમ બકદમ ચલકર હઝરતકી દરગાહશરીફકે સજ્જાદાનશીન મીર પ્યારેસાહેબ ઇબ્ને મીર હાશિમશાહકો અપની રિયાસતમેં હથીયારબંદીકે કાનુનસે આઝાદી દીહય,

નામદાર બ્રીટીશ સરકારકી તર્ફસેભી જલાલપુર ઓર બારડોલી તાલુકોંકી બહોતસી ઝમીનેં દરગાહશરીફકી ચિરાગ બત્તીકે લીયે ઇનામી દેનેમેં

realpatidar.com

https://archive.org/details/bk099/page/n30/mode/1up

realpatidar.com

આઈ હેં. ઓર ઉર્સ શરીફકે વકત જલાલપુરકે બડે અમલદાર સલામીકો આતે હેં.

હઝરતકી એક બહોત બડી કરામત યેહભીથી કે જબ આપકે મઝારસે મોહર્રમમેં તાઝીયા (જરી) નીકલતાથા ઓર મલેશરમેંસે " કે જો હિસ્સેમેં પારસીઓંકા આદરીયાનથા, " ગુઝરતાથા. યકાયક તમામ આતિશ ઠંડી × હો જાતીથી, યેહ સબબસે પારસી અકાબરોંને અપની મુશ્કીલ સરકારમેં પેશકીથી. જીસસે સંવત ૧૯૧૭ મેં સુવર્ગબાસી મહારાજા ખંડેરાવ સાહબને કાયમી ઠરાવ કરકે, તાઝીયાકે લીયે જો કદીમી રાંસ્તા જારીથા, વોહી કાયમ રખ્ખા ઓર પારસીઓંકા દાવા રદ્દ કીયા.

યેહ બાતકો પુરે ચાર સાલ ગુઝરનેકે બાદ પારસીઓંકી તર્ફસે શેઠ સોરાબજી જમશેદજી બાટલીવાલાને સંવત ૧૯૨૧ ઓર ૧૯૨૨ મેં સૈયદ બાપુમીયાં સાહબકો, કે જો હઝરતકી દરગાહશરીફકે સજાદાનશીનથે, અર્ઝકી. કે આપકી દરગાહશરીફકા તાઝીયા મલેશરકે રાસ્તે સે યાની હમારે આદરયાનસે ગુઝરતા હય, જીસકે સબબ હમારી આતિશ ઠંડી હો જાતા હય, ઇસ લીયે આપ અગર ઇસ રાસ્તેકો બદલકર ઓર રાસ્તેપર તાઝીચા લે જાઓ તો, જહાંતક બાટલીવાલેકા નામ રહેગા વહાંતક હઝ-રતકી ચિરાગબત્તીકે લીયે સાલાના દો હઝાર રુપીએ દીંયે જાઇગે. મગર યેહ બાતકા સૈયદ બાપુમીયાં સાહેબને ઇન્કાર કરદીયા. ઓર જો કદીમી રાસ્તાથા જારી રખ્ખા. યેહી વજાહથી કે આખિર પારસીઓંને અપની આદરીયાનકો ઓર જગે બદલ દીયા.

× દેખો તવારીખે પીર.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n31/mode/1up

realpatidar.com

હઝરતકે મઝારકે સજ્જાદાનશીન અભી મીર સૈયદ પ્યારેસાહેબ હેં આપકે વક્ત મેં બહોતસી આબાદી હુઇ હય. એક મુરીદને રૂા. ૪૦૦૦ ચાર હઝાર શરફ કરકે દરગાહ શરીફકે ચાંદીકે દરવજ્જે બનાએ હેં. ઓર ભીમપુર ગાંવકે એદ મુરીદને રૂા. ૨૦૦૦ દોહઝાર કે ખર્ચસે એક દિવાન-ખાના બનાયા હય. ઓર એક મુરીદને રૂાં. ૬૦૦૦ છે હઝાર ખર્ચકર એક મસ્જીદ ઓર મુસાફરખાના બનાયા હય, ઓર મહુર્મ સજ્જાદાનશીન સૈયદ હાશિમશાહકે વક્તમેં છોટીસી ઝમીનલેકર એક છોટાસા બગીચા બનાયા ગયા હય. જીસમેંસે શબોરોઝ તાઝે ફુલ મીલા કરતે હેં જો હઝરતકે મઝાર-શરીફપર ચઢાએ જાતે હેં.

હઝરતને બહોતસી કિતાબેં લીખ્ખી હેં, ઓર વોહ તમામ સુફીયાના તરીકકી હેં, ઓર હરેક કામ કામકો ઇત્તેફાકકી રગબત દીલાતી હેં, આપકી તમામ કિતાબોંમેં ઇખ્લાસ, ઇત્તેફાક, ઓર હરેક વર્કમેં અલ્લાહ ઓર ઉસકે પ્યારે હબીબ હઝરત મોહંમદ મુસ્તુફા (સ. અ.) કી તારીફ બયાન હય, ઓર હુઝુરપુરનૂર (સ. અ.) કી પેરવીકી સખ્ત તાકીદ હય. અગર અયસી કીતાબોં કે મંઝીલેમકસુદકો મદ્દેનઝર રખકર કોશીષો નશીહતકી જાય, તો મુઝે ઉમ્મીદ હય કે ફીઝમાનેમેં હિંદુ–મુસલમાન લીડર લોગ ઇત્તેફાકકી ઝબર-દસ્ત કોશીષેં કરનેપરભી આખિર હેરાનો પરેશાન હેં, યેહ બાત ટલજાએ. ઓર ઇસ્લામકી સદાકતો સફક્કતકી શીરીનીકા મઝા ઓર લીઝ્ઝતકા વોહ અસર દિખાઇ દેને લગજાએ, કે તમામ કોમ, સચ્ચેદીન ઇસ્લામકો હસરત-ભરી નિગાહોંસે દેખતી રહેં. મગર અફસોસતો ઇસ બાતકા હય, કે હમ ઓરોંકી એબજુઇમેંહી મસ્ત રહેં, યહાંતક કે ફુલાને હઝરત ઇસતરાહસે ફુલાને ઇસતરાહસે, ઓર ગોયા હમતો સફફાફ બર્ફકી મિસાલ પાકો સાફ મુત્તકી ઓર પરહેઝગાર એસા બતાના ચાહતે હેં. મગર હમેં યાદ રહે કે,

realpatidar.com

https://archive.org/details/bk099/page/n32/mode/1up

realpatidar.com

કરો ગેરકીગર મુઅઝ્મતકો પેહલે,
ઉઠા આઇના અપની સુરતતો દેખો;
ન કરો અબતુમ એબ જુઇ કીસીકી,
જરા અપની નાગુફ્તા હાલત તો દેખો:

હાસિલ કલામ યેહ કે, યેહ ઝમાના એસા નહીં કે સામઇન બે પાએ વ બે પરકી તોપોંકે આવાઝ સે હમકો મહેરબાનો મુરબ્બી સમઝ લેવે. બલકે વોહ અચ્છી તરાહસે સમઝ સકતે હેં કે મીયાં " ફેંક છાપ " કે ઇમ્તેહાનમેં અવ્વલ નંબર મીલાનેમેં ઝુરૂર કામયાબી હાસિલ કર શકતે હેં.

યેહ વકતમેં ચાહીએ કે ઇધર ઉધરકી બાંતેં બનાના છોડકર ખુદ ઓરાં કે લીયે નશીહત કે નમુના બન જાએં.

હઝરત પીર નુરૂદીન (રે. અ.) કી અવલાદ કે તમામ પીરોંને ઇખ્લાસો મોહબ્બતસે પેશ આકર, અલ્લાહ ઓર ઉસકે પ્યારે હબીબ (સ. અ.) કી ઇતાઅત કરને કો સમઝાયા હય, ઓર ઇશાઅતે ઇસ્લામમેં કામયાબી હાસિલ કી હય. આપકા મઝારશરીફ નવસારીમેં ઝયારતગાહ હય. હુનુઝ મઝારસે ફેઝ જારી હય બચ્ચોંકે કાનકા દર્દ, ઓર મસાકા દર્દ આપકી ન્યાઝકા ઇકરાર કરકે વસીલા લેનેસે અલ્લાહપાક તમામ દફા કર દેતા હય. દરીયામેં જહાઝોંપર આફત આને કે વકત અતરાફ કે માહી આપકી ન્યાઝો નઝર કરતે હેં ઓર હઝરત કે તુફેલ ખુલાસી પાતે હેં. આપકી યે તીનોં કરામતેં અવામમે મશહુર હેં.

હઝરત કે હાલાતે મુખ્તેસર નઝમમેં ભી હેં જો હસ્બે ઝેલ હેં

realpatidar.com

https://archive.org/details/bk099/page/n33/mode/1up

realpatidar.com

પીર રોશન ઝમીર સૈયદુસ્સાદાત

હઝરત નૂરમોહમંદ (નૂરસતગોર) (રેહ) કે હાલાત.

હમ્દ કે લાયક વોહી હય ખાલિકે કોનો મકાં;
જીસને લફ્ઝે કુનસે પેદા કર દીયે દોનો જહાં—૧
સારી દુનિયા ફિલ હકીકત હય ઉસી ખાલિકકા નૂર;
હય વોહી મખલૂક જો પેદા હુઇ પાયા ઝુહુર—૨
અવ્વલુલ મખલૂક હય મખલૂકમેં નૂરે ખુદા;
નામ આખિર કો મોહંમદ રખકર ઝાહિર હુવા.—૩
જો હય માસુકે ખુદા ઔર જો હય મેહબુબે વુદુદ:
નામ જબ સુનલો અંગુઠે ચુમકે પઢલો દુરૂદ.—૪
અબ યહાં લીખતા હું કુછ અવસાફ નુરૂદીન કે,
સૈયદુસ્સાદાત જો હેં, ઔર વલી હેં દીનકે.—૫
શાહેર પટ્ટનમેં થા જબ સિદ્ધારાજકા દવરે ઝમાં
ઉસ ઝમાનેમેં યેહ અરબસ્તાનસે આએ યહાં.—૬
ઔર ઇમામે જા.અફરે સાદિકકે યેહ ફરઝંદ હેં
ફિલ હકીકત બસ ઉસી કમલીકે યેહ પયવંદ હેં—૭
આપકો ઇલ્મે હકાઇક પર થા એક હદતક ઉબૂર.
આપને મખલૂકકો દિખલાદીયા ખાલિકકા નૂર.—૮
આપકા સતગોર ઔર નૂરમોહંમદ નામ હય.
આપકા ઇસ્લામકી રવનક બઢાના કામ હય.—૯
થા ખુદાને આપકો બખ્શા વલાયતકા શરફ
સાથહી ઉસ્કે દિયા અપની હકીકતકા શરફ.—૧૦

realpatidar.com

https://archive.org/details/bk099/page/n34/mode/1up

realpatidar.com

જબ ગએ પટ્ટનકે મંદરમેં, તો પૂજારીને કહા,
તુમ ન અંદર આવ, યે હય આસ્તાના દેવકા.—૧૧
તુમ બુતોંકે માનને વાલે નહીં બે બાક હો
આય ગર મુસ્લિમ જો મંદરમેં, અભી નાપાક હો.—૧૨
જબ ફરમાયા હઝરતને ઉનસે, અપને દેવોંસે કહેં
તાકે વોહ અલફાઝ બોલેં, નાચે, કૂદેં, ખૂશ રહેં.—૧૩
સૈયદુસ્સાદાતને અલફાઝ જીસદમ યેહ કહે
દેવ મંદરમેં લગે સબ નાચને ઔર કુદને.—૧૪
યેહ ખબર સિદ્ધરાજકો જાકર પુજારીને કહી
નાચતે હેં દેવ સબ મંદરમેં દેખો તો સહી.—૧૫
આ ગયા સિદ્ધરાજ રાજા, જોગી જાનીપા કોલે.
જબ યહાં- મંદરમેં દેખા, દેવથે સબ નાચતે—૧૬
આપને એક દેવકો યે હુકમ ફરમાયા કે જા
દોડકર મેરે વુઝુ કે વાસ્તે પાની તું લા—૧૭
આ ગયા વોહ દેવ પાની ભરકે જબ તાલાબસે
આપને ઉસજા વુઝુ ફરમાયા ફિર ઉસ આબસે.—૧૮
દૂસરેકે સરપે યેહ રાજાને ઝિમ્મા ધરદીયા.
જોગી જાનીપાકો હઝરતકે મુકાબીલ કરદીયા—૧૯
જોગી જાનીપાને એક ડંડા હવા મેં ફેંકકર
યે કહા હઝરતસે બુલવાલો જો તાકાત હો અગર—૨૦
સૈયદુસ્સાદાતને સુનકર ખડામોંસે કહા
જલ્દ લે આઓ હવામેં જાકે જોગીકા અસા—૨૧
હો કે ગાઇબ વોહ ખડામેં લે કે ડંડા આગઈ
લીજીયે જોગીજી યેહ ડંડા, વોહ યૂં કેહને લગી—૨૨

realpatidar.com

https://archive.org/details/bk099/page/n35/mode/1up

realpatidar.com

ફિર દિખાયા પીરકો જોગાન ...દકર અસર.
તાકે કાઇલ પીર હોં ઔર રાજા ખુશ હો સરબસર.—૨૩
યાની એક શાગિર્દકો એક સાંપ નિગલાકર કહા
ઇસકો બાહિર લાઇએ દેખેં કરિશ્મા આપકા.—૨૪
આપને મારે સિયાહસે યેહ કહા બાહિર નિકલ.
બસ વહીં વોહ સાંપ નિકલા મુંહસે ઉસકે સરકે બલ.—૨૫
હોગયે જોગી વ રાજા દોનોં કાઇલ આપકે
દોનોં આખિર ઉમ્રતક ઇસ્તઆમકે આશિક રહે—૨૬
શાહેર ધારાગીરીમેં રાજા સૂરચંદ્ર મામૂરથા.
ખાનદાની ઔર દિલેરીમેં બહોત મશહુરથા.—૨૭
ઉસકી ઓરતકો હમલ થા ઉસસે એક લડકી હુઇ.
નામ પાલન દેવી રખ્ખા ઔર ખુશી હોને લગી.—૨૮
પંડિતોને કેહદીયાથા યેહ કુમારી ખુશચલન
આપકા તારન કરેગી ઉસકા જબ હોગા લગન—૨૯
ફઝલે હકસે જબ જવાની પર યેહ લડકી આ ગઇ
ખાસ મંગવાકર હિરનકા ગોસ્ત વોહ ખાને લગી.—૩૦
થે વઝીરે સેંકડો અફસર શિકારી કે લીએ
વોહ હિરનકા ગોશત લાતેથે કુમારી કે લીએ.—૩૧
સૈયદુસ્સાદાતકી અબ યેહ કરામત દેખીએ
શાહેર પટ્ટનસે વોહ નવસારી કે બનમેં આગએ.—૩૨
આપ પઢતે થે કલામુલ્લાહ ખુશ ઇલહાન થે.
જાનવર જંગલીભી સુના કરતે થે ઉંસકો ધ્યાનસે.—૩૩
અલગર્ઝ એક દિન કલામે પાક યેહ પઢને લગે.
જાનવર સુનનેકો જંગલ કે ઇકટ્ઠે હો ગએ.—૩૪

realpatidar.com

https://archive.org/details/bk099/page/n36/mode/1up

realpatidar.com

ઔર શિકારી ઉસતર્ફ નિકલે થે જો થે હોશિયાર
વોહ હિરન જંગલમેં પાતેહી ન થે બેહરે શિકાર—૩૫
ફિરતે ફિરતે ઉસ જગે જબ વોહ શિકારી આગયે.
બજદ ઉનકો આગયા કુરઆનકો સુનતે રહે—૩૬
શૌકસે અલ્લાહકા ફરમાન સુનીએ આઇયે,
પાવગો, કયા હિરનકા ગોશ્ત તુમકો ચાહીયે ?—૩૭
સબ હિરન સુનતે હેં, સુનતે હેં કુરઆં યેહ શિકારી દેખકે
ઉસ જગે સબ ચકબચક હયરાનો શશદર હોગએ.—૩૮
આપસે બોલે શિકારી રાજકુંવરીકે લીયે.
બસ હિરનકા ગોશ્ત હમકો સવાશેર પુરા ચાહીએ.—૩૯
આપને પકડા હિરનકો ગોશ્ત કાટા ઔર દિયા
વોહ હિરન અચ્છા હુવા જબ પઢકે ઉસપર દમ કીયા—૪૦
ગોશ્ત લેકર આગએ જીસદમ કુમારીકે કરીબ.
ખાતેહી ઉસ ગોશ્ત કો ખુલ જાતે હેં ઉસકે નસીબ.—૪૧
બિગાડ જો દિલપર સિયાહકારીથા વોહ ધુલગયા.
ગોશ્ત કે ખાતેહી સબ રાઝે હકીકત ખુલ ગયા—૪૨.
વોહ કુમારીને જાકર અપને બાપસે યું કહા
મેરી શાદી કરદો ઉસસે, જીસને મુઝકો રંગ દીયા.—૪૩
બાપ બોલા વોહ મુસલમાન ઔર હમ હિંદુ બરન
હો નહીં સકતા હય અય બેટી, તેરા ઉસસે લગન.—૪૪
બાપતો ઉસકો ઇસી હટ પર " નહીં " કેહતા રહા
કરકે કુંવરીને ઝિદ આખિર બાપકો સમઝા લિયા.—૪૫
ઇન્તીહાં લેનેકો ફીર ખુદ સૈયદુસ્સાદાતકા
રાજગાદીસે વોહ રાજા, આપકી જાનીબ ચલા.—૪૬

realpatidar.com

https://archive.org/details/bk099/page/n37/mode/1up

realpatidar.com

જીસ ઘડી રાજા વલી અલ્લાહસે આકર મીલા
કોડ જો બચપનસે ઉસકો થા વોહ અચ્છા હોગયા.—૪૭
ખુશ હુવા રાજા કિયા ફિર ઉનસે લડકીકા લગન
ઉનકી શાદીસે યેહ નવસારી હુવા રશ્કે ચમન.—૪૮
શીરકે ઉપર ખુદાકા ફઝલ થા યેહ કુદરતી
રોશની કયા આપકી શાદીમેં કોસોંતક હુઈ—૪૯
યેહ બરાતી કે લીયે અસબાબ આશાઇશ કીયે
દૂધ ઔર સરબતસે વોહ તાલાબ હકને ભરદીયે.—૫૦
દોનોં અબતકભી શહેર નવસારીમેં વોહ મવજુદ હૈં
જો અભીતકભી રિફાએ આમકે મકસૂદ હૈં.—૫૧
મરકદે અનવર હય જીસજા આપકા અયએ રિયા
થી હકીકતમેં યેહ પેહલે એક મહાજોગી કી જા.—૫૨
જબ ગએ હઝરત વહાં યેહ લફ્ઝ સાધુસે કહે
યેહ જગે મુઝકો હમેશા કે લીયે રેહને કો દે.—૫૩
યે કહા જોગીને શકિત આપકી બતલાઇએ
ફીર જગે હય આપકી રહેનેકી ખાતિર આઇએ.—૫૪.
સુનકે હઝરતને કહા જો તું કહે તૈયાર હું
કયું હટું મેં નામ લેવા હયદરે કર્રાર હું.—૫૫
તીન દિનતક હમ રહેં પાનીમેં ચલીએ આઇએ.
આપ સચ્ચે હો તો યેહ શકિત હમેં દિખલાઇએ.—૫૬
આપ ઔર જોગી ચલે પાનીકી તેહતક અય અઝીઝ
આપકો હઝરતકી કરામતકા અભી હોગા તમીઝ.—૫૭
સાઠ ઘંટેતક રહી જોગી કે શંખકી સદા.
બે તકલ્લુફ શંખ પાની પર સદા બજતા રહા.—૫૮

realpatidar.com

https://archive.org/details/bk099/page/n38/mode/1up

realpatidar.com

આપકી આઈ બહત્તર ઘંટે આવાઝે અંઝાં
થાનાકે ઉપર સુના કરતે થે સબ પીરો જવાં.—૫૯
તીન દિનકે બાદ જોગી મરકે નિકલા આબસે
ઔર ઝિંદા આપ નિકલે બસ ઉસી ગિરદાબસે.—૬૦
ફીર ઉસી જા સૈયદુસ્સાદાતને ડેરા કીયા
ઔર મુરીદોંકો યહાંસે ફૈઝે હક બટતા રહા—૬૧
સૈયદુસ્સાદાતકી તારીખ યેહ મનઝુમ હય
જીનકે નામે પાકકી હિંદુસ્તાંમેં ધુમ હય.—૬૨
હૈં જો સદરૂદીનો, સજ્જાદનશીં પ્યારે મીયાં.
દોનાં ફખ્રેકૌમ હૈં ઔર દોનો ફખ્રે ખાનદાં.—૬૩
યેહ દુઆ હય નાચીઝ કી તા અબદ યે શાહે નૌશારી રહે.
ઔર કુલજમ ફૈઝ ઇસ મકાકાં હશ્રતક જારી રહે.—૬૪

હઝરત મૌલાના શમ્સ તબ્રેઝી (રેહ)

આપકી વિલાદત તા. ૧૭ માહે રજબ હી. સ. ૫૬૦ મેં ગીજની ઈલાકે કે સબ્જવાર નામી કસ્બેમેં હુઈથી આપકા ઇષ્મશરીફ હઝરત શમ્સ થા. શમ્સ યાની પરંદા આપ પરંદકી તરાહ અભી યેહ મુલ્કમેં થોડીહી દેરમેં ઔર મુલ્કમેં સફર કીયા કરતે થે. ઔર કભી કભી તો નઝરોંસે ગાઇબ હો જાતે થે. યેહી વજાહ હય કે આપકા ઇષ્મશરીફ શમ્સ થા.

આપ હી. સ. ૫૭૪ મેં સબ્જવારસે મુલતાનમેં તશરીફ લાએ, ઔર મુલતાન, પંજાબ વગેરામેં બહોતસી નામવરી હાસિલકી ઔર અપની ઝબરદસ્ત કરામાતોંસે ૭૫૦૦૦ પંચોતેર હઝાર આદમીઓંકો ઇસ્લામસે મુશર્રફ કરકે મુરીદ બનાએ.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n39/mode/1up

realpatidar.com

હઝરત મૌલાના શમ્સ તબ્રેઝી (રેહ.) એક રોઝ દરીયાપર સેરકરનેકે ગએ. ઓર આપને એક કાગઝકા હોડી બનાઈ. જીસકો દરીયામેં રખકર ખુદ બેઠ ગએ ઓર સેર કરને લગે. દરીયા કિનારે હઝરત શેખ બહાઉલહક (રેહ.) કા મકાન થા. ઉન્હોંને અપને મકાનકે ઝરૂખેમેંસે દેખા કે, એક કાગઝકી હોડીમેં બેઠ કર કોઈ સાહબે કરામત સેર કર રહે હેં યેહ દેખકર બહોત મુતાજ્જુબ હુવે. ઓર ખ્યાલ કરને લગે કે યેહ અલ્લાહવાલા કૌન હય કે જો ઈસતરાહ સેર કર રહા હય.

હઝરત બહાઉલહક (રેહ.) ભી બહોત બડે બુઝુર્ગ થે. ઉન્હોંને અપની તેઝ નઝર હોડીપર ડાલી. હોડીપર નઝર પડતેહી વોહ ડુબને લગી. ઉધર હઝરત શમ્સ (રેહ.) ને અપની હોડીકી યેહ કેફીયત દેખકર રૂખ મુબારક ઉંચા કીયાતો હઝરત બહાઉલહક કો ઝરૂખેમેં પાએ. આંખે દોચાર હોતેહી ફોરન હઝરત બહાઉલહકકે શરમેં દો શીંગ* નીકલ આએ. જીસસે ઉનકા સર ઝરૂખેસે બાહિર રહા અંદર ન આ સકા.

હઝરત બહાઉલહકને જબ અપની યેહ હાલત દેખી તો બહોત ગભરાયે ઓર સમઝ ગએ કે મેંને એક ઝબરદરત વલીઅલ્લાહકી હોડી ડુબાનેકા કસ્દ કીયાથા યેહ ઠીક નથા. બલ્કે લાઝીમ થાકે ઉનકો અપના રફીક બના લેતા ઓર પહેછાન કર લેતા, અબતો કીયેહુવે ગુનાહસે માફી માંગકર ખુશનુદી હાંસિલ કરના યેહી ઠીક હય, હઝરત શમ્સ (રેહ) દરીયાકી સેર કરચુકે ઓર શહેરકી એક મસ્જીદમેં જાકર ઠેહરે. થોડેહી, અરસેમેં હઝરત બહાઉલહક કે ભેજે હુવે ઉનકે દોનો ફરઝંદ હઝરત શમ્સ (રેહ.) કે પાસ મસ્જીદમેં આએ. ઓર આદાબ બજાકર ખડે રહે. આપને ફરમાયા તુમ્હારા ઈષ્મ શરીફ કયા હય? ઓર કયું આના હુવા? લડકેને જવાબ દીયા

* દેખો તવારીખે પીર

realpatidar.com

https://archive.org/details/bk099/page/n40/mode/1up

realpatidar.com

મેરા નામ શેખદીન હય ઓર યેહ મેરે ભાઇ હેં ઇનકા નામ ફખરૂદ્દીન હય. ઓર હમ દોનો ઇસી ગર્ઝસે આએ હેં કે, " હમારે વાલિદ બહાઉલહક હેં ઉનકે સરમેં દોશીંગ નીકલ આએ હેં ઓર ઉનકા સર ઝરૂખેકી બાહિર હય. શીંગકે સબબસે અંદર નહીં આ સકતા. " આપ દુવાએ ખેર કરો તાકે હમારે વાલિદકે સરમેં નીકલે હુવે શીંગ સમાજાએ.

હઝરત શમ્સ (રેહ.) ને ફરમાયાકે ઇસમેં હમારા કસુર નહીં હય, હમ દરીયામે સેર કર રહેથે, ઉસ વકત તુમારે વાલિદને હમારી હોડી ડુબા દેનેકા કસ્દ કીયાથા. ઓર વોહ કુછ ડુબનેભી લગીથી, યેહી સબબ હય કે ઉનકો શીંગ નીકલ આએ હેં. મગર તુમ મેરે પાસ આએહો, ઓર તુમારે વાલિદભી અપની ખતા કબુલ કરતે હેં તો જાવ ઇન્શા અલ્લાહ તુમ અપને વાલિદ કે શીંગ સમાએ હુવે દેખોગે. મગર મેરી યેહ નિશાની તુમ લોગોકી પુશ્તદર પુશ્ત કાયમ રહેગી.

હઝરતકી ઇજાઝત લેકર દોનોં સાહબઝાદે અપને મકાન પર ગએ તો કયા દેખતે હેં કે વાલિદ સાહબકે શીંગ સમા ગએ હેં મગર નિશાનીએં મવજુદ હેં.

આપકો મુલતાનમેં ચંદમુદ્દત હોને પરતો હઝરત બહાઉલ હકકો હસદ પેદા હુવા. ઓર ઉન્હોંને આપકે પાસ એક કટોરા દુધસે ભરા હુવા ભેજા. યેહ રાઝકી બાતથીં, આપને ઉસમેં ગુલાબકા ફુલ રખદીયા.

આપકે પાસ એક અમીરકા લડકા આતા જાતાથા. ઉસકે ઉપર આપકો બહોત મોહબ્બતથી, વોહ લડકા મર ગયા. ઓર ઉસકે તમામ રીસ્તેદાર પરેશાનો ગમગીન હુવે અમીરને મુલતાન કે તમામ પીરોંકો સિવાએ શમ્સ-તબ્રેઝી (રેહ) કે જમે કીયા* ઓર અર્ઝકી કે યેહ લડકે કો ઝિંદા કરો કયું કે આપ સબકે સબ વલી અલ્લાહ હો. મગર યેહ ઝબરદસ્ત કામ કીસીસે ન હુવા. આખિર વોહ અમીર લડકેકો લેકર હઝરત શમ્સ (રેહ). કી

realpatidar.com

* (દેખો ખોજાવૃત્તાંત)

https://archive.org/details/bk099/page/n41/mode/1up

realpatidar.com

ખિદમતમેં હાઝિર હુવા. ઓર અર્ઝકી કે આપ ઇસ લડકેકો ઝીંદા કરો આપને લડકેકી લાશકો હુકમ કીયાકે, " ઉઠ અલ્લાહકે હુકમસે " મગર લડકા ન ઉઠા. આખિર ફરમાયા. " ઉઠ મેરે હુકમસે " ઉસી વકત લડકા કલેમા તૈયબ પઢતા હુવા ઉઠ બેઠા.

આપકી યેહ કરામતકા આમ ચર્ચા હો ગયા ઓર મુલતાનકે તમામ લોગ બહોત તઆજ્જુબ હુવે. ઓર ઉધર પીરોંકો આપકા હસદ બઢતા ગયા, ઉન્હોંને યેહ રાય ઠેહરાઇકે પીર શમ્સને જો કામ કીયા હય વોહ ખિલાફે શરીઅત હય. વાસ્તે ઇનકો સઝાદી જાય. સઝા યેહ ઠેહરી કે આપ કે જીસ્મ મુબારિકકી પોશ્ત (ચમડી) ખેંચી જાય. આપને ફરમાયા અગર શરીઅતકા મેં ગુનાહગાર હું તો આપલોગ જો સઝા દો મુઝે મંઝુર હય. ફીર આપને પાઉંકે અંગુઠેકી જગેકી ચમડીકો પકડકર તમામ ચમડી ઉતારદી. ઇસપરભી પીરોંકા હસદ કમ નહુવા. ઓર આપકે લીયે યહાંતક ઇન્તેઝામ કરાદીયા, કે શહેરમેસે આપકો કોઇ શય તકભી નદે.

એક રોઝકા ઝિક્ર હય કે આપકો ભૂખકા ગલબા હુવા, શહેરમેંસે કુછ ખાના મીલ જાએ. ઇસી ગર્ઝસે આપને દરબદર ગસ્ત લગાએ. મગર કોઇને કુછ ન દીયા. આખિર એક કસ્સાબને આપકો સવાશેર ગોશ્તકા ટુકડા દીયા. વોહ ટુકડા લેકર ફીર આપ આગકી તલાસ કરને લગે. મગર વોહભી કહાંસે મીલે. કયુંકે આપકો કોઇ શય ન દેનેકા ઇન્તેઝામ હો ચુકાથા. આગકી તલાસ કરને પરભી જબ ન મીલી તો આખિર આપને આસ્માનકી તર્ફ દેખા, ઓર સૂરજકો ફરમાયા, " આ જા તૂહી ઇસ ગોશ્તકે ટુકડે કો ભુંજદે કયુંકે તૂ શમ્સ હય, ઓર મેં ભીતો શમ્સ હું " (અરબી ઝબાનમેં શમ્સ સૂરજકો કેહતે હેં.) આપકે યેહ કલામ ખતમભી ન હોને પર તો સૂરજ નીચે ઉતર આયા, ઓર હઝરત શમ્સને બઝરીયે બલ્લમ કે ઉસ ગોશ્તકે ટુકડેકો ભુંજ લીયા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n42/mode/1up

realpatidar.com

સૂરજ નીચે આનેકે સબબ બહોત સખ્ત ગરમી માલુમ હોને લગી. ઔર ગરમીકે સબબ મુલતાનકે લોગ તલમલાને લગે. આખિર લોગોંને આપકે પાસ આકર અપની ખતાકી માફી ચાહી. ઔર અપને કીયે પર પસ્તાને લગે. હઝરત શમ્સ (રેહ) કો રહેમ આ ગયા. ઔર આપને સૂરજકો રૂખસત દે દી, યેહી સબબ હય કે અભીભી ઔર શહેરોંકે મુકાબલે મેં મુલતાન શરીફમેં ગરમી કુછ ઝયાદા માલુમ હોતી હય, ઔર યેહ કેફીયત લોગોં મેં અવામતોરપર સુનનેમેં આતી હય.

મુલતાન શરીફમેં જબ લોગોંને આપકી યેહ કરામત દેખીતો બહોત લોગ આપકે મુરીદ હુવે. આપકા હિદાયતકા તરીકા સૂફીયાનાથા. જો આપકે ચંદ અશઆર દેખનેસે માલુમ હો સકતા હય.

*અશઆર.

ચે તદબીરે મુસલમાના કે મન ખુદરા નમી દાનમ
ન તરસાઓ ન યહુદીયમ. ન ગબરમ ન મુસલમાનમ
ન શરકીયમ ન ગરબીયમ ન બારીયમ ન બરરીયમ.
ન અઝ મુલ્કે એરાકીયમ ન અઝ ખાકે ખોરશાનમ.
ન અઝ ખાકમ ન અઝઆબમ ન અઝ બાદમ.
ન અઝ આતશ ન અઝહવા ન અઝઆદમ
ન અઝ ફિરદૌસે રિઘવાનમ મકાનમ લામકાંબાસદ.
નિશાનમ બે નિશાં બાશદ નતનબાસદ નઝાંબાસદ.
ન બાસદ ઇરકે જાનાનમ, હુવલ અવ્વલ હુવલ આખિર
હુવલ ઝાહિર હુવલ બાતિન બિ ઉઝ વયા મનહુ

*દેખો ખોજાવૃત્તાંત.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n43/mode/1up

realpatidar.com

દીગર ચીઝી નમીંદાનમ દૂઇ રાચુ બદર કરદમ
યકી દીદમ દો આલમરા યકીબીનમ યંકી જુયમ.,
યકી ખાનમ યકી દાનમ અલા યા શમ્સતબરેઝે
ચિરા મસ્તી દરીં આલમ બજુઝ યાહુ વયામનહુ.
વમદ હોશી ન બાસદ હેચ સામા નમ.

(બમિસ્દાક આયતકે, " કુલ્લોમન અલયહાફાન, વજહો રબ્બેકા જલ જલાલે વલ ઈકરામ.)

હાસિલ કલામ યેહ હયકે આપ ફરમાતે હેં કે મેં તત્વોંકા નહી બના, મેરી કોઈ ઝાત નહી, મેરા મકાન નહી, મેરા તન નહી, મેરી જાનનહી, મેરા નિશાન નહી, મે પેહલેથા ઓર ફીરભી રહુંગા યાની મેં કાયમો દાયમ રેહનેવાલા હું મેં શિર્કકો તોડતાહું એક અલ્લાહકો જાનતા હું ઓર એકહી એક દેખતા હું વગેરા વગેરા.

ઉપર લીખે હુવે આપકે કલામે કુદસીસે અબ કોનસી દલીલેં ચાહીએ કે જીસમે આપકા સુફીયાના તરીકા સાબીત હો, બસ આપકા તરીકા બતાને કો યેહી દલીલ કાફી હય

"મી. નીકલસનને આપકી સચ્ચી કેફીયત બમુજબ ઝેલકે લીખ્ખી હય, યેહ હઝરત એક પલમેં તખ્તે કે ઉપર ઉડતે ઉડતે આતે હેં ઓર દુસરીં પલમે અકલદંગ રહે જાય ઇસી તરાહ આંખોસે ગાઇબ હો જાતે હેં. એસી શાનવાલે જો હઝરત મૌલાના શમ્સ તબ્રેઝી (રેહ) હેં, ઉનકો લીખને પઢનેકી કમ વકફીયત થી મગર અલ્લાહ પાકકા પસંદ કીયા હુવા બાજાવમુંહકી તરાહ થે જીસકા સુબુત યેહથા કે જો શખ્સ આપકી મુલાકાત કા ફેઝ હાસિલ કરતાથા ઉસકો આપકી શાનોશવકત ઓર જમાલકા ફોરનહી અસર હોતાથા ઓર ખાસ કરકે તાલીમયાફતા લોગોંપર

realpatidar.com

https://archive.org/details/bk099/page/n44/mode/1up

realpatidar.com

આપકી અસર બહોત જલ્દ હોતીથી, ઓર ઉન લોગોં કો આપકી મોહબ્બત કામિલ દરજ્જે તક હો જાતીથી. ઓર યેહ હઝરતને બાહીર કે તમામ્ રોબોદાબકે દેખાવ કો નકમ્મા, સબુત કર દીખાયા હય ઓર ઇમાનકે નુરકો મોહબ્બત કે મૂલ (કીમ્મત) કીતરાહ દીખા દીયા હય" આપ અલ્લાહસે હમેશાં યેહી ઇલ્તેઝા કરતેથે કે " યાબારેતઆલા મેરી બાતેં સુનને વાલા યા ઉસ પર અમલ કરનેવાલા મુઝે કોઇ મીલાદે." આપકી યેહ ઇલ્તેઝા મકબુલ હુઇ

"શમ્સ તબ્રેઝી !" ડા **મુસન્નિફ મી.** ફૌક લીખતા હય કે હઝરત શમ્સ તબ્રેઝી (રેહ) કો હુકમ હુવાકે " મૌલાના જલાલુદીન રૂમીકો કે જો મેરા જલાલ દીખા રહા હય ઉસકો મીલ ઓર તેરે રંગમે ઉસે રંગદે. "

ઉસ વુકત હઝરત શમ્સ તબ્રેઝી દમિશ્કમેં થે ઓર આપને વહાંસે એક સોદાગરકી હાલતમે રૂમકા સફર કીયા, ઓર તા. ૨૬ જમાદીઉલઆખર હી. સ. ૬૪૨ કે દિન કૌનિયામે તશરીફ લે ગએ. ઓર **બિરંજ ફરોશ** નામી મહોલ્લે કે મુસાફીરખાનેમે મુકામ કીયા. ઉસ વકત આપકે પાસ એક પુરાની ચટાઇ, એક ટુટા હુંવા પ્યાલા, ઓર ઇંટકા તકીયા થા. યેહ મામુલી અસબાબકે સબબ આપને અપને કમરેકો કુફલ દે રખ્ખા થા, તાકે ઓર લોગોંકો આસાનીસે આપકી બુઝુર્ગી વગેરા વગેરાકી પેહછાન ન હોને પાએ.

મગર નહીં, અલ્લાહકે ખાસ બંદે કહાંતક છુપે છુપ શકતે હેં આપકી જીસ્મ મુબારિકકી નુરાની રૌશની તમામ કૌનિયામેં ઝગ મગા રહીથી. ઓર હકીકતો મારેફતકે ચશ્મેં જારી હો ચુકેથે; ઓર જીસકો પ્યાસથી (તલબથી) વોહ અપને અપને મુંહ ખુલ્લે કરકે પ્યાસ મીટાનેકો આને લગે.

ઉધર હઝરત મૌલાના જલાલુદીન રૂમી (રેહ૦) ભી અપની પ્યાસ દૂર કરનેકી કોશીષમેંહીથે. ઓર દોનોં તર્ફકી રૂહાની કુદરતી કશીશ હુઇ. દુસરે રોઝ હઝરત મૌલાના શમ્સ (રેહ.) સુબ્હોકે વકત ગાંવમેં ફીરતેકે લીયે

realpatidar.com

https://archive.org/details/bk099/page/n45/mode/1up

realpatidar.com

-નીકલે, ફીરતે ફીરાતે ગાંવકે ચબુતરેં કે નઝદીક આગએ ઓર વહાં બેઠકર કુછ સોચને લગે.

અવામ લોગોંકા કાનુન હય કે અનજાન શખ્સકો કીસી જગે અપને ગાંવમેં દેખલેં તો ઝુરૂર કુછ ન કુછ સવાલો જવાબ કરતે હેં યાની તુમ કહાં કે બાશિંદે હો, કયું આના હુવા ? વગેરા વગેરા. ઇસીતરાહસે હઝરત શમ્સકે ભી ઇર્દગીર્દ બહોત લોગ જમે હો ગયે. કયું કે આપ અનજાનતો થેહી, ઓર ઝયાદતીમે આપકા રંગઢંગ ભી નીરાલા થા.

આપકે પાસ લોગોંકા ઝુંડકે ઝુંડ જમે થા યેહ હાલ દેખકર હઝરત જલાલુદીન રૂમીભી આપકી તર્ફ તશરીફ લે ગએ. ઓર આપકે રૂખે મુબારિક કો દેખતેહી મોલાના રૂમીપર અજબહી તાસીર હો ગઇ. ઓર મૌલાના રૂમીકે દીલમેંસે ઇશ્કે ઇલાહીકી આગ નીકલને લગી. ઓર દિલસે હિજાબ દૂર હો ગયા. શરીઅતકી જગે તરીકતને લી. ઓર તમામ અગલી ઝીંદગીમેં કમી બેશી હો ગઇ. મતલબ કે યેહ પીરોમુરીદકી પેહલીહી મુંલાકાતમેં હઝરત શમ્સ તબ્રેઝીકી આંખોને ચકમકસી તાસીર દિખાઇ. ઇસ વકત હઝરત શમ્સ તબ્રેઝીકી ઉમર ૩૮ સાલકી થીં.

અબ રોઝબરોઝ મૌલાના રૂમીકે દીલકો " હદીસ ઓર ફીકાહ " કી કિતાબોંસે કમ રગબત હોતી ચલી. ઓર વાઅઝ કેહના, નશીહતેં કરના વગેરા આપકે બુઝુર્ગોંકા અવામ તરીકાથા. ઉસસે અબદીલ નહીં લગતાથા કયું કે યેહ તમામ બાતેંતો આપકી રૂહાની ગીઝા બન ગઇથીં, અબ જો કુછ રહાથા વોહ શિર્ફ હઝરત મૌલાના શમ્સ તબ્રેઝીકી મોહબ્બત ઓર ઇશ્ક, માસિવા તમામ ચીઝેં આપકે સામનેસે ફના હો ગઇથીં.

ઇસીતરાહ ઇધર પીરો મુરીદ યાની હઝરત શમ્સતબ્રેઝી વ હઝરત મૌલાના રૂમી રાઝોન્યાઝકી બાતોંમે મશગુલ થે. ઓર હઝરત શમ્સતબ્રેઝી

realpatidar.com

https://archive.org/details/bk099/page/n46/mode/1up

realpatidar.com

ખુદ મસ્ત બનકર ઇશ્કે હકીકીકે નશેમેં હઝરત મૌલાના રૂમીકો અપને રંગમેં રંગ રહેથે. ઓર ઉધર હઝરત મૌલાના રૂમીકે શાગીર્દ હઝરત શમ્સ તબ્રેઝીકે હાસિદ બન ગએથે. ઓર આપકો તરાહ તરાહકી અઝીયતેં દેના શરૂ કરદી થીં.

યેહ હાલ દેખકર હઝરત શમ્સતબ્રેઝી (રેહ) દમિશ્ક વાપિસ ચલે ગએ. હઝરત મૌલાના રૂમી કે દિલમેં આપકે લીયે જો જગે. ઓર મહોબ્બતથીં વોહ શાગીર્દ ન સમઝ શકે. અગર મૌલાના રૂમીકી ઇબાદત ઓર ચલનકી તર્ફ થોડાસા ભી ગોર કીયા હોતાતો શાગિર્દોં કે લીયે બદનામીકી કેફીયત તવારીખોંમેં દરજ હોના મુશ્કીલથી.

હઝરત મૌલાના રૂમી (રેહ) અપની તમામ ઝીંદગીકા મુલ, હઝરત શમ્સ તબ્રેઝી (રેહ) કે તુફેલ કિતના અહેશાનમંદ હય, યેહ બતાને કે લીયે ફરમાતે હેં.

.મૌલવી અઝ ખુદ, ન શુદ મૌલાએ રૂમ.
તા ગુલામે શમ્સ તબ્રેઝી ન શુદ.

હાસિલ કલામ યેહ કે મૌલાના ફરમાતે હેં કે જબતક મેં હઝરત શમ્મ તબ્રેઝીકા ખાદિમ ન બનાથા તબતક મૌલવી નથા. મતલબકે મેં હઝરત શમ્સકે હી લીયે મૌલવી કહેલાને કે લાયક હુવા.

આપકે કૌનિયાસે દમિશ્ક ચલે જાનેકે બાદ મૌલાના રૂમીકી હાલત આપકે ફિરાકમેં શબોરોઝ પરેશાન રેહતીથી, મૌલાનાકી આંખોંમેં આપકા તસવ્વુર રેહતાથા. ઓર ફિરાકકે સબબ આહો જારી કરતે થે, ઓર યહાં-તકકે અપને દીલકી બેકરારી મીટાનેકો રૂબાઇયાત કે કંઇ કાગઝ કે કાગઝ ભરદીયે. ફીરભી જરાસી તસલ્લી મૌલાનાકે દીલકો હોતી નથી. આપકી અયસી પરેશાન હાલત દેખકર આપકે શાગીર્દ, કે જો હઝરત શમ્સ તબ્રેઝીકા

realpatidar.com

realpatidar.com

ઇરાદા કરતેથે [illegible] રંજીદા હોને લગે. ખુદ મૌલાના કે ફરઝંદ સુલતાનવલદકોભી અપને વાલિદ બુઝુર્ગવારકી યેહ હાલત દેખકર બહોત રંઝ હોતા થા ઓર સાથમેંહી શાગીર્દોંકા હસદ કરના ઓર હઝરત શમ્સકો ઇઝાએં દેનાભી માલુમ થા.

હઝરત મૌલાના રૂમી (રેહ) ફિરાકકે સદમેસે બહોત રંજુરથે ઓર બાર બાર શર્દ આહ લગાતેથે. યેહ હાલાત દેખકર આપકે ચાહને વાલોંકો બહોત ફીક્ર હોગઈ કે અબ કયા કીયા જાય. આપકે ચાહને વાલે સમઝતેથે કે હઝરત શમ્સ કે ચલે જાનેકે બાદ, મૌલાના રૂમી ખુદબખુદ, આપકી અસલીયત પર આ જાઇંગે. મગર યહાંતો ઓરહી રંગ નઝર આતાથા. મૌલાનાને અપને તમામ ખેશો અકારીબ વ શાગીર્દ વગેરા તમામ સેભી મીલના ઝુલના છોડ દીયા. ઓર અકેલેહી ખાનકાહમેં બેઠ રેહને લગે. ઓર "હદીસ, ફીકાહ" વગેરાકાભી દેખના છોડદીયા. ઓર શબોરોઝ, રીયાઝત મેંહી ગુઝારને લગે. હરેક વકત અલ્લાહકીયાદ ઓર મુરશીદકી ધુન મચી હુઇથી. ઓર દુનિયા મિસાલે કેદ નઝર આતીથી. મુરશીદકી સચ્ચી મોહોબ્બતકા યેહસબ અસરથા. એસે મોઆમલેમેં ઇત્તેફાકસે હઝરત શમ્સતબ્રેઝીકાભેજાહુવા ખત, દમિશ્કસે આપકે નામ પર આયા. ખતકો દેખતેહી આપકો ઓર ઝયાદા બેચેની હોગઇ.

યેહ હાલત આપકે ફરઝંદ સુલતાન વલદસે દેખી નગઈ, ઓર પિદરી મોહબ્બત જોશમેં આઇ, જીસસે વાલિદ બુઝુર્ગવાર કો અર્ઝ કરને લગે, અય બાબા મત ફીક્ર કરો, યેહ બંદા હઝરત શમ્સ તબ્રેઝીકો બુલાનેકે લીયે દમિશ્ક જાનેકો તૈયાર હય. હુકમ, ફરમાઇએ ? યેહ સુનકર મૌલાના બહોત ખુશ હુવે. ઓર એકખત લીખકર તૈયાર કીયા જીસકી મુખ્તેસર ઇબારત ઝેલમેં દરજ કરનેમેં આતી હય.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n48/mode/1up

realpatidar.com

" ખતકી ઇબારત* "

કાયમો દાયમ, જો અલ્લાહ પાકકી ઝાતેબાબરકાત હય, અવ્વલ ઉસકી તારીફ કરકે મેં આપકો અર્ઝ ગુઝારતા હું કે, અય શમ્સ, આપ મુઝે જીસ તરાહ ફરમાએ હેં ઉસી તરાહ કરતા હું. ઓર ઇબાદત કરતા હું. માસિવા દુસરી બાતોંસે, કે જો અલ્લાહસે દૂર રખતી હેં અલગ રેહતા હું. અય શમ્સ આપકે નૂરકી તુફેલકી બરકતસે શામો અરબ વ ઓર મુલ્કમેં આફ-તાબ ગાઇબ હોને પરભી રૌશની રેહતી હય. મગર મેરે રૂમકે મુલ્કમેં આફ-તાબ કે હોને પરભી, આપકી ગેરહાઝરી કે સબબ તારીકી હય. ફોરન આ જાઓ. ઓર યેહ બેકરારી દુર કરો. દસ્ત ખત.

આપકા ખાદીમ મોહંમદરૂમ.

યેહ ખત લેકર સુલતાન વલદ અપને મીશનકે સાથ દમિશ્કમેં રવાના હુવે. વહાં પહોંચે ઓર કયા દેખતે હેં કે, હઝરત શમ્સ તબ્રેઝી એક ફિરંગી લડકે કે સાથ મુસાફિરખાને "**જલાલજીયા**" મેં બેઠે શેતરંજ ખેલ રહે હેં. યેહ લડકા દરગાહે ઇલાહીમેં, મકબુલોંમેંસે શુમાર કીયા ગયા થા. મગર વોહ લડકા અપની એસી હાલતસે વાકિફ નથા. મગર હઝરત શમ્સ કો ઉસ લડકેકી અચ્છી તરાહ વકફીયતથી, કયું કે આપ હમેશાં ઉસકે સાથ શેતરંજ ખેલતે થે. ઇસ વકત વોહ તમામ દાવ જીત ગયા. ઓર ઉસને ગુસ્સેમેં આકર આપકો એક તમાચાભી માર દીયા. યેહ બેહુદા ઓર બેઅદબ તરીકા સુલતાન વલદ ઓર ઉનકે સાથીઓંસે દેખા ન ગયા. જીસસે વોહ સબ હઝરત કે કદમ મુબારિક ચુમને લગે.

જબ યેહ હકીકત ઉસ ફીરંગી કે લડકેને દેખી તો. ફોરન કલેમા પઢ-કર મુસલમાન હુવા. ઓર અપની રૂહાની તાકાતકો ઝિંદા કરલીયા. જીસસે વોહ સુફીઓંમેં સુમાર કીયા ગયા, અબ વોહ લડકા હઝરતસે રઝા લેકર અપને મુલ્કકો રવાના હો ગયા.

* દેખો ઈસ્માઇલી નર રત્ન.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n49/mode/1up

realpatidar.com

યેહી અરસેમેં આપને સુલતાન વલદકો કદમોં પરસે ઉઠા કર અપને સીનેસે લગાયા. ઓર પ્યારકા એસા દેકર કૌનિયાકે હાલાત દરયાફ્ત કરના શુરૂ કીયે. સુલતાન વલદને વાલિદ બુઝુર્ગવાર કા ખત દીયા. ઓર તમામ કેફીયત અર્ઝ કી, યહાં તક કે, જો આપ કે હાસિદ ઓર દુશ્મન બન ગએ થે વોહ ભી તમામ શરમીંદા ઓર પરેશાન હોતે હેં ઓર ખતાકી માફી ચાહતે હેં, વગેરા વગેરા તમામ કેફીયત અર્ઝ કરદી.

આપને જબ યેહ તમામ બાતેં સુની તો આપ બહોત ખુશ હુવે. ઓર દુબારા કૌનિયાકી તફ રવાના હુવે; આપકી શહેરમેં તશરીફઆવરી કી ખબર સુનતેહી મૌલાના રૂમી મુલાકાત કે લીયે દોડ આએ. ઓર મોહબ્બતસે બગલગીર હુવે.

અબ મૌલાના રૂમીકી તમામ બેકલી દૂર હુઇ, જો લોગોંને પીરોમુરીદકેમીલનમેં રખના ડાલાથા વોહ તમામ આજેઝીસે માફી ચાહને લગે. યહાં તકકે શહેરવાલે સબકેસબ હઝરતકી દુબારા તશરીફ આવરી સે ખુશ હુવે. આપકી યેહ દુસરી દફાકી કૌનિયાકી મુલાકાત કામિલ દોઢ સાલ રહી, યેહ મુલાકાતમેં ભી પીરોમુરીદ ઇશ્કે હકીકીમેં ગુફતગુ કરતે રહે. ફીરભી ન તો મૌલાના રૂમીકા દીલ ભરતા થા, નતો હઝરત શમ્સ તબ્રેઝીકો ગભરાહટ હોતીથી. ઇસી તરાહ શબોરોઝ મશગુલ રેહતે દેખકર અવ્વલસેભી ઝયાદા હસદ લોગોંમેં નઝર આને લગા. ઓર તમામ લોગ આપકે દુસ્મન બન ગએ.

આપ જાનતેથે કે લોગોમેં અવ્વલ કે મુકાબલેસે ઝયાદા હસદ બઢ ગયા હય, ઓર સખ્તસે સખ્ત અઝીયતેં દેને પરભી આમાદાહ હો ગએ હેં. મગર મૌલાના રૂમીકી ખાતિર આપને કુછ પરવા નકી. આખિરકાર લોગ બહોત ઝનુની બને તો આપખુદ દેખતે દેખતેહીમેં નઝરોંસે ગાઇબ હો ગએ.

realpatidar.com

email: mail@realpatidar.com

https://archive.org/details/bk099/page/n50/mode/1up

realpatidar.com

મૌલાના રૂમીને દેખાકે હઝરત શમ્સ ગાઇબ હો ગએ. ઉસી વકત આપ બેચેન હો ગએ, ઓર દીલપર કાબુ ન રેહનેકે સબબ આહોઝારી કરતે હુવે, દમિસ્કકે રાસ્તે ચલ દીયે. ઓર વેરાન જંગલમેં ફીરતે ફીરાતે બહોત પરેશાન હાલતમેં હઝરત શમ્સકા પતા ન મીલનેસે કૌનિયા વાપિસ આએ:

એક રોઝકા ઝિક્ર હય કે, હઝરત શમ્સ તબ્રેઝી એકદમ કૌનિયામેં ઝાહિર હુવે. ઓર મૌલાનાકો મીલે. યેહ તીસરી મુલાકાતભી કૌનિયાકે લોગોંસે પોશીદા ન રહી. ઝાહિર હો ગઇ. અબ તો લોગોંને ખ્યાલ કીયા કે શમ્સકો કત્લ કર દીયે જાય, તો યેહ હર વકતકા ખોફ ટલ જાય. યેહ રાય તમામકો નિહાયત પસંદ ગુઝરી, ઓર મવકા દેખકર કત્લ કરનેપર આમાદા હો ગએ.

ઉધર હઝરત શમ્સ તબ્રેઝી મએ મૌલાના કે રાતકે વકત એક કમરેમેં થે ઓર લોગ યકાયક જમે હો ગએ. ઓર ઘાત લગાકર બેઠ ગએ. તાકે-મોકા આને પર કામ પુરા કરદેં, યેહ લોગોંમેં મૌલાના કે બડે ફરઝંદ અલાઉદ્દીનભી થે. તમામને કમરેકે પાસ જાકર હઝરત શમ્સકો ઇશારા દીયા: યેહ દેખકર આપને મૌલાનાકો આખિરી સલામ કીયા. ઓર બાહિર તશરીફ લે આએ. ઇધિર તો તમામ હુશિયાર હો કરહી બેઠે થે. એકદમ હુમલા આવર હુવે આપને બઆવાઝેબલંદ " અલ્લા હો અકબર " કા નઆરા અયસે જલાલકે સાથ લગાયા કે તમામ લોગોંકે હોશોહવાશ જાતે રહે. ઓર બેહોશ હો ગએ, ઇસી અરસેમેં આપ નઝરોંસે ગાઇબ હો ગએ. બાદમેં કૌનિયામેં તશરીફ લાએ નહીં. યેહ હુમલેમેં મૌલાના કે બડે લડકા અલા-ઉદ્દીનભી મારે ગયે.

હઝરત શમ્સ તબ્રેઝીકી વફાત તા. ૨૧ રમઝાન હી. સ. ૬૭૫ મેં હુઇ. આપકા મઝાર પુર અનવર ઉચમેં ઝયારતગાહ હય. આપકા મઝાર મહેરઅલી નામી મુરીદને રૂ. ૭૫૦૦૦ પંચોતેર હઝાર શરફ કરકે બનાયા હય. આપકે મુરીદોંમેં બહોતસે સુન્ની હેં, ઓર બહોતસે શીઆ હેં લેકિન આપકા હિદાયતકા તરીકા સૂફીમતકા થા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n51/mode/1up

realpatidar.com

"હાલાતે હઝરત શમ્સ તબરેઝ" નામકી છોટીસી કિતાબમેં ખ્વાજા હશન નિઝામીસાહબને જો નોટ (ખુલાસા) દીયા હય વોહ ઇસતરાહસે હય.

" હઝરત શમ્સતબ્રેઝકે વાલિદકી નીસબત બયાન કીયા ગયા હય કે ફીરકે ઇસ્માઇલીયાસે તઆંલ્લુક રખતેથે. ઓર હઝરત શમ્સને યેહ મઝહબતરક કરદીયા થા. મુઝકો ઇસ દાવેકે કબુલ કરનેમેં તામ્મીલ હય કયું કે ઇસ્માઇલી ફિરકે વાલે શમ્સ દુસરે ગુઝરેહેં જીનકા મઝાર મુલતાનમેં હય, અવામમુલતાની શમ્સ તબ્રેઝીકોહી હઝરત મૌલાના રૂમકા મુરશીદ સમઝતે હેં, હાલાંકે યેહ ગલ્ત હય, યુરોપીયન મુવર્રિખોંકી ગાલેબન ઇસી રિવાયતકી વજાહસે ગલ્ત ફેહમી હુઇ હોગી.

મુલતાની શમ્સ તબ્રેઝી (રેહ) કો તીનસો બરસકા અરસા ગુઝરા યેહ ઇસ્માઇલી ફિરકે કે દાઇ બનકર હિંદુસ્તાનમેં આએથે. ઇનકે હમરાહ દો શખ્સ ઓર થે, એકકા નામ પીર સદરૂદીન (રેહ) થા. ઓર દુસરેકા નામ પીર ઇમામુદ્દીન (રેહ) પીરસદરૂદ્દીનને ઇઝલાએ સીંધ વ બંબઇમેં દાવત શુરૂકી ઓર પીર ઇમામુદ્દીનને ગુજરાત વ કાઠીયાવારમેં. શમ્સુદ્દીન સીધે પંજાબ ચલેઆએ. ઓર યહાં અપના મીશન જારી કીયા સીંધ ઓર બંબઇમેં જીસકદર આગાખાની ખોજે હેં વોહ સબ પીર સદરૂદીનકી કોશિષ સે મુસલમાન હો કર આગાખાની (ઇસ્માઇલી) જમાઅતમેં સામીલ હુવે હેં. પીર ઇમામુદ્દીનને અવ્વલ અવ્વલતો બહેસીયત ઇસ્માઇલી દાઇકે કામ કીયા. મગર ચંદ રોઝકે બાદ ખુદ મુખતાર હોકર અપના એક ઇલાહેદા તરીકા ઇમામશાહી જારી કર દીયા. ઇમામશાહી તરીકે કે ઓસુલભી કરીબ ઇસ્માઇલી થે. લેકિન વોહ ખુદ અપને તઈ નાઇબે ઇમામ, ઓર મુઝહરે ઝાતે મવલાઅલી બયાન કરતે થે. પીર ઇમામુદ્દીનકા મઝાર મુકામ પીરાના મેં હય. જો અહમદ આબાદ, ગુજરાત કે કરીબ એક કસ્બા હય. આજ ઇમામશાહી જમાઅતમેં કમઅઝકમ પંદરાબીસ લાખ આદમી હોંગે

realpatidar.com

https://archive.org/details/bk099/page/n52/mode/1up

realpatidar.com

જીનમેં કુછતો ઝાહિરી તોરપર મુસલમાન હોગએ હેં જીનકા લકબ મોમીન હય. ઓર બાકી ગુપ્તી યાની પોશીદા હેં. ઓર ઉનકો અપને અકાયદ ઝાહિર કરનેકા હુકમ નહીં. યહાં તકકે અગર એક ઘરમેં ચાર હિંદુ રેહતે હેં. ઓર ઉનમેં તીન ઈમામશાહી હેં. તો ચોથેકો ઈસિકી ખબર નહોગી. પીરાનામેં ઈન લોગોંકી ખાનકાહ બની હુઈ હય, ઈસી ખાનકાહ જનોઈઓંકી દરગાહ બની હુઈ હય. યાની જો ગુપ્તી ઝાહિરી તરીકસે મુસલમાન હોના ચાહતે હેં, વોહ અપના જનોઈ દરગાહમેં ચઢાકર મુસલમાન હોજાતે હેં, ઓર ફીર ઉનકો મોમીનકા લકબ મીલ જાતા હય."

ખ્વાજા હશન નીઝામી સાહબ લીખતે હેં કે હઝરત શમ્સતબ્રેઝી ઓર પીર સદરૂદીન વ પીર ઈમામુદ્દીન (રેહ) તબલીગીકે લીયે સાથમેંહી આએ હેં, યે બાત ગલ્ત માલુમ હોતી હય. કયું કે યેહતીનોં હઝરાતોંકા ઝમાના કંઈ કંઈ સાલકે ફાસિલેપર ગુઝરા હય. ઈલાવા હઝરત શમ્સ તબ્રેઝીકે લીયે લીખતે હેં. કે મૌલાનાવાલે શમ્સ ઓર હેં ઓર યેહ શમ્સ ઓર હેં. લેકિન બડીબડી મોતેબર યુરોપીયનોંકી તવારીખોંમેંભી યેહી બાત પાઈ જાતી હય, જો ઈસ બાબમેં હમને લીખ્ખી હય. એકાદ મુવર્રિખ ગલ્તી કર સકતા હય. હરેક મુવર્રિખ ગલ્તી કરેં ઓર કોઈ સમઝેહી નહીં. યેહ બાતભી ખાસ એતેબારકે લાયક નહીં હય.

યેહી કીતાબકે યાની " હાલાતે શમ્સ તબ્રેઝ " કે મુવર્રિખ લીખતે હેં કે " હઝરત શમ્સકા મુલતાનમેં આફતાબકો ઉતારના " યેહભી મહઝ ગપ્પમગપ્પા હય. ઓર હઝરત શમ્સકા મુલતાનમેં આનાતકભી સુબુત નહીં હય.

યેહ ઈબારતકોભી સચ્ચે તોરસે નહીં માન સકતે, કયું કે હઝરત શમ્સ તબ્રેઝી (રેહ.) કો કંઈમુવર્રિખોંને પરંદેકી મિસાલદી હય. ફીર પરંદા કબ કોઈભી જગે મુકીમ રેહ સકતા હય. કભી યહાં ઓર કભી વહાં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n53/mode/1up

realpatidar.com

આફતાબકો* નીચે ઉતારનેકે બાબમેંભી સુબુત પાયા જાતા હય. ઓર એક અવલીયા અલ્લાહકા યેહ કરામત દિખાના કોઈ મુસ્કીલકી બાત નહીં હય. યેહ અવલીયા અલ્લાહોંને ઓર કંઈ ગીરોહકે ઓર અવલીયા અલ્લા-હોંને એસી એસી કરામાતેં દીખાઈ હેં જો શાનો ગુમાનમેંભી નહીં આ સકતી. મગર અલ્લાહ વાલોંકે નઝદીક યેહ બાતેં કુછ મુસ્કીલ નહીં, અલ્લાહ જલ્લશાનહુ ઝુરૂરી વકતપર એસી ઓર ઈસસેભી બડી કરામાતેં અપને દોસ્તોંસે ઝહુરમેં લા દેતા હય.

હઝરત શમ્સ તબ્રેઝીકે બારેમેં ઈમામશાહી કીતાબોંમેં બહોતસી હકીકત મવજુદ હય. અહેમદાબાદમેં જનાબ સૈયદ યાવરઅલી સાહબ હેં ઉનકે યહાં કલમી કિતાબ મવજુદ હય. ઉસમેંભી બહોતસે હાલાત લીખ્ખે હેં. મગર અફસોસ તો ઈસ બાતકા હય. કે એસી કિતાબેં છપવાકર અવામમેં ઝાહિર કરનેકી કોશીષ નહીં હોતી. અગર છપકર અવામમેં ફેલ જાએ તો હઝરત શમ્સ તબ્રેઝી (રેહ) કે કલામે કુદસીસે બહોત ફેઝ પહોંચનેકી ઉમ્મીદ હય.

આપકે ચંદ કલામાત હસ્લે ઝેલહેં જો ઈમામશાહી ગિરોહકી કીતા-બોંમેં મવજુદ હેં.

જે પીરને રાહ દીખલાઇ અને તાસું લાગા દાવે.
હાલ માલ જે પીર કેરી, તે સુખી મુસાફિર થાવે.
જેણે હાલ માલ પીરોં કેરી ખાઇ, અને સોતો કોઇ ન તર્યા ભાઇ.
સાહેબે આદે ઉનાદે દીતી બઢાઇ અને આ ગોર આલે આવ્યા.
આલથકી જે મુકર્યા ભાઇ તેણે ગાફિલ જન્મ ગુમાવ્યા.

× × × × ×

* દેખો તવારીખે પીર.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n54/mode/1up

realpatidar.com

કહે પીર શમ્સ સુણોરે ભાઇ અને વેલા કઠણુ આવી
એવા પાખંડ કલજુગમાંહિ વ્યાપ્યા ત્યારે કહો મહાદન વેલા આવી.

× × × × ×

ત્યારે ખત્રીના ખત્રવટ જાશે અને સુણોને સાચા યારો
બ્રાહ્મણુના તો ત્રાગા તુટશે તહીં થાશે એકાકાર.
બ્રાહ્મણુ ગલીના વસ્ત્ર પહેરશે, અને પીર પેગંબર જાશે.
કન્યાતણો દ્રવ્ય જો લેશે ભાઇ તે ભાંગ તમાકુ પીશે.
નાત છોડી પરનાતે પરણુશે અને સ્ત્રી મેલે રોતાં બાળ.
એક નારીને ત્રણુ બાળક હોશે ત્યારે આવ્યો પુરણુ કાળ.
ત્યારે નવ બરસકી બાલકી દેખો અને સોતો બેટા જણુશે.
અન્નપાણી ઓછેરાં પાકશે ભાઇ કાલ કેર ત્યાં પડશે.
બારે બરસકા પુરૂષ ફલેગા અને ગૌવા દોહો જણુસે.

× × × × ×

કહે પીર શમ્સ સુણોરે ભાઇ અને ઇલમસે દીલ લગાઓ.
એ જીવ છોડાવંવા મલીયા ભાઇ તમે રખે દોજખ જાવો.
જે પીરે અગમરાહ દીખલાઇ અને મોમિનકો સમજાયા.
જેણે ઇલમકા કહા કીતા ભાઇ તે જીવ બહેસ્ત સીધારા.
ભાઇ સાચ વિના તો તરણા નહીં અને જુઠા કાએકુ બોલો.
ઇલ્મ આલકી કુંચી લઇને તમારા દીલના તાલા ખોલો.
દીલતેરેમેં દેખ બીચારી અને પાંચભુત આત્માને વારો.

× × × × ×

દિલ સ્થિર નહીં ઓર ઇલ્મબાંચે અને મુરખ ભેદ ન બુજે
જો સિદ્દક ઇમાન હોવેગા તેરા તો ભાઇ દીલમાંહે સબકુછ સુજે

+ (પીર શમ્સકી ભવિષ્યવાણી કલમી મેંસે)

realpatidar.com

https://archive.org/details/bk099/page/n55/mode/1up

realpatidar.com

આરશી તો કાટ ભરાણી અને લોગોંકો દીખલાવે.
જે મુરખ મન બીચાર નબુઝે તે દર્શન કેમ કરી પાવે.
કરતવ કમાઇ જેની જેવી હોશે તેવા તે ફલ લેશે.
ભણે પીર શમ્સ સુણોરે ભાઈ તે દર્શન અલ્લાહી પાવે.

હઝરત પીર સદ-રૂદીન (રેહ.)

હઝરત પીર સદરૂદીન (રેહ.) આપ બચપનહીસે સાહેબે કરામત માલુમ હોતેથે ઓર યેહી સબબ થા કે આપકે બુઝુર્ગોંકે મુરીદોંમેં આપને બહોત ઝયાદતી કી. ઓર અલ્લાહ ઓર ઉસકે હબીબ મોહંમદ મુસ્તફા (સલ.) કે ફરમાન સમઝાને મેં બહોત કામયાબ હુવે. બલકે આપકી શોહરત તમામમેં બીજલીકી તરાહ ફેલ ચલી. ઓર મુરીદ લોગ આપકે દીદારકો બડી ખુશીકે સાથ આનેલગે. માસિવા મુરીદોંકે ઇસ્લામી આલમમેંભી આપકી શોહરતકા ચર્ચા હો ગયા ઓર લોંગો કે ઝુંડ કે ઝુંડ ઝોક ઝોક આતે થે જીસકી સુબુતીકે લીયે તવારીખેં ગવાહી દે રહી હેં આપકી કરામતકી યેહ તાસીરથી કે દૂરદૂરસે મુશરીક લોગ આપકે દીદારકો આતેથે ઓર ચાર આંખે હોતેહી ઉન્કા તમામ શિર્કોકુફ્ર નેસ્તો નાબુદ હોજાતાથા. ઓર ઇસ્લામસે મુશર્રફ હોકર આપકે મુરીદ બન જાતે થે.

આપકે વકતમેં લોંગોંમેં યેહ ખ્યાલ ફેલાથા કે જો દરિયાયે અટકકે ઉધર જાએ, ઉસે અપને ધર્મસે (દીનસે) ખારિજ હુવા સમઝ લેના. યેહી વજાહથી કે બહોતસે બલ્કે સબકેસબલોગ દરીયાએ અટકસે આગે બઢને સે ગભરાતે થે. ઇસલીયે લોગોમેં તીજારત, હુન્નર, કારીગરી વગેરા બહોત કમથીં જીસસે તરાહ તરાહકી તકલીફેં ઉઠાના પડતીથીં, ઓર તીજારતો, કારીગરીસે જો ફેઝ હાંસિલ હોતે હેં, હાસિલ નહીં કર સકતે થે.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n56/mode/1up

realpatidar.com

એસે બારીક વકતમેં આપ ઇશાઅતે ઇસ્લામકા કામ કર રહે થે ઓર સૂફીયાના તરીકસેહી નશીહત દેકર એક બડી જમાઅત જીસકી તઆદાદ ૩૬૦૦૦ છત્તીસ હઝારકીથી, યેહ તમામ મુરીદોંકે ગિરોહકો આપને દરીયા-એ અટકકે પાર લેજાનેકી હીંમતકી. તાકે અવામ લોગોમેંસે યેહ બેહુદા ખ્યાલ નાબુદ હોજાય. આપ યેહ ઝબરદસ્ત કામકો અંજામ દેનેમેં કામ-યાબ હુવે. તમામ મુરીદોંકો લેકર દરીયાએ અટકકે પાર ગએ. ઓર અપને પીરો મુરશીદકી ઝયારત કરાઇ. ઇસીતરાહ લોગોંકે બેહુદા ખ્યાલકો રદ્દો બાતિલ કર દીખાયા.

આપ તમામ મુરીદોંકો લેકર અપને પીરો મુરશીદકે પાસ ગએથે વહાં આપકો બહોત ઇજ્જત મીલી. પીરને અપના સરકા અમામા ઉતાર કર આપકે સરપર રખ્ખા. ઓર આપકે સાથમેં જો સાહબઝાદે આપકે થે જીનકા ઇસ્મ શરીફ કબીરૂદ્દીન થા ઉનકે લીયે દુઆએ ખૈર કી ઓર ફરમાયા આપકે પોતે હઝરત નુરમોહંમદકે વક્તમેં આપકી ગદ્દી પીરાનામેં રહેગી. ઓર વોહ બહોત નામવર બુઝુર્ગ ગુઝરેંગે.

હઝેરત પીર સદરૂદ્દીન (રેહ.)ને નવમુસ્લિમ મુરીદોંકે લીયે ઇબાદતખાને બનવાએ. જીસમે પેહલાહી ઇબાદતખાના જીલ્લે સિંધ કે કોટડા નામી કસ્બેમેં કરારદીયા ઉસસે પહેલે મુરીદોંકે લીયે કોઇ ઝાહિર ઇબાદતખાના નથા.

*લુહાને લોગતો પેહલેસેહી, ઝમાને હઝરત નુરમોહંમદ (સૈયદુસ્સાદાત) ઓર ઝમાને હઝરત પીર શમ્સ તબ્રેઝી (રેહ.) કે વકત મેંહી મુરીદ હો ચુકેથે મગર આપકે વકતમેં ઇસ્લામકે ઉસુલો અરકાનકે પુરે તોરસે પાબંદ હુંવે જબસેહી યેહ અવલીયા અલ્લાહને ઉનકો ખ્વાજા (સરદાર) કા ખિતાબ દીયા હય.

* દેખો " લુહાના કૌમકા ઇતિહાસ "

realpatidar.com

https://archive.org/details/bk099/page/n57/mode/1up

realpatidar.com

યેહ લોગ અસલમેં રાજપુત થે. ઔર યે બાતેં હિંદુઓંકી તવારીખોંમેંભી સાબિત હો ચુકી હેં. સબબ ઇસ બારેમેં અબ ઝયાદા લીખનેકી ઝરૂરત નહીં હય.

ચંદ લોગોં કા એતેરાઝ હયકે ખોજા કોમ કોઇ હલકી ઝાત હિંદુઓમેંસે હય. મગર યેહ બાત સિવાય હસદ કે દુસરા કુછ નહીં હય. યેહી ખ્વાજા લોગ અભીખોજા કેહલાતે હેં. આપકે બાદ યેહ ખ્વાજા યા ખોજા કોમ ખામોશ હો રહી. કયું કે હઝરત પીર સદરૂદ્દીન (રેહ.) કી ગદ્દી ઓર આપકી અવલાદ કે પીર કહાં હેં, વોહ બાત ઉનકે સામને તારીકીમેં રહી. મગર હાં, અબતો યેહ કૌમભી બહોત સમઝેને લગ ગઇ. કયું કે પીઝમાનેમેં યેહ કોમમેં બડે બડે તાલીમયાફતા મવજુદ હેં. ઓર ખૈરો શરકી તમીઝ બઝરીયે તાલીમકે કર સકતે હેં.

હઝરત સદરૂદ્દીન (રેહ.) કી વફાત ઉચમેં હુઇ હય. ઔર કરીબકે ગાંવ જેતપુરમેં આપ મદફુન હેં આપકા મઝાર કાબીલે દીદ હય. આપકી બહોતસી હકીકત ફારસી, ઉર્દુ તવારીખોંમેં મવજુદ હય. ઔર વહાં આપકા લકબ સૈયદ સદરૂદ્દીન હુસેની (રેહ.) હય. ઇમામશાહી ગિરોહકી કીતાબોંમેં આપકે બહોતસે કલામાત. હેં જીસમેંસે થોડે બહોત હરબેઝેલહેં.

એજી અલ્લાહ એક ખસમ સભુકા
દુનીયા ઉસકી સારી
અવીચલ નામ ખુદાવંદ ભણીએ
ઓર સબ મીટીયા કેરી બાજી
અલા ભેદ તંતવ નામ લીજે
અપણે જીવડેકી ચીંતારે મોમનભાઇકીજે.
અપણે જીવડેકું દોજક ન દીજે
અલા ભેદ તંતવ નામ લીજે

realpatidar.com

https://archive.org/details/bk099/page/n58/mode/1up

realpatidar.com

એજી નબી મોહંમદ, બુજો ભાઈ
તો તમો પાયો ઇમાન
મુશરકમનતો કાફર કહીએ
મોમન દીલ કુરઆન
એજી લોહો કલમ નીત ઉઠ દેખેઆ
તો એકકુ રદજ કીયા
ફેમે સુકર દાવે પરેઆ
સો લેખા રદજ કીયા
એજી જુમલે ફરીસ્તે સુજદા કીયા
અઝાઝીલ ફરમાન ન માનેઆ
સો લેખા રદજ કીઆ
એજી અઢારલાખ બરસકી ઉમરે
ઉસકુ ખાલિક દીયા
અનંતઇલ્મ ને અનંત દોલત
સો લેખા રદજ કીયા
અજી અઝાઝીલ ફરીશતા બુઝરૂગ કહીએ
અને બુધવત કહીએ તેસા
છત્રીસ કરોડ કીતાબાં પડીઆ
પણ ભીતર ભેદ ન પાયા
એજી હિંદુકે ઘરબેટા આયા
હુઆ મુસલમાન
પએલાનામ ઇબ્રાહીમ ભણાયા
દીન હુવા રેહમાન

realpatidar.com

https://archive.org/details/bk099/page/n59/mode/1up

realpatidar.com

એજી આધા ગંદુમ બહોત અભરત
આદમ ખાયા એતા
કનીક દાનાં આદમ ખાયા
તીસે નાંખેઆ બહેસ્તથી હેઠા
એજી ઉસભેદસે અંદેશા કીયા
નબી મોહંમદ ચેતેઆ
એક મણુને શેર દશ
ત્રેસઠ ખાયા એતા
એજી સગ પોશકી મશક બનાઇ
ઉસમાંહી ભરીએ જમજમ પાણી
કુત્તા કભઇ પાક ન હોવે
જો ધોવે સોહો પાણી
એજી પાક પાણી ફરમાને હુવા
સરોવર નદીઆં જાણી
એ ફરમાની પાક ન હોવે
જોધોવે સોહોપાણી
એજી ભણે સુણે ને બુજે એસા
ભેદ ન જાણે તેસા
વણુ કલમે જો નિમાજ ગુજારે
શીર બીના ધડ કેસા
એજી કલમા કુંચી મંદિર તેરા
પેઠ નસગે અનેરા

realpatidar.com

https://archive.org/details/bk099/page/n60/mode/1up

realpatidar.com

કલમે બીના મોક્ષ ન હોવે
સો કલમાં કુચીતેરા
ભણે પીર સદરૂદ્દીન કહેત કબીરૂદ્દીન
મારે મોમનોંકુ બહેશ્ત મુકામ
અલા ભેદ તંતવ નામ લીજે.

હઝરત પીર સદરૂદીન (રેહ.) કે ચંદકલામાત દેખનેસેહી ઈતિનાતો જરૂર માલુમ હોગા કે આપ કુફ્રોશિર્કો બિદઅત વગેરા પર ફિટકાર કરતે હેં, ઓર સાથમેંહી ગુમરાહોંકે લીયે હિદાયતભી કર દેતે હેં.

હજરતપીર હશન કબીરૂદીન (રેહ.)

હઝરતપીર હશન કબીરૂદીન (રહે.) બહોત બડે બુઝુર્ગ ગુઝરે હેં, આપને ગુજરાત વગેરા મુલ્કોંમેં બહોત લોગોંકા કુફ્ર તોડા હય યેહી વજાહ હય. કે આપકો કુફ્રેશીકનભી કેહતે હેં આપને તમામ ઝાહીરી વ બાતિની ઈલ્મ અપને વાલિદ બુઝુર્ગવાર હઝરત પીર સદરૂદીન (રેહ) સે હાસિલ કીયા થા.

દરીયાએ અટકકે પાર મએ મુરીદોં કે જબ આપકે વાલિદ બુઝુર્ગવાર ઉનકે પીરો મુરશીદ કે પાસ ગએથે. ઉસ વકત સાથમેં આપભી મુવજુદથે ઓર આપકે વાલિદ બુઝુર્ગવારકી વહાં બહોત તારીફ હોને લગીથી. યહાંતકકે ઉનકે પીરોમુરશીદને અપને સરકા અમામા ઉતારકર ઉનકે સરપર રખદીયાથા. ઉસ વકત આપને રાસ્તેમેંસેહી તૈયાર કીયા હુવા એક અમામા, (કેજો રૂઈકા તૈયાર કીયાથા ઓર ઉસકે થોડે થોડે ફાસિલે પર અલ્લાહ વ રસુલ (સલ૦) કી તારીફ કે ફકરે લીખે હુવે થે.) અપનો વાલિદ બુઝુર્ગવારકે મુરશીદકા સર ખુલ્લા દેખકર ઉનકો ઇનાયત કીયા થા. જીસસે ઉન્હોંને આપકે હકમેં દુઆએ ખેર કીથીં ઓર પેશીનગોઈ કીથી કે

https://archive.org/details/bk099/page/n61/mode/1up

realpatidar.com

તુમ્હારે પોતે હઝરત નુરમોહંમદ કે વકતમેં તુમારી ગદ્દી પીરાના મેં રહેગી. ઔર વોહ બડે સાહબે કરામત ગુઝરેંગે. ઔર ઉનકી બચપનહીકી કરામતેં દેખકર કંઇ લોગ ઔરભી મુરીદ બનજાઇંગે.

બુઝુર્ગોને દીનકી પેશીનગોઈ કભી જુટ નહીં હોતી. ઉનકી ફરમાઈ હુઇ તમામ બાતેં સહીથીં. જોહઝર પીર નુરમોહંમદ (રેહ૦) કે બાબમેં માલુમ હોંગી.

હિંદુઓંમેં જાલીંધર નામી એક બડા ઝબરદસ્ત જોગી થા, ઔર કાનીફા નામી ઉસકા એક બાલકા થા. વોહભી જાદુકે કામમેં બહોત મશહુર થા. ઔર અપના રથ હવામેં ઉડાએ લીએ ફીરતા થા. જાલીંધર જોગીકા વકતેમુર્ગ નઝદીક આ ગયા, ઉસવકત ઉસને અપને બાલકા કાનીફાકો ચંદ વસીયતે કીં ઉસમેંસે એક યેહભી થીં કે, " અય બાલકા કાનીફા, યાદ રખના કે શહેર ઉચમેં એક બહોત ઝબરદસ્ત કરામતવાલા પીર પેદા હોગા. જીસકા નામ હશનકબીરૂદ્દીન હોગા. ઔર ઉસકે બચપનહી મેં તુઝે ઉસકી મુલાકાત હોગી. ઔર ઉસકી નિશાની યેહ હય કે તેરા ઉડતા હુવા રથ ઉસકી નઝર પડતેહી ઝમીનપર ગીર જાયગા. ઉસવકત સમઝ લેના કે યેહ વોહી મહાત્મા હય જો ગુરૂને સમજાયા થા ". ઉસસે કોઇ તરાહકી ઇમતેહાનનભી તકરીર ન કરના.

જાલીંધર કે મરને કે કંઇ અરસકેબાદ એક રોઝ કાનીફા જોગીકા રથમેં બેઠે હુવે ઉચકી તર્ફસે ગુઝર હો રહાથા. યકાયક ઉચમેં ઉસકા રથ ઝમીન પર ગીરા. ઉસી વકત કાનીફા જોગી કો અપને ગુરૂકી પેશીનગોઈ ઔર નશીહત યાદ આ ગઇ. ઔર હરઝત પીર હશન કબીરૂદ્દીન (રેહ૦)કો અપને સામને મવજુદ પાયા ઉસ વકત આપકી ઉમર સિર્ફ ૯ સાલકી થી.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n62/mode/1up

realpatidar.com

આપકો ના બાલિગ ઓર કમઅકલ સમઝકર કાનીફા જોગીકો ખ્યાલ ગુઝરા કે યેહ નાતઝરબાકાર અચ્છા કયા કરામત દિખા સકતા હય, ઓર ગુરૂકી પેશીનગોઇ કયસે સચ્ચી હો સકતી હય. ઇસ ખ્યાલસે કાનીફાને આપસે તરીકતકે બારેમેં ચંદ સવાલાત કીએ. મગર ઇસકે સવાલોંકા જવાબ આપ બહોત કામિલ તોરસે દેતે ગએ. યહાંતકકે કાનીફા જોગીકે દીલકી ઇસ્લાહ હો ગઇ. ઓર ઉસકો અપને ગુરૂકી પેશીનગોઇકીભી સદાકત માલુમ હો ગઈ. યેહ તમામ બાતોંને વોહ અસર કીયા કે જોગી ખુદ આપકે હાથસે મુશર્રફ હોકર ઇસ્લામ લાયા. ઓર મુરીદ બના. ગોકે ઇસકી તવારીખ તો બહોત બડી હય મગર યહાં ઇસિ છોટીસી તવારીખકા અદ્દ બદ જાનેકે ખોફકે સબબ મુખ્તેસર તોર પરહી દરજકી હય.

આપ બહોત બડે સાહબે કરામાત ગુઝરે હેં જો મુશરીક આપકે ચેહરે મુબારિક કો દેખતાથા ફોરન કલેમા પઢકર ઇમાન લાતાથા ઓર આપકા મુરીદ હો જાતા થા ઇસી તરાહ આપને ઇલાહેદા ઇલાહેદા બહોતસે કસ્બોમેં ગસ્ત લગાએ હેં ઓર લોગોંકા કુફ્ર તોડા હય આપ બહોત બડે સય્યાહ ગુઝરે હેં

આપકે અઠારા સાહેબઝાદે થે જીનકે મઝારશરીફ અભીભી ઇલાહેદા ઇલાહેદા જગહોં પર મવજુદ હેં યેહ, તમામકી કેફીયત લીખ્ખું તો ઓર એક ઇતનીહી તવારીખ હો જાનેકા અંદેશા હય જીસસે ઇન હઝરાતોંકા ઇસ્મ ઓર મઝાર શરીફ લીખ દેતા હું.

નંબર.	ઇસ્મ શરીફ.	મઝાર શરીફ.
૧	હઝરતપીર શાહ કલંદર	દિલ્હી
૨	હઝરતપીર અવલીયાઅલી	લાહોર
૩	હઝરતપીર તાજદ્દીન	સીંધ
૪	હઝરતપીર અલાઉદ્દીન	મુલતાન
૫	હઝરતપીર ફરમાન	મુલતાન
૬	હઝરતપીર ઇસ્લામુદ્દીન	લાહોર

realpatidar.com

https://archive.org/details/bk099/page/n63/mode/1up

realpatidar.com

૭	હઝરતપીર રહેમતુલ્લા	લાહોર
૮	હઝરતપીર જઝબોદીન	મુલતાન
૯	ઝઝરતપીર જાફર	લાહોર
૧૦	હઝરતપીર આદમ મેંહદી	લાહોર
૧૧	હઝરતપીર નૂર મેંહદી	ઉચ
૧૨	હઝરતપીર બબ્ર કલંદર શાહ	મુલતાન
૧૩	હઝરતપીર બંધ	અકબરાબાદ
૧૪	હઝરતપીર શહાબુદીન	મુલતાન
૧૫	હઝદતપીર લાલશહેબાઝ કલંદર	સેવાન-સિંધ
૧૬	હઝરતપીર અચલશાહ	મુલતાન
૧૭	હઝરતપીર ગેબીશાહ	મુલતાન
૧૮	હઝરતપીર ઇમામુદ્દીન	પીરાના—ગુજરાત

હઝરતપીર હશન કબીરૂદીન (રેહ.) વફાત હી૦ સ૦ ૮૬૭ મેં ઉચમેં હુઇ. આપકે મઝારસે ફેઝ જારી હય. આપકેભી ચંદ કલામાત હરએઝેલ હૈ.

શાહા કુરાન પઢો સુરગીનાન શાહા આપણા કરશે ભાણા
ચાર પીર ચઉદ ખાન વાદા ભાઇ દીન બડા સમશાણા
આજકલ વારે રૂહુ ઉગારે આશા ગતીએ આશ તમારી
ગીનાન મહારસ ગોફતે પીરહશન કબીરૂદીન શાહા

હઝરતપીર લાલશહેબાઝ કલંદર (રેહ.) કા અસલ નામ સૈયદ ઉસ્માન

હઝરત પીર લાલ શહેબાઝ કલંદર (રેહ)

હય. આપ હઝરત હશનકબીરૂદ્દીન (રેહ.) કે શાહબ ઝાદે ઓર હઝરત ઇમામુદ્દીન (રેહ.) કે ભાઈ હેં આપકી વાલિદાસાહબા બાદશાહ જાદીથી આપ બચપનહીસે સાહબે કરામત નઝર આતેથે.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n64/mode/1up

realpatidar.com

ઓર જોકુછ આપ ફરમાતેથે દરગાહે ઇલાહીમેં મકબુલ હોજાતાથા. મૌલાના મોહંમદ સીદ્દીક ફરમાતે હેં કે " હઝરત લાલ શહેબાઝ કલંદરકી પેશાની મુબારક આફતાબસી માલુમ હોતીથી ઓર સિર્ફ સાતહી સાલકી ઉમ્રમેં આપ કલામેપાક પઢ ચુકેથે, ઇલ્મે મારેફતમેં બલંદ મરતબા રખનેવાલોંમેંસે ગુઝરે હેં અયસા કેહનેમેં મુઝે કોઈ બાતકા અંદેશા નહીં."

આપકા ઇષ્મિશરીફ લાલશહેબાઝ કલંદર કે મુતાલ્લિક બહોતસી રીવાયતેં હેં * મગર જો ખાસુલખાસહય, વોહ ઇસતરાંહપર હય. આપ હમેશાં લાલ રંગકે કપડે પેહના કરતેથે ઇસલીયે લાલ, ઓર આપકે મુરશીદ બાબા ઇબ્રાહીમકી કી તર્ફસે શહેબાઝકા. ખિતાબ મિલાથા. ઇસી તરાહસે ઇલ્મમેં કામયાબી હાસિલ કરનેકી વજાહસે કલંદરકાભી ખિતાબ પાયાથા. યેહી વજાહ હયકે લાલ શહેબાઝ કલંદર કે નામસે મશહુર હુવે. આપકે સાથમેંહી કલંદરકા ખિતાબ પાએહુવે ઓરભી તીન કલંદરથે (૧) હઝરત જહાંબાઝ કલંદર (૨) હઝરત બુલબુલ કલંદર ઓર (૩) હઝરત તુતી કલંદર.

આપકા ખિતાબ લાલશહેબાઝ કોનસે વક્તપર કયા કામ કરનેસે મશહુર હુવા યેહભી જાનના ચાહીએ. હઝરત સૈયદ ઉસ્માન (રેહ.) બમુકામ મર્ફંદ (ઈરાન) મેં પેદાહુવે કીસી ઝમાનેમેં આપકે બુઝુર્ગ સુબે મર્ફંદકે હુકમરાંથે, હઝરત સૈયદ ઉસ્માનભી નવજવાનથે કે આપને લિબાસે ફકીરી અખત્યાર કીયા. ઓર કલંદર બનગએ. ઓર યેહ આપકાહી અસર ફેઝયાંથા કે મીર સૈયદઅલી ગવર્નર બગદાદભી તારેકુદ્દ દુનિયા હોકર આપકે સાથ સેવાન ચલેઆએ, મીર સૈયદ અલીકા મઝારભી આપકે મઝાર પુરઅનવરકે કરીબ હય. કહાજાતા હય કે આપ હી. સ. ૬૨૪ મેંસેવાન તશરીફ ફર્મા હુવે ઓર યહીં ૫૫ સાલકી ઉમ્રમેં હી. સ. ૬૨૪ મેં આપને વફાત ફરમાઈ.

---

* દેખો રીસાલા ખુલા સતુલ સલાસીલ. × આપકો શોહરવર્દી ખાનદાનસેભી ખિલાફત હાંસિલ હય, ઓર બાપદાદાકે ખાનદાનમેંભી હઝરત ઈમામ જાફરસાદિકસે ઇજાઝત હય.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n65/mode/1up

realpatidar.com

એક મરતબા આપકે દોસ્તોંને આપકો નમાઝ પઢને કે લીયે મજબુર કીયાથા ચુનાંચે જબ નમાઝ પઢને લગે તો જીસ્મકે હર હિસ્સેસે ખુન બેહને લગા. ઓર ગેબસે સદા આઇ કે **સૈયદ ઉસમાન લાલહય**, દુસરી રીવાયત હય કે એક મરતબા આપકે પીરને ખુશીમેં આકર આપકો "લાલોંકાલાલ" પુકારાથા ઓર ઉસ દિનસે યેહ નામ પડ ગયા. શહેબાઝ મશહુર હોનેકી વજાહ યેહ બયાનકી જાતી હય. કે હઝરત શેખ ફરીદ (રેહ૦) કે મુરીદકો એસે વકતમેં, જબકે વોહ બે ગુનાહ ફાંસી દીએ જાને વાલાથા, આપ બાઝ બનકર અપને પંજેમેં ઉડાલાએથે ઉસ દિનસે શહેબાઝ યાની બાઝોંકા બાદશાહ મશહુર હો ગએ.

આપકો અપને મુરશીદ બાબા ઇબ્રાહીમ (રેહ૦) કી કામિલ એક સાલકી ખિદમત કરનેકે બાદ એક પત્થર મીલાથા જો ગલુબંધ કે નામસે મશહુર હય. યેહ પત્થર હઝરત ઇમામ ઝેનુલ આબેદીન• (રદી.) કા ખાસ ગલુબંધથા. યેહી સબબથાકે આપ ઇસ પાક તબર્રુકાતકો અપને ગલેમેં બાંધકર સોને પરહી રખ્ખા કરતેથે. ઓર બહોત ઇઝ્ઝત કરતેથે યેહ ગલુ-બંધ ઈઝમાને મેંભી આપકે મઝાર શરીફ મેં મવજુદ હય.

આપકો એક રોઝ ખ્યાલ હુવાકે એક જગે આબાદ કરના ચાહીએ. ઇસલીયે આપ એક મઝદુરકો લીયે હુવે એક ખેતમેં ગએ ઓર ઉસે ફર-માયા. યેહ જગે સાફ કર, તાકેમેં મુકામ કરૂં, મઝદુર બતાઇ હુઇ જગે સાફ કરને લગા. યેહ કેફીયત ખેતકે માલીકકો માલુમ હોતીહી વહાં જા પહોંચા. ઓર આપકો બેહુદા કલામ કેહને લગા. આખિર આપકો ગુસ્સા આયા. ઓર વોહ ખેતકે માલીકકો લાકડી મારી જીસસે વોહ મરગયા. આપને ઉસકી લાશકો વહાં ગાડદી. જબ ઇસ બાતકી ખબર ઉસકે રીસ્તેદારોં કો હુઇ, તો તમામ વહાં જાપહોંચે ઓર આપસે સવાલ કરને લગે કે યેહ ઝમીનકે માલીકકો આપને કયું મારા ? ઔર મારકર દાટદીયા યેહ બાત કયા સચ હય ?

realpatidar.com

https://archive.org/details/bk099/page/n66/mode/1up

realpatidar.com

આપને ફરમાયા હમને તો કુત્તેકો મારકર દાટ દીયા હય. અગર યકીન ન હો તો ખોદકર દેખ સકતે હો ઉન લોંગોને એસાહી કીયા, ઓર દેખાતો બેશક કુત્તાહી નઝર આયા. સબકેસબ હેરાન હોગએ. ઓર આપસે માફી ચાહી આપ બચપનહીસે જો ફરમાતે થે વોહ દરગાહે ઇલાહીમેં મકબુલ હોજાતા થા આપકી વફાત × હી. સં. ૭૨૪ મેં બમુકામ સેવાનમેં હુઈ તા. ૧૦ શાબાનસે તા. ૨૧ મી શાબાનતક બારાદિન આપકા ઉર્સ શરીફ ભરતા હય.

આપકે મઝારસે ફી ઝમાનેમેંભી કરામાતે ઝહુરમેં આતી હેં. આંપકી ગદીપર સજ્જાદાનશીન જનાબ સૈયદ મોહંમદશાહ બીન મુરાદશાહ હેં.

આપકી ઝયારતકો કલંદરી ફકીર બહોત આતે હેં. જો આપકે મુરીદોંમેંસે હેં, ઓર વહાં બડી જમાઅત કે સાથ રેહકર ઇબાદત કરતે હેં ઓર ઉનકે રહેનેકે લીયે અલગ અલગ બહોતસે મકાનાત તૈયાર કરને મેં આએ હેં. આપકે મઝાર શરીફકો "સેવાનમેં તા. ૭ માહે રજબ હી. સ. ૭૫૭ મેં મલેક અખત્યારૂદીનને કે જો બાદશાહ ફીરોજશાહકી તર્ફસે શેવાન જીલ્લેકા હાકીમથા" બનવાયાહય.

હઝરતપીર તાજદીન (૨૯૦)

હઝરતપીર તાજદીન (૨૯૦) આપભી હઝરતપીર ઇમામુદીનકે ભાઈ ઓર હઝરતપીર હસન કબીરૂદીનકે સાહેબઝાદે હેં આપકો વાલીદ બુઝુર્ગવારને જીલ્લે સિંધકે મુરીદોંકી નીગેહબાનીકે લીયે મુકરર કીયે થે.

આપકીં કરામાત કે હાલાતભી બહોત તુલો તવીલ હેં. મુખ્તેસર યું હય કે આપકી ઝબરદસ્ત કરામતેં દેખકર મુશરીક કોમમેંસે "સોડા" નામી લોગ ઇસ્લામસે મુશર્રફ હોકર આપકે મુરીદ હુવે. આપક વફાત

× આપકી વિલાદતો વિસાલ સાલમેં બહોત ઈખતેલાફ હય. હરેકને અલગ અલગ બતાયા હય.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n67/mode/1up

realpatidar.com

પંજાબકે ઉંચ શહેરમેં હુઇથી. ઔર વહાંસે કરામત કે તુફૈલ આપકા જનાઝા ઉડતા હુવા સિંધમેં આયા. ઔર સિંધમેં આપકા મઝાર બના હુવા હય. મઝારસે હુનુઝ ફૈઝ જારી હય.

હઝરત પીર મશાયખ (રેહ.) જીનકે વાલિદ બુઝુર્ગવારકા નામ હઝરત સૈયદ ફાઝિલ શાહથા આપકા ખાનદાની સિલસિલા હઝરત ઈમામ જાફર સાદિકકે ફરઝંદ હઝરત ઇમામ ઇસ્માઇલસે મિલતા હય ઔર હઝરત પીર ઇમામુદીન કે સાથભી કંઇ વાસ્તોંસે રીસ્તેદારી હય. યાની હઝરત પીર ઇમામુદીન કે ભાઇઓંકી અવલાદમેંસે હેં.

હઝરત પીર મશાયખ (રેહ.)

આપકા ખિલાફતકા સિલસિલા હઝરત શેખ ફરીદુદીન ગંજેશકર (રેહ.) તક પહોંચતાં હય. અપને બાપદાદા કે ખાનદાનમેંભી ઇજાઝત હય. આપકી વિલાદત જંતરાલ (પટનકે કરીબ) નામીં ગાંવમેં તા ૧૩ રબીઉલ આખિર હી. સ. ૧૩૬૦ મેં હુઈ. પરવરીશ કરએ કડીમેં પાઇ. ઔર આખિર ઉમ્રમેં અહેમદાબાદ તશરીફ લાએ. ઉસવકત આપકી ઉમ્ર ૯ સાલકી થી. ઔર આપકે વાલિદ બુઝુર્ગવાર હઝરત સૈયદ ફાઝિલ શાહકા વિસાલ હો ગયા. ઔર આપ યતીમ હોગએ બાપકે હઝારોં મુરીદ આપકો માનતેથે લેકિન કુફ્રકા અંધેરા છાયા હુવાથા. આપ બીસ સાલ તક ઇલ્મકી તેહસીલસે મેહરૂમ રહે, ચિરાગે હિદાયતકી રોશનીકી ઝુરૂરત નથી. મુરીદોંકા હાલ દેખકર આપકો બહોત ફિક્ર હુઇ ઇસ ફિક્રને કુછ અયસી તાસીર પેદાકી કે, મેરી લાજ ઔર ઇઝત તેરે દસ્તે કુદરતમેં હય તૂમુઝે નવાઝ મેં કયા કર સકતા હું જબતક તેરી રેહમત નહો,

realpatidar.com

https://archive.org/details/bk099/page/n68/mode/1up

realpatidar.com

એક રોઝ ખ્વાબમેં દેખા કે, રેહમતે ઇલાહી નાઝિલ હુઇ, ઓર હઝરત પયગમ્બર (સ. અ.) કો દેખે કે અપના લબે મુબારિક મેરે લબસે લગારહેં હેં. આપ ફરમાતે હેં કે મે યકાયક બેદાર હુવા. ઓર ઉંસીવકત અપને મુરીદોંકો શાહો રાસ્તપર લાનેકે લીયે મુંઝે મેરા દીલકવી માલુમ હુવા. તેહસીલે ઉલુમ ફરમાને લગે. થોડેહી અરસેમેં આપને ઝુરૂરતકે મુવાફિક ઇલ્મ હાસિલ કરલીયા. ઓર બહોતસી કીતાબેં ઝુરૂરત કે લિહાઝસે ગુજરાતી હુરૂફોંમેં ઓર પુરાની ઉર્દુ ઝબાનમેં લીખ્ખી હેં જો હસ્લેઝેલ હેં

(૧) નુરનામા. (૨) મેઅરાજનામા. (૩) ગઝવાત (૪) ગીરદીયા. (૫) મોજિઝાત (૬) વિસાલનામા. (૭) ખુલફાએ રાશેદીન (૮) મકતુલનામા હિસ્સા ૧ (૯) મકતુલનામા હી. ૨ (૧૦) ઇમાને મુફસ્સલ હીસ્સા ૧ (૧૧) ઇમાને મુફસ્સલ હીસ્સા ૨ (૧૨) ફિકાહ હિસ્સા ૧ (૧૩) ફિકાહ હિસ્સા. ૨.

આપકો અલ્લાહને અપને ફઝલોકરમસે ઇસ તરાહ ઇલ્મ અતા કીયાથા કે જીસકા બયાન એક જગે આપ ખુદ ફરમાતે હેં.

બદ દીન, દીનકાજ મુઝ પાસ આવે,
અને અકીદા કુહનેકું સાહી કર લાવે;
તો કરમરે અલ્લાહસુ કુફ્ર ઉસકાજાવે,
અને દીન કેરી રાહ સહીરે પાવે
પીછે હોવે શ્રાવક હિંદુ કે મેશરી,
કે હોવેરે મુનાફિક ટોળી મુમનોકેરી;
કે હોવે ઉસે મલીયા દીનકા ચોરા;
તો કુફ્રભી ઉસકા તોડરે બોહતેરા.
શીઆ મઝેહબકા જો કદીરે આવે,
તો સુન્ની હોં કેરી રાહા વે પાવે.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n69/mode/1up

realpatidar.com

ઈતનીરે સમજન હયમુજ માંહા
વેનબીકી દોસ્તીસુ મુજસુરે નાંહા
(નુરનામા.)

આપકી તારીફ સુનકર લોગ દૂરદૂરસે આપકી ખીદમતમેં હાઝિર હોતેથે ઔર સચ્ચે દીનસે ફેઝયાબ હોતેથે. આપ અપને વક્ત કે મુજદ્દિદગીને જાતેથે. મગર આપકો ઇસ બાતસે કુછ ફખ્ર નથા.

પીર મશાયખ સાહબકો માનનેવાલે મુરીદ મુમને–મોમીન નામસે મશહુર હેં. બહોતસે લોગ ઇનમેંસે ગુજરાત કાઠીયાવાડમેં ખેતી કરતે હેં ઔર બંબઇમેંભી એક બડી જમાઅત હય, જીનમેંસે અકસર વિકટોરિયા ગાડી ચલાનેકા કામ કરતે હેં.

આપ શરીઅતપનાહ બાદશાહ આલમગીર કે વકતમેં હુવે હેં. આપ ઇન્તેફાકસે દકકનમેં સોલાપુરમેં ગએથે. ઔર વહાં આપને દેખાકે બાદશાહ ઔરંગઝેબકા લશ્કર બીજાપુર પર હુમલા કરને કો જા રહાહય. તો આપભી સાથ હોગએ. ઔર લશ્કરમેં ફકીરકે નામસે મશહુર હુવે. બહોત અરસેતક લડાઇ જારી રહી. લેકિન ફતેહ ન હોનેસે બાદશાહ ઔરંગઝેબ બહોત પરેશાન હુવા. આપકી શોહરત સીપાઈઓંમેં બહોત હુઇથી. સિપાઇઓંકી ખ્વાહિશ ઔર તલબ પર આપને દુઆકી ઔર ફરમાયા કે, જુમેરાતકો બારિશ હોગી ઔર માહે ઝીલકઅદકી ચોથી તારીખકો બફઝલે ખુદા, આલમગીર અપને હુમલેમેં ઝોરાવર સાબિત હોકર બીજાપુર ફતેહ કરેગા. આપને વાયદા કીયાથા ઉસીકે મુવાફિક ફતેહ હુઈ ઔર આપકી કરામત ઝાહિર હુઇ. ઈસી તરાહ આપને ગોવલકુંડેકી ફત્તેહકી બશારત દી. ઔર વહાંપરભી બતાએ હુવે વકતપર ઔરંગઝેબ બાદશાહકી ફત્તેહ હુઇ ઇનલડાઇઓંમેં બાદશાહ આપકી સલાહસે કામ લેતાથા જિસકી બાબત આપ લીખતે હેં કે,

realpatidar.com

https://archive.org/details/bk099/page/n70/mode/1up

realpatidar.com

અયસે ઉમ્મતી નબીકે. ખાતીમ જીન્કા નામ રે.
ઈસ ઝમાને કે બાદશાહ, પુછ ઉન્કુ કરતે કામરે.
(મોઅજી ઝાત. ૨૧૩)

આપને ઉમ્રકા આખિરી હિસ્સા અહેમદાબાદમેંહી બસર કીયા. આપકા ઇંતેકાલભી યહીં હુવા. ઓર સારંગપુર દરવાઝે કે બાહિર ચાર ટોડાકે નઝદીક આપકા મઝાર હય. ઉર્સ આપકા મોહર્રમકી તા. ૨૧ કો હોતા હય.

હઝરત પીર ઇમામુદ્દીન (રેહ.)

આપકી વિલાદત તા. ૨૭ માહે રબી ઉસ્સાની હીજરી સને ૮૫૬ મેં ઇલાકે પંજાબ કે શહેર ઉચમેં હુઈ. આપકા ઇસ્મશરીફ સૈયદ અબ્દુર્રહીમ થા. મગર અવામમેં તમામ લોગ આપકો ઇમામ કહા કરતે થે, યેહી વજાહથી કે આપકા લકબ સૈયદ ઇમામશાહ યા સૈયદ ઈમામુદ્દીન મશહુર હો ગયા.

યેહ છોટીસી મગર સચ્ચી તવારીખકા નામ જો "**તવારીખે પીરઝાદા ઈમામશાહી**" રખ્ખા હય, ઉસકાભી તઆલ્લુક આપહી કે ઇસ્મ શરીફસે હય. યેહ નાચીઝભી આપહીકી અવલાદમેં હોનેકા દાવેદાર હય. ઓર જો "**સાદાતે ઇમામશાહી**" કેહલાતે હેં, વોહ સબકેસબ આપહી કી નસલસે હેં. હાં ઉનમેંભી કંઇ ગિરોહ હેં, મગર સબકેસબ ઈમામશાહી તો ઝુરૂર હેં. અલ્લાહપાકને આપકી અવલાદમેં બડી બરકકત અતા કી હય ઓર ઉસકા ફઝલો કરમકીયા હય, કયું કે ગુજરાત કે તમામ અહાતે મેં માસિવા ઓર જગેભીં આપકી અવલાદ મવજુદ હય. ઓર બાઝ બાઝતો કયાદીનમેં, કયા દુનિયા મેં બહોતહી રોશન ખ્યાલ ઓર તરકકી કે સોચમેં રેહને વાલે હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n71/mode/1up

realpatidar.com

માસિવા ગ્રેહ તવારીખમેં હઝરત ઇમામ જાફર સાદિક (રદી.) સે લેકર જીતને બુઝુર્ગોંકે હાલાત દરજ કીયે હેં વોહ તમામ આપહીકે જદ્દો અમજદ હેં ઓર બાકી ભાઇ, અવલાદ, ઓર ખલીફા વગેરા હેં. ઓર આપને ખુદભી હઝરત ઇમામ જાફર સાદિક (રદી.) સે રૂહાની ફેઝભી હાસિલ કીયા હય. ઓર ઇશાઅતે ઇસ્લામમેંભી અપને જદ્દો અમજદ કે તરીક સેહી કામ લીયા હય. જીસસે આપકા તરીક આપકે અગલે બુઝુર્ગોંકેહી મુતાબિક હય. યેહ સાફ પાયા જાતા હય. અગર યેહ સબબ-સેભી ઇસ તવારીખકા નામ આપકે સાથ સરોકાર રખ્ખે તો મુમકીન હય.

હઝરત ઇમામુદ્દીનકી વિલાદત હોનેકે બાદ આપકો આપકી વાલિદા સાહબાને એક પાક ઓરસફ્ફાફ કપડેમેં લપેટકર હઝરતપીર હશન કબીરૂદ્દીન (રેહ.) કી ગોદમેં દીયે, જો હઝરત ઇમામુદ્દીનકે વાલિદ બુઝુર્ગવારથે. આપકો ગોદમેં લેકર વાલિદ બુઝુર્ગવારને ફરમાયા, કે યેહ મેરા લડકા અપને ઝમાનેકા ગવસો કુતુબ* હોગા. ઓર ઇસકી ઝબરદસ્ત કરામાતેં ઝાહિરી વબાતિની ઝહુરમેં આતી રહેગીં.

આપ બડે સાહબેકરામાત બુઝુર્ગોંમેંસે હેં, બચપનહી મેં આપસે તરાહ તરાહકી કરામાતેં ઝહુર હોતીથીં, સિર્ફ આપ પરહી નહીં બલ્કે હઝરતપીર હશન કબીરૂદ્દીન (રેહ૦) કી જીતની અવલાદ હુઇ સબકે સબ સાહબે કરામાત ઓર બુઝુર્ગોને અઝીમ ગુઝરે હેં.

આપકી બારા સાલકી ઉમ્રશરીફ હોને પર તો આપકે વાલિદ બુઝુર્ગ-વારને ઝાહિરી વબાતિની ઇલ્મકી તાલીમ દેકર આપકો ખલીફા મુકર્રર કરકે ઇશાઅતે ઇસ્લામકે લીયે ગુજરાતકી તર્ફ રવાના કીયે, ઓર ફરમાયા કે ગુજરાતમેં જાફર કુફ્રકા અંધેરા હય, ઉસે દૂર કરો ઓર ઇસ્લામકી રોશની

* દેખો તવારીખે પીર

realpatidar.com

https://archive.org/details/bk099/page/n72/mode/1up

realpatidar.com

ફેલાએ. વાલિદ સાહબકા ફરમાન હોતેહી આપ ઉચ સે ગુજરાતકી તર્ફ રવાના હુવે આપને અભીતો થોડાહી સફર કીંયાથા કે બાતિની કરામતસે વાલિદ સાહબકી વફાતકી ખબર હુઈ જીસસે ગુજરાતકી તર્ફ ન જાતે આપ ઉચકી તર્ફ વાપિસ તશરીફ લાએ.

હઝરત પીર હશનકબીરૂદીન (રેહ૦) કા જનાઝા લેકર લોગ જા રહેથે ઓર આપભી વહાં મવજુદ હો ગએ. ઓર જનાઝેકો રોકકર વાલિદ સાહબસે નેઅમતકી તલબકી, યેહ હાલ દેખકર આપકે ભાઇઓને ઓર અવામ લોગોંને કહા કે યેહ વકત નેઅમત તલબ કરનેકા નહીં હય આપને ફરમાયા મુઝે એસીહી વસીયત હય; આપકે કલામ અભી ખતમ નહીં ચુકે થે કે યકાયક જનાઝેસે દસ્તે મુબારિક ઝાહિર હુવા. ઓર આપકો તમામકે બીચમેં બહોતસી નેઅમતેં દીં ઓર ફરમાયા કે ઈસસે ઝયાદા નેઅમતેં તુમકો હઝરત ઈમામ જાફર સાદિક (રદી૦) કે મઝારશરીફસે મીલેગીં.

યેહ ઈરશાદ હોતેહી આપ બહોત ખુશ હુવે, ઓર વાલિદ બઝુર્ગવારકો મદફુન કરનેકે બાદ પુરે ચાલીસ રોઝ ઉચમેં રહે, ચાલીસેકે બાદ આપ કીરમાનકી તર્ફ તશરીફ લે ગએ. ઓર વહાં જાકર શેખ ગુલામ મોહંમદ (રેહ૦) કો મીલે. કે જો આપકે વાલિદ સાહબકે રફીક થે. બાદમેં આપકો સૈયદ નુરશાહ (રેહ૦) કી મુલાકાતકા ફેઝ હાસિલ હુવા.

હઝરત સૈયદ નુરશાહ (રેહ૦) ને ફરમાયા, કહો મેરી આંખો કે નૂર, આપ કયા ઈરાદેસે મેરે પાસ આએ હો, આપને અર્ઝકી કે આપ કરામતોંસે ભરે હુવે હો, આપ તમામ બાતેં જાનતે હો. ઈસલીયે મેં કયા અર્ઝ કરૂં મગર મુઝે ઉમ્મીદ હય કે આપ મેરા મતલબો મકસુદ પુરા કરોગે. યેહ સુનકર હઝરત સૈયદ નુરશાહ (રેહ૦) ને આપકો બહોતસી કરામાતેં બખશીં ઓર ફરમાયા કે આપકો આપકે જદ્દોઅમજદસેભી કરામતેં હાસિલ હોગી.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n73/mode/1up

realpatidar.com

આપ કીરમાનકી તર્ફસે મદીના મુનવ્વરાકી તર્ફ રવાના હુવે. ઓર વહાંજાકર હઝરત મોહંમદ મુસ્તુફા (સ૦ અ૦) કે મઝારપુરઅનવરકી ઝયારતકી; બાદમેં હઝરત ઈમામ જાફરસાદિકકે મઝાર શરીફપર ગએ. ઓર રૂહાની ફેઝ હાસિલ કીયા જબ આપ અપને જદ્દોઅમજદકે મઝારશરીફસે વાપિસ ફિરે ઉસવકત અપને આપકો કરામતોંસે ભરે હુવે પાયા. યેહ હાલ દેખકર આપ બહોત ખુશ હુવે. ઓર નફીલેં અદા કરકે અલ્લાહ પાકકા સુક્રીયા બજા લાકર વાપિસ ઉચ્ચકા સફર કીયા. ઉચ્ચમેં તશરીફ લાકર વલિદા માજીદાકી ખિદમતમેં હાઝિર હુવે.

ચંદ મુદત વાલિદા સાહબાકી ખીદમતમેં ગુઝારી, ફિર આપ મએ હાઝર બેગ કે ગુજરાતકી સિમ્ત રવાના હુવે. રાસ્તેમેં જહાં જહાંસે આપકા ગુઝર હુવા વહાં વહાં ! બહોતસે લોગ ઈસ્લામસે મુશર્રફ હુવે, ઓર આપકે મુરીદ હુવે. યેહી ગુજરાતકે જહાં આપકે બુઝુર્ગવાર હઝરત પીર નૂરમોહંમદ ઉર્ફે સૈયદ સાદાતને આપસે સેંકડો સાલ અવ્વલ ઈસ્લામ ફેલાયા થા, ઓર ચારોં તર્ફ ઈસ્લામકી રોશની કુછ કુછ ચમક રહીથી જીસકો આપને તાઝા રૂહ ફુંકદી. યેહી સબબ થા કે ગુજરાતમેં ચારોં તર્ફ " લા ઈલાહા ઈલ લલ્લાહો મોહંમદૂર્રસુલુલ્લાહ " કી સદાએં બલંદ હો ગઈ.

આપ ઈશાઅતે ઈસ્લામ કરતે હુવે, ઓર કુફ્રકો તોડતે હુવે ગુજરાતકે આટુણા નામી ગાંવમેં તશરીફ લાએ. ઓર એક મસ્જીદમેં મુકીમ હુવે. જો નમાઝી લોગ નમાઝકો આતેથે વોહ આપકો બેઠ રેહતે દેખકર અર્ઝ કરને લગે. કે આપતો મુસલમાન હો, ફીર નમાઝ કયું નહીં અદા કરતે ! આપને ફરમાયા "મેરી તર્ફસે યેહ મસ્જીદકે મિનારે નમાઝ અદા કરલેંગે*" યેહ ફરમાકર આપ ખડે હો ગએ. ઓર " અલ્લાહો અકબર " કેહકર નમાઝ અદા કરને લગે. જબ આપ સીજદેમેં ગએ ઉસી વકત મસ્જીદકે

*દેખો ખોજાવૃત્તાંત.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n74/mode/1up

realpatidar.com

દોનોં મિનારેભી સીજદેમેં ઝુક ગએ. લોગોંને જબ આપકી યેહ કરામત દેખીતો દંગ હોગએ. ઓર મસ્જીદસે બાહિર નીકલ આએ. આપકી યેહ કરામતકા ચર્ચા શહેર અહેમદાબાદકે સુલતાન મેહમુદ બેગડા તક પહોંચા તો ઉસને આપકો અપની હુઝુરમેં બુલવાએ. ઓર અર્ઝ કરને લગાકે આપ કૌન હો ઓર કહાંસે તશરીફ લાંએહો ? આપને ફરમાયા,

હાશમી ખાનદાન હય, બનીફાતેમા લકબહય,
ઇસ્માઇલ બિન જાફરે સાદિકકા નસબ હય,
જો બાદઅઝ મુર્તુઝા છઠે ઇમામ હય,
અર્શે અઝીમતક રોશન ઇનકા નામ હય.
ઇસખાનદાનકે સબ બા કમાલ હય,
સૈયદ સદરૂદીન ઉસમેં બે મિસાલ હય,
પીર કબીરૂદીન પીશર ઉનકે નેકો હશીન,
ઉચ્છ શરીફમેં જો હુવે થે ગદી નશીન,
વોહ વાલિદ હમારે સુએ જન્નત રાહી હુવે.
અબહમ યહાં આકર, મહેમાન આજ શાહીહુવે.
ઇમામશાહ ઇષ્મ હય મેરા અય શાહે ગુજરાત.
મોહબ્બતે પંજતનમેં ગુઝર હોતી હય ઓકાત.

(ભાભારામ સુબોધ ઉપરસેં)

યેહ સુનતેહી મેહમુદ બેગડાને આપકી બડી ઇજ્જૈતકી, ઓર આપકા ખાનાભી કીયા, ખાના દસ્તરખ્વાન પર ચુના ગયા ઉસવકત એક તસ્તમેં ઇમ્તેહાનન, પકાહુવા બીલ્લીકા ગોશ્તભી રખ્ખા ગયા.

આપકે પાસ દસ્તર ખ્વાન પર ખાના ધરા ગયા, ઉસીવકત આપને તસ્તકો, કે જીસમેં બીલ્લીકા ગોશ્તથા, અપના અસા લગાયા, ઓર ફરમાયા,

realpatidar.com

https://archive.org/details/bk099/page/n75/mode/1up

realpatidar.com

“ **ઉઠરે મિઆઉં કીસલીયે મરી પડી હય** ” ” આપ ફરમાનાહીથા કે તરતમેંસે ઝીંદા બીલ્લી નીકલકર ભાગ ગઈ.

આપકી યેહ કરામત દેખકર, ઓર એક સાહબે કરામતકા ઇસીતરાહ ઇમ્તેહાન કરના ગેરમુનાસિબ સમઝકર મેહમુદ કે સાથવાલોંને કહાકે અય મેહમુદ “ **બિગડા** ” યેહસુનકર મેહમુદકો ખોફ તારી હુવા, ઓર આપસે કી હુઇ ખતાકી માફી ચાહને લગા, આપને ફરમાયા, અય મેહમુદ તૂમત ગભરા “ **બિગડા** ”* નહીં બલકે “**બેગડા**” તુઝે અલ્લાહપાક દોગડોંપર ફતેહ દેગા, જુનાગડ, ઓર પાવાગડ. યેહ સુનકર મેહમુદ બહોત ખુશહુવા ઓર આપકો બહોતસા નકદ નઝરાના પેશ કીયા. આપને લેનેકો ઇનકાર કીયા, આખિર મેહમુદને બહોત આજેઝીસે અર્ઝ કીયા. હઝુર કુછતો હુકમ ફરમાઇએ આખિર આપને ફરમાયા “ અચ્છા હમેં એક બેલગાડી દે તાકે હમકો બેઠનેકો કામલગે. ” સુલતાનને આપકો એક કીંમતી બેલ-ગાડી દી.

આપ મએ હાઝરબેગકે ગાડીમેં બેઠકર અહેમદાબાદસે રવાના હુવે, આપકી ગાડી સાબરમતી કે કિનારેપર પહોંચી. ઉસવક્ત સાબરમતી બડેઝોર પરથી ઇસલીયે આપને કીસ્તીવાલેકો ફરમાયા, હમકો સામને કિનારે જાના હય તૂ હમકો બીઠા લેજા, કીસ્તીવાલા બોલા આપ યહાં ઠેહરે રહો મેં ઇન બેઠેહુવે લોગોંકો સામને કિનારે રખકર આતા હું, ફીર આપકો લે જાઉંગા. આપને ફરમાયા હમકો જલદી જાનેકી ઝુરરત હય, કીસ્તીવાલેને કહા અગર આપકો બહોત ઝુરરત હય, તો ગાડીં સમેત ચલદીજીયે કયું કે આપ ગાડીમેં તો સવાર હેં.

૯ ________________

* બેગડા કયું મશહુર હુવા યેહ, તવારીખોંવાલોં કો ખૂબમાલુમ હોગા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n76/mode/1up

realpatidar.com

કિસ્તીવાલે કે યેહ અલફાઝ આપકો બહોત નાગવારા ગુઝરે, જીસસેં આપને હાઝર બેગકો ફરમાયા, કે બિસ્મીલ્લાહ, કિસ્તીવાલેકે કેહને કે મુતાબિકહી કરો, હમારા અલ્લાહ નિગેહબાન હય, યેહ ફરમાન હોતેહી હાઝરબેગને ગાડીકો સાબરમતીમેં ડાલા, ફૌરનહી પાની કે દો હિસ્સે હોગએ. ઓર આપકી ગાડીને અસાએ મુસા સા કામકીયા. બીચમેં ખુશ્કીકા રાસ્તા હો ગયા. જહાંસે આપકી ગાડી સામને કિનારે પર નીકલ ગઇ. ફીરપાની અપને દસ્તુર કે મુવાફિક એકસાં હોકર બેહને લગા.

આપકી યેહ ઝબરદસ્ત કરામત દેખકર મએ કીસ્તીવાલેકે સબકેસબ કલેમા પઢકર ઇસ્લામસે મુશર્રફ હુવે ઓર આપકે કદમોંપર ગીર પડે. ઓર મુરીદ હુવે ઓર યેહ જગે, કે જહાં દરીયાએ સાબરમતી કે પાનીકે દો હિસ્સે હો ગએ થે. ફાટા, નામસે મશહુર હો ગઇ, જો અભીતકકે યેહી નામસે મશહુર હય.

આપ યહાંસે આગે બઢે, રાસ્તેમેં લુટેરોંકા સરદાર જીસકા નામ નાયા થા વોહ મીલા, ઓર ઉસને આપકો લુંટનેકા ઇરાદા કીયા. યેહ કૈફીયત ઇલાહેદા નાયા કે ઝીક્રમેં દી જાયગી.

ઇસી તરાહસે સફર કરતે હુવે આપ ગીરમથા નામી ગાંવમેં આયે, જો અહેમદાબાદસે સાત કોસકે ફાસિલે પર હય, ઓર વહાં મુકામ કીયા. ઓર હાઝર બેગકો ફરમાયા કે તુમ ગાંવમે જાકર બેલ કે વાસ્તે ઘાસ લે આવ. હાઝરબેગ ગાંવમેં ઘાસ લેને કે વાસ્તે ગએ. મગર કોઇ જગેસે ઘાસ ન મીલી. કયું કે યહાં તીન સાલસે બારિસ ન બરસીથી, ઓર કહેતસાલીથી આખિર હાઝરબેગ, ગાંવકે પટેલ કે વહાં ગએ, ઓર ઘાસકી તલબકી. ગુફ્તગુમેં પટેલ કે જો ચાલાક શખ્સથા, વોહ સમઝ ગયા, કે યેહ કોઇ અલ્લાહકે ખાસ બંદોંમેંસે હેં યેહી સબબથા કે વોહ કંઇ આદમીયોંકો સાથમેં લેકર મએહાઝરબેગ કે આપકે પાસ આયા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n77/mode/1up

realpatidar.com

ઓર અર્ઝ કરને લગા કે હઝરત યહાંતો તીન સાલસે બીલકુલ બારિસ નહીં હુઇ ઓર કહેત સાલી હય, લેકિન આપ અલ્લાહ કે મકબુલોંમેંસે માલુમ હોતેહેં. ઇસલીયે આપ દુઆએ ખેર કરો. કે બારિસ હો જાય ઓર હમારી મુશ્કીલ દફા હો જાય.

આપને રૂખે મુબારિક આસ્માનકી તર્ફ કીયા, ઓર કુછ કલામ કહે, સાઅત નગુઝરીથીં કે એક છોટીસી બાદલી નમુદાર હુઇ, ઓર થોડીહી દેરમેં ચારોં તર્ફ ફેલ ગઇ. ઓર બારિસ બરસના શરૂ હો ગઈ, ઓર યહાંતક બરસી કે તમામ જલથલ ભરદીયે. ઓર કુદરતે કામિલાસે નયા ઘાસભી ઝહુર હુવા જબ યેહ કરામત દેખી તો સબકેસબ કલેમા પઢકર ઇસ્લામસે મુશર્રફ હુવે. ઓર મુરીદ હોકર હઝરતકો અર્ઝ કરને લગે કે આપ યહીં મુકીમ રહો. આપને ફરમાયા હમ વહાં મુકામ કરેંગે કે જહાં હમારા ફેંકા હુવા તીર ગીરેગા યેહ ફરમાકર આપને એક તીર ફેંકા, જો ગીરમથાસે મગરીબમેં જહાં અભી આપકા મઝાર શરીફ હય. વહાં જાકર ગીરા. જીસકી તાલાસકો હાઝરબેગકો રવાના કીયે. તાલાસ કરતે હુવે હાઝર બેગ જહાં તીર ગીરાથા ઉસ મુકામ પર જા પહોંચે કયા દેખતે હેં, કે યહાં તો એક શેર મએ શેરનીકે. મવજુદ હય, તમામ કેફીયત દરયાફત કરકે હાઝરબેગ આપકી ખીદમતમેં હાઝિર હુવે. ઓર અર્ઝ કરને લગે કે જહાં હઝરતકા તીર ગીરા હય વહાં એક શેર મએ શેરની કે મવજુદ હય.

આપને ફરમાયા, અય હાઝરબેગ તુમ સચ કેહતે હો, યેહી જગે મેરે લીયે મુકર્રર હય, ઓર યેહ જગે બેજાપલીદી વગેરા નહોને પાએ યેહી સબબસે શેર નિગેહબાની કર રહા હય, અપને જાને પર વોહ, ઇનશાઅલ્લાહ, ઝુરૂર ચલે જાએંગે, યેહ ફરમાકર આપ મુરીદોંકો નશીહત વસીચત કરકે ગીરમથાસે મુકર્રર જગેકી તર્ફ રવાના હુવે.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n78/mode/1up

realpatidar.com

આપ જબ તીર ગીરાથા ઉસ જગે તશરીફ લાએ તો શેરકો મએ શેરની કે મવજુદ પાયા, જીસને આપકા આદાબ બજાલાકર વહાંસે ચલદીયા. ઓર આપ યેહી જગે મુકીમ હુવે. આપકે આનેકે તુફેલસી ઇસ જગેકા નામ પીરાના મશહુર હુવા. (પીર+આના=પીરાના) ચંદ મુદતકે બાદ એકદિન, ગુજરાતકે હિંદુઓંકા એક બડા સંઘ કાશી જાત્રાકો જા રહાથા જોગીરમથામેં મુકીમહુવા. ઉસ સંઘ કે લોગોંને ગીરમથા વાલે લોગોંસે હઝરતકી કરામતોંકી બહોત તારીફ સુની, ઇસલીયે સંઘકે તમામ લોગ આપકે દીદાર કરનેકો પીરાના ગએ.

આપને તમામકો દેખકર ફરમાયાકે તુમસબ કહાં જારહેહો. સંઘવાલે લોગોંને અર્ઝકી, કે હમ સબ કાશીકી જાત્રાકો જા રહે હેં, આપને ફરમાયા, "**મન ચંગા તો કથરોટમેં ગંગા**" તુમકો યહીં કાશીકી જાત્રા કરાદેં તો કયસા? લોગોંને અર્ઝકી, કે હમકો યહીં જાત્રા કરાદો જબતો બહોત ઠીક, કયું કે યેહ મહીનોંકી મુસાફરીહય, ઓર વોહભી તરાહ તરાહકી તકલીફોંકે સાથ, ઇસલીયે અગર આપ યહીં જાત્રા કરાદોગે તો હમ સબ આપકો હમારા ગુરૂ (પીર) બના લેંગે. આપને ફરમાયા, બહોત અચ્છા, તુમ સબ લોગ આજકી રાત યહાં મુકામ્ કરો, કલ દેખા જાયગા.

આપકે ફરમાનેસે સંઘકે તમામ લોગ રાતકો પીરાનામેંહી મુકીમ રહે ઓર સુબ્હો ઉઠે તો ઉંનકો કાશીકા શહેર નઝર આયા તમામ લોગોંને ગંગામેં સ્નાનકીયા, ઓર દેવદર્શનભી કીયા, યહાં તકકે કાશીકે નામકી જો હુંડીથી ઉસકે રૂપીએભી લીએ. ઓર બ્રહમનોંકો ખાનાભી ખીલવા દીયા. ઇસી તરાહ તમામ ક્રીયા (કારોબાર) કરતે હુવે પીર રાત હો ગઇ, ઓર સબકેસબ સો ગએ દુસરે રોઝ સુબ્હો ઉઠે ઓર દેખતે હેં તો પીરાનામેં હી મવજુદ હેં.+

\+ આપને બઝરીયે તસવ્વુફકે તમામ બાતેં બતાઈ થીં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n79/mode/1up

realpatidar.com

યેહ ઝબરદસ્ત કરામત દેખકર સબકા સબ ઇસ્લામસે મુશર્રફ હુવા. કંઈ લોગોને કાશી, જાત વગેરાસે તલાસ કરાઈ કે યેહ બાત સચહય કે પૂરાં પૂરાં રેત હુમલોગ આએથે ઔર તમામ ફીકા કીયી, જવાબમીલા કે યેહ બાત બીલકુલ સચહય, ઇસમેં તુમકો કયું શક આયા, શાયદ તુમારે દિમાગતો બીગડે નહીં હૈં.

આપકી યેહ ઝબરદસ્ત કરામત દેખકર સબકે સબ ઇસ્લામસે મુશર્રફ હુવે. ઔર આપકે મુરીદ બન ગએ, આપને તમામકી જનોઇએં ઉતરવા ડાલી. જીસકા તોલ સવા મણ થા, જીસકો એક જગે મુકર્રર કરકે રખ્ખી, ઔર ઉસજગેકા નામ જનોઇ કરારદીયા. તાકે ઇસજગેકો દેખકર મખલુકકો જનોઇકી તવારીખ જાનનેકા શોક પેદા હોકર સચ્ચે દીનકી શાનો શવકત સમઝમેં આ જાએ. ઔર અગર મુશરીકોંકુફ્ર હૈં તો અપને ગુનાહોંસે તોબા કરેં.

જનોઇમેં અભીભી બહોતસી જનોઇએં મવજુદહૈં જીસકો દેખનેસે આપકી કરામતકા ઔર ઈસ્લામકી સદાકતકા બહોત અચ્છા તોઝા અસર હોતા હય, ઔર નએ મુરીદભી ઔક ઔક આપકી કરામતો સચ્ચેદીનપર ઇમાન લાતે હૈં.

રોઝબરોઝ આપકી નઈ નઈ કરામતેં ઔર શોહરત સુનકર સુલતાન મોહમુદ બેગડા હી૦ સ૦ ૮૭૫ મેં આપકી મુલાકાતકો પીરાનામેં આયા, ઔર ગોયા અવ્વલકે ઇમ્તેહાનસે ફરામોશ હો ગયા હો; ઇસીતરાહ આપકો ઇમ્તેહાનકે તોરપર, મર્ગ ઝહેર કાતિલકે દૂધકા પ્યાલા દીયા, ઔર ઉસકો પી જાનેકી અર્ઝ કી. મગર અલ્લાહવાલોંસે કબ કોઈ બાત છુપાઇ છુપી રેહ શકતી હય, આપ યેહ ફરમાકર "એક દફા ઇમ્તેહાન કરનેસે શાયદ તુમારા જી નહ ભરા." પ્યાલેકા તમામ દુધ પી ગએ.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n80/mode/1up

realpatidar.com

થોડે અરસેતક સુલતાન મેહમુદ બેગડા દેખતા રહા કે દેખેં ક્યા હોતા હય, આખિર કુછ ન હુવા. યેહ દેખકર સુલતાનને બડી આજેજી કે સાથ અર્ઝ કી "હુઝુર કો જો કુછ અર્ઝ કરૂં કબુલ ફરમાઇએ," આપને ફરમાયા બહોત ખુશીકે સાથ કહો, સુલતાનને કહા આપકે બડે સાહબઝાદે નૂરમોહંમદકી, મેરી લડકી બુઝુર્ગખાતુન કે સાથ શાદી કરદો. આપને યેહ બાત મંઝુરકી. ઔર અપને સાહબ ઝાદેકી. શાદી સુલતાનકી લડકીસે કરદી.

આપને અપની વફાતકે અવ્વલહી પીરાનામેં એક આલીશાન રોઝા બનવાયા હય, ઇસકે બનાનેમેં અંદાજન દેઢ લાખ રૂપીઆ સરફ હુવા હય. એસા કહાજાતા હય, જબરોઝા બનવાને કે ઇંતેઝામમેં આપ મશરૂફ થે, ઉસવકત **"નગીના ગોમટી"** નામી જગેમેં આપકી બેઠકથી. જો મકાન અભી રોઝેકી જુનુબમેં મવજુદ હય.

આપ અપની બેઠકકે નીચેસે શામકો પેસે નીકાલ નીકાલકર મઝદુરોંકો દીયા કરતેથે, કંઇ મઝદુરોંકો યેહ હાલત દેખકર ખ્યાલ હુવા, કે યેહ ગદીકે નીચેતો ખઝાના હય, જીસમેંસે નિકાલ નિકાલકર આપ પેસે દેતે હેં, અગર રાતકો આકર તમામ પેસે લેકર ચલદેં, તો ફીર હમેં મઝદુરી કીભી હાજત નરહે, યેહ સોચકર કંઇ હમ ખ્યાલી મઝદુર રાતકે વકત આએ, ઔર આપકી બેઠક ઉઠાકર ખૂબ ખોદને લગે, આખિર ના કામયાબ હોનેપર ઝમીન જયસીથી વયસી કરકરાકર ચલદીએ.

દુસરે દિન આપ બમુજબ કાનુનકે શામકે વકત તમામ મઝદુરોંકો મઝદુરી દેને લગે. ઔર જો મઝદુર કે રાતકો ચોરી કરને કે વાસ્તે આયેથે ઉનકો પહેછાન પહેછાન કર દુગને પેસે દેને લગે. દુગને પેસે મીલનેસે વોહ મઝદુરોંકો યેહ ખ્યાલ હુવા કે યેહ સાહબે દૌલત (નહીં જાનતેથે કે સાહબે કરામત હેં) હમારા ઇમ્તેહાન કર રહે હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n81/mode/1up

1933-12-21 -Twarikhe Pirzada ImamShahi (99)

realpatidar.com

ઇસલીયે કેહને લગે કે આપને હમકો યેહ દુગને પેસે કયું દીએ? ગલતીતો નહીં હુઇ ? આપને ફરમાયા, નહીં. ગલતી નહીં હુઇ, બાતયેહ હય કે તુમલોગોંને રાતકે વકતભી બહોત મઝદુરી કીહય, ઇસલીયે દુગને પેસોંકે હકદારહો, ખુશીસે લે જાવ, આપકે કલામ સુનકર વોહ ચોરમઝદુર બહોત શરમીંદા હુવે. એોર આજેઝીસે માફી ચાહને લગે, એોર [illegible] નમા પઢકર ઇસ્લામસે મુશર્રફ હુવે.

આપકીં દરગાહ બહોત ખુશ્નુમા એોર આલીશાન હય, દરગાહ કે ઉંચે ગુંબદ કે ઉપર સોનેકે કલસ હેં, એોર બડે દરવઝે ચાંદીકે હેં દરગાહ શરીફકી મશરીકકી જાનિબ જમાતખાના, એોર કારોબારીઓંકે લીયે રેહને કે મકાનાત હેં, જીસમેં હઝારોં રૂપીએ શરફ હુવે હેં. મગરીબકી તર્ફ એક આલીશાન મસ્જીદ હય, જીસમેં એકહી વકત મેં ૫૦૦ શખ્સ નમાઝ ગુઝાર સકતે હેં. બરસકી દોનોં ઇદોંકીભી નમાઝેં યેહી મસ્જીદમે હોતી હેં, એોર જીસમેં જુદે જુદે દરબાર કે કાકા*ભી શરીક હોતે હેં. યેહ મસ્જીદકી સિમાલકી જાનિબ એક ઇમામખાના હય, જહાં મજલીસેં વગેરા હોતી હેં ઇસકે ઇલાવા જુનુબમેં નગીના ગોમટી નામકી આપકી બેઠક હય, જીસકા સંગેમરમરકા કામ કાબિલેદીદ હય, જીસકે દેખનેકો દૂર દૂરસે સૈયાહ આતે હેં એોર કારીગીરી દેખકર બહોત ખુશ હોતે હેં, બહોતસે યુરોપીયન સૈયાહ ... કાબિલેદીદ મકાનોંકે ફોટુભી લે જાતે હેં. દરગાહ શરીફ કે અહાતે કે બાહિર એક કુવા હય વોહ ... યેહભી આપકી કરામત એોર સદાકતકી ગવાહી દેરહા હય, માસિવા ઇસકેભી બહોતસી જગેં એસી હેં. જીનસે કુછ ન કુછ આપકી કરામત એોર સદાકતકી ગવાહી નિકલતી હય.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n82/mode/1up

realpatidar.com

આપકે મુરીદોંમેંસે જો દશોંત (ચઢાવા) આતા હય, સાલાના રૂ. ૫૦૦૦૦ પચાસ હઝારકે કરીબ હય. ઔર ઝમીન વગેરાકી ઔરભી રૂ. ૨૫૦૦૦ 'પચીસ હઝાર આમદની મીલાકર કુલ રૂ.૭૫૦૦૦ પંચોતેર હઝારકી આમદની હય, યેહ આમદનીમેંસે કારોબારકા ખર્ચ, લંગરખાનેકા ખર્ચ, વગેરા ખર્ચ નિકાલકર આપકી અવલાદકે સાદાતોંકે, (કે જો "સાદાતે ઇમામશાહી" કેહલાતે હેં. ઉનકે રોઝાના, માહીયાના, સાલીયાના, શાદી, મૈયત, બીસ્મીલ્લાહ, વગેરા વગેરાકે) કદીમી હુકુક અદાકરનેમેં આતે હેં.

આપકે ફરઝંદ ગુજરાતકે હરેક કસ્બેમેં ઔર ગાંવમેં ફેલે હુવે હેં, ઔર બાઝબાઝ દખનકે મકામાતમેંભી હેં, જબ પીરઝાદે દોરેપર નીકલતે હેં તો મુરીદોં કે ગિરોહ કે ગિરોહ જમા હોકર બહોત ખુશી મનાતે હેં; ગોયા અપને લીયે ઇદકે દિન સમઝતે હેં. ઔર ઇસકદર ખિદમત ગુઝારી કરતે હેં કે, જો એક મોઅતકિદે ખાસ ઔર ખાદિમે બાઇખલાસં કે લીયે એબા હય.

આપકી ગદ્દીપર કાકા* કો મુકર્રર કરનેમેં આતા હય. અસલઇસકી યેહ હય કે હઝરતપીર ઇમામુદીન (રેહ).ને મુરીદોંકો (કમાઇકા દશવાં હિસ્સા.) દેને પર યહાંતક કે મોઅતકિદ કરદીયેથે કે અગર કીસીકો દશ લડકે પેદા હોવે, તો એક લડકાભી આપકીખીદમત ગુઝારી કે લીએ ભેજ દીયા કરતેથે. જો કાકાકે લાયક ગીના જાતાથા,

અભી કાકાકો મુકર્રર કરનેકા અખ્તિયાર તીન બાતોંપર હય.

(૧) સાદાતે "ઇમામશાહી" કી પસંદગી

(૨) મુરીદ જમાઅતકે લોગોકી પસંદગી.

(૩) ઉપર બતાઇ હુઇ દોનોં બાતોં મેં કામયાબ હોનેપર હઝરતકે નામકી લોહેકી એડી પહેનના,

---

* કાકા બઝબાને ફારસી લફ્ઝ હય, જીસકે મઆની, ગુલામ; ખીદમત કરનેવાલા; મુજાવર; વગેરા હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n83/mode/1up

realpatidar.com

અગર લોહેકી બેડી ન તુટીતો ઉપરકી દોનોં બાતેં પુરુલ હય, જો શખ્સ તીસરી શર્ત મેં કામયાબ નહો, વોહ કાકાકે લાયક નહિ ગીના જાતા. અગર તીસરી શર્તમેં કામયાબ હુવાતો ઝુરૂર કાકાકે લાયક સમઝા જાતા હય. ઓર યેહી કદીમી તરીકા હય.

કાકાકો ફકીરી તરીક અખત્યાર કરના પડતા હય, ઓર ભગવે કપડે પહેનાએ જાતે હેં. ઓર ઉસકો ઇબાદત, પરહેઝગારી, સદાકત, ઈશાઅતે ઇસ્લામમેં કોશીષ, સબર, વગેરા વગેરા બાતોંકો ફર્ઝ સમઝકર અમલ કરના પડતા હય.

આપકા નશીહતકા તરીકા સુરીયાના થા, ઓર યેહી સબબથા કે મુસલમાનોંકે ઇલાવા બહોતસે હિંદુભી સચ્ચેદીનસે મુશર્રફ હોકર આપકે મુરીદ બનને લગ ગએ. આપને નશીહતોંકે લીયે હિંદુઓકે શાસ્રોંકાભી ઇલ્મ હાસિલ કીયા થા ઓર ઉસમેંસેભી મગજ નિકાલકર "**ઈશાઅતે ઈસ્લામ**" કા આલા દરજ્જેકા કામ કીયા હય. આપકે ચંદ કલામાત આખિરમેં દરજ કરનેમેં આએ હેં, જીસસે આપકે આલા તરીકકા કુછ ખ્યાલ આ સકતા હય.

આપકે ફરઝંદ ગુજરાતકે હરેક કસબેમેં ઓર ગાંવમેં ફેલે હુવે હેં ઇસી તરાહ મુરીદભી ગુજરાત, કાઠિયાવાડ, દખન, ખાનદેશ, કચ્છ વગેરા હરેક જગે ફેલે હુવે હેં.

નવ મુસ્લિમ મુરીદ લોગ કે જો ઇમાનલાકર ઇસ્લામસે મુશર્રફ હોતેથે. તો ઉનકો અપને અપને કબીલોંકી તર્ફસે તરાહ તરાહકી ઈઝાએ દેનેમેં આતીથી, ઓર નવમુસ્લિમ મુરીદ આપકો તમામ કેફીયત અર્ઝ કરતેથે,

realpatidar.com

https://archive.org/details/bk099/page/n84/mode/1up

realpatidar.com

યેહી વજાહથીકે આપને સંવત ૧૫૮૦ મેં પાટીદાર મુરીદોંકે એક ગિરોહકો કચ્છકી જાનિબ જાનેકા હુકમ કીયા. કચ્છકા મુલ્ક ખુશ્ક હય, મગર ઝમીન કસ્વીર હોનેકી વજાહસે આપને કચ્છકી ઇજાઝતદી. દુસરે ગિરોહકો જીલ્લે કાનમમેં રવાના કીયા, ઔર તીસરે ગિરોહકો જીલ્લે સુરતકીતર્ફ રવાના કીયા.

આપકી દુઆ કે તુફૈલ મુરીદોંકી અવલાદ ખુબ ફલી ફુલી, ઔર કચ્છમેં તો લાખોંકી તઆદાદ હો ગઇ, ઔર ચંદ સાલસે તો કચ્છકે મુરીદ લોગોંમેંસે બહોતસે લોગ, સિંધ, મુંબઇ, પંચમહાલ, ખંભાતસ્ટેટ, વગેરા વગેરા મુલકોંમેંભી ફૈલ ગએ હેં જો ઝમીને રખકર ખેતીબારી કરતે હેં ઔર તિજારતભી કરતે હેં.

આપકી વફાતકે બાદ, આપકે પોતે હઝરત પીર અશરફશાહ (રેહ) મુરીદોંમેં ગએથે, ઉસ અરસેમેં આકિલમીયાં નામી એક શખ્સને પીરાનામેં આકર ગદ્દીકા દાવા કીયાથા, ઔર કેહને લગાકે મેંભી હઝરત પીર ઇમામુદ્દીન (રેહ.) કી અવલાદમેંસે હું. યેહ ખબર હઝરત અશરફ શાહકો હુઇ તો મુરીદોંમેંસે આપ બમુકામે પીરાના તશરીફ લે આએ. ઔર બાદશાહે દિલ્હી ઔરંગઝેબસે દાદ ચાહી. યેહી વજાહથી કે બાદશાહને આપકો ઔર આકિલમીયાં કો દિલ્હી બુલવાએ. ઔર આપસે કહા, કે આપ કેહતે હેં કે હમ હઝરત પીર ઇમામુદીન (રેહ.) કી અવલાદસે હેં. તો આકિલ મીયાંકાભીતો યેહી દાવા હય, ઇસલીયે આપકે પાસ અગર કોઇ સનંદ હય તોં રૂજુ કરો. વર્ના લોહેકે ગરમ કઢાવ પરસે ગુઝરકર મસ્જીદમેં નમાઝ અદા કરો ? આપને સિજરે મુકદસકો જેબસે નિકાલકર બાદશાહકો દીયા, ઔર ફરમાયા, " અય બાદશાહ તેરા યેહભી અરમાં બાકી ન રહે ! દે, ગરમ કડાવ પરસે જાનેકોભીમેં તૈયાર હું. "

realpatidar.com

https://archive.org/details/bk099/page/n85/mode/1up

1933-12-21 -Twarikhe Pirzada ImamShahi (99)

realpatidar.com

આપકે ઇમ્તિહાનકા રોઝ જુમેરાતકા મુકર્રર કીયા. ઓર આપ જુમ્મે રાતકે રોઝ બાદશાહે દિલ્હી કે સાથ મસ્જીદકી તર્ફ રવાના હુવે. મસ્જીદકે કરીબ પહોંચે તો એક બડા લોહેકા કઢાવ ગરમ હો રહાથા, બાદશાહને આપકો કહા, હઝરત ઇસ કઢાવમેં કદમ રખતે હુવે મસ્જીદમેં આઓ. આપને બિસ્મીલ્લાહ, બોલકર કઢાવમેં કદમ રખ્ખા. શાને ઇલાહીથી કે કઢાવ શર્દ હો ગયા. આપ મસ્જીદમેં તશરીફ લે ગએ. ઓર નમાઝ ગુઝારી, આપકા નમાઝકા યેહ હાલથા કે આપ રૂકુઅમેં ઓર સીજદેમેં જાતે થે તો મસ્જીદકે દોનોં મિનારેભી રૂકુઅ ઓર સીજદે મેં જાતેથે. (આપકો યેહ ફેઝ અપને બુઝુર્ગવાર દાદા પીર ઇમામુદ્દીન (રહે.) સે હાસિલ થા.)

બાદશાહે દિલ્હી ને જબ યેહ હાલ દેખાતો બહોત ખુશ હુવા, ઓર આપકી બડી ઇઝ્ઝતકી. કુછ નઝરાનાભી પેશ કીયા. ઓર હઝરત પીર ઇમામુદીન (રેહ.) કે સચ્ચે વારિસ હો, એસાયકીન હો ગયા, ઓર યેહી સબબથા કે ઓરંગઝેબ બાદશાહને પીરાનાકી ૪૫ વીંઘા જમીનકા પરવાના લીખ દીયા, ઓર આપકે સીજરે મુકદસ પર બાદશાહી મહોર લગાદી.

ઇસીતરાહ કદીમ રિયાસતોં કે કદમ બકદમ ચલકર આલાહુઝુર ના. બ્રીટીશ સરકારકી તર્ફસેભી ચીરાગ બત્તીકે લીયે સાલાના મુકર્રર રકમ દીજાતી હય, ઓર ગદ્દીવાલે કાકાકો હથીયારબંધી કે કાનુનસે રિહાઈ દેનેમેં આઈ હય.

શ્રીમંત સરકાર ગાયકવાડ વાલીએ રિયાસતે બડોદાકી તર્ફસેભી,, પીરાનાકી દરગાહ શરીફકે મરતબેકી ખાતિર જીલ્લે કાનમમેં બહોતસી ઝમીન દેનેમેં આઇ હય. જો અભી તકકે મવજુદ હય, હઝરત પીર અશરફશાહ (રેહ.) કામઝાર બ મુકામે ધોલકા મેં " લાકડા કુઇ " નામી જગે હય, વહાં ઝયારત ગાહ હય,

realpatidar.com

https://archive.org/details/bk099/page/n86/mode/1up

realpatidar.com

હઝરત પીર ઇમામુદ્દીન (રેહ.) કી વફાત હી. સ. ૯૧૯ મેં બમુકામે પીરાનામેં હુઈ. ઔર મઝાર શરીફભી પીરાનામેં ઝયારતગાહ હય. આપકા ઉર્સ શરીફ રમજાન મુબારિક્કી તા. ૨૭ કો બડી ધામધુંમસે હોતા હય, ઉસરોઝ ખત્મે કુરાન શરીફ, મીલાદ, વગેરેકા બહોત બડા જલસા હોતા હય.

આપકે મઝારસે હુનુઝ ફેઝ જારી હય, ઔર કરામતેં ઝહુરમેં આતી હેં. ઇ. સ. ૧૯૨૫--૨૬ મેં કચ્છકી જમાઅતમેં ચંદ આર્ય સમાજીઓટાં ને બદગુમાની ફેલાનેકી કોશીષ કીથી, ઇસલીયે કંઈ મુરીદોંમેં (જો સાલાના દશોંત ભેજા જાતા હય, વોહ પેસા રોક દીયા.) બદગુમાની ફેલાઇ.

સાહેબે અકલ મુરીદોંને કહા કે ઇસ તરાહકા કામ કરના ઠીક નહીં હય. હાં અગર તુમકો કોઇ, કરામતકા દેખના મંઝુર હય, તો ઇસ મુરિદોંસે જાકર અહેમદાબાદમેં મુકીમ રહો. ઔર તીન રોઝમેં કુછ કરામત ઝહુર હુઇ સુનનેમેં આએતો ઠીક, નહીંતો તમામ પેસા લેકર ચલે આઓ.

બદગુમાની મુરીદોંને યેહ રાય મંઝુરકી ઔર દશોંતકા તમામ પેસા લેકર અહેમદાબાદ આએ. ઔર પીરાનાકી દરગાહકે માતેહત કે બંગલે મેં મુકામ કીયા. દુસરે રોઝ રાતકો કંઇ બદગુમાની અકાબરોંકો ખાબમેં હુકમ દીયા, "કે **જાવ, પીરાનામેં જાકર ગંગ કુવેસે**" મેરી કરામત દેખો.

તીસરે રોઝ સુબ્હો ઉઠતેહી યેહ મુરીદલોગ અપને અપનેમેં ગુફતગુ કરને લગે. આખિર મોટરોંમેં બેઠકર પીરાના રવાના હુવે.

પીરાના પહોંચકર ગંગકુંવેકી તર્ફ ગએ. તો કયાદેખતે હેં કે ગંગકુ-વેકી અતરાફકી ઝમીનસે ફુંવારેકી તરાહ બહોત ઝડપસે પાની નિકલરહા હય ઔર તલાસ કરનેસે માલુમ હુવા કે આજ દોરોઝસે બિલાનાગાહ પાની જારી હય. ઔર ઇસપાનીમેં યેહ તાસીરથી કે કેસાભી મરીઝ હો ઉસકે ઇસ્તિમાલ કરનેસે સફા પાતાથા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n87/mode/1up

realpatidar.com

યેહ ઝબરદસ્ત કરામત પીઝમાનેમેંભી દેખકર, આર્યસમાજીષ્ટોંકે બરગીલાએ હુવે. બદગુમાની મુરીદોંકે હોશોહવાશ દુરસ્ત હોગએ ઓર મઝારશરીફ પર જાકર તમામ રૂપીઆ રખદીયા, ઓર અપને કીયે આમાલોંસે પશેમાન હોકર માફી માંગને લગે ઓર તોબાહ કરને લગે.

ઇધર ગંગકુવેકા પાનીભી (દરગાહમેં દશોંત રખતેહી) બંધ હુવા, યેહ વાકેઆ ઇસ તવારીખકે મુસન્નિફનેભી અપની આંખોંસે દેખા હુવા હય, ઓર ઇસિ વાકેઆકો નઝરોંસે દેખનેવાલે ઓરભી સેંકડો શખ્સ મવજુદ હેં.

આપને કલામેપાકમેંસે અકોંમગજ છાન છાનકર અપને મુરીદોંકો આશાનીસે નશીહત કરને કે વાસ્તે એક બડીકિતાબ તૈયાર કી હય. જીસકા નામ " સતવાની " (સચ્ચાકલામ) રખ્ખા હય ઉસમેં કે ચંદ કલામાત હરએઝેલ હેં.

કલમો કહો ભાઇ મુનીવરો, અને મત જાઓ તમે ભુલ.
જે રાહ નબીકી સાચ હે, તે સદારે હે કબુલ. ૧
અલ્લાહે ન્યામત ભેજીયા, ઇસ દુનિયા કે બીચ.
રોઝા, નમાઝ, કરે બંદગી, પણ કલમો ન્યામત ચીઝ. ૨
હેતે પ્રીતે મન ભાવશું, અને જપો અલ્લાહ રસુલ,
કલમો કહો દિલ સાચશું, તો ક્રોડો વિઘ્ન હોએ દુર. ૩
નબીસો દાતા જીવકા, અને કલમો કહો પોકાર,
જેણે માન્યાતે બેહેશ્તી હુવા, બાકી ભુલ્યા મુર્ખ ગમાર, ૪
જે કોઇ વણકલમે કરે બંદગી, જેસા ધૂલ ઉપર લીંપણ થાર્ત,
આજ અલ્લાહ નબીકો ધાઇએ. અને સુણો મોમીન વાત ૫
જેણે કલમો ના કહ્યો, એને નબીએ કહા પુકાર
તેને ઉંધે મસ્તકે ટાંગસે, ભાઇ દોજખને દરબાર ૬

realpatidar.com

https://archive.org/details/bk099/page/n88/mode/1up

realpatidar.com

જેણે કહાનબીકા નાસુણા, અને કલેમા નાકીયો કબુલ
તેના મુખમાંહી ફરીસ્તા ડાલશે, ભાઇ દોજખકેરી ધૂલ ૭
જેણે મુખ કલેમા નાકહા, નબીકા નજાના નામ,
તેના મુખ જેસા ભુંડકા તેના દોજખમાંહી ઠામ. ૮
ભાઇ નામ અલ્લાહકા મીઠડા, જેસી સાકર દુધ.
કલેમા કહો દીલ સાચશું. ભાઈ તેમ તેમ આવે બુદ્ધ. ૯
પાંચે કાલ વશ કરીને, અને દીલ રાખો ઠામ.
જે કલેમા કહે દીલજાનથી, તેને દોજખની આંચ હરામ.૧૦
ભાઈ મોમીન દીલ માંહે ચાંદરણાં, અને અલ્લાહ નબીકારેપીંડ
એ કલેમાની દોસ્તી, તેના હ્રદયમાંહે ઉઘડયા કમાડ.૧૧
કલેમા કહે મુનીવરો, અને મુરખ ભુલે રે કાંઇ
જેને મહોર છે બેહેશ્તની, તેને નબી વસ્યા દીલમાંહી.૧૨
મનનિર્મળકરીનેસેવીએ, અને હ્રદયમાંલીજીએઅલ્લાહનુંનામ
મોમીન કલેમા મીઠડા, જેમ લોભીકો મીઠારે દામ.૧૩
કલેમા કહો કીંમત શું, અને હું, હું, બાજી છોડ
માયા મનથી દુર કરી, ભાઇ પ્રીત અલ્લાહ શું જોડ૧૪
ના કલેમા કહે, રોજા, ધરે, અને ગેરહક કણ ખાએ.
ભાઇ બુરા ફેલ તજે નહીં, તે તો મહાદન માંહે કુડાએ.૧૫
પાંચે વિક આ દિલમાંહે વશનહીં, અને કુડી નજરે જોય
કલેમાની કીંમત ના બુઝે, તે જીવ બહેશ્તી કેમ કરી હોય.૧૬
ભાઈ કલેમાતણી કીંમત બુઝે, અને અલ્લાહ નબીકો ધ્યાએ.
જે મનમાંહી મર્તક હોય રહે, તે મોમીન બેહેશ્તી કહેલાએ૧૭
ભાઇ કહેણી રહેણી સાચશું. અને હકની રોટી ખાય,
જે રોજા, નિમાઝ, કરેબંદગી, ભાઈ તેથી બહેશ્તમાંહે જાય,૧૮

realpatidar.com

https://archive.org/details/bk099/page/n89/mode/1up

realpatidar.com

ભાઇ ધનદેશ અને ધન નબીંકુ, અને ધન ધન તે નરને નારી
જેણુ નબી આંખુ દેખ્યા, તે લોકોંકી બલી હારી૧૯
ગતમાંહે નબી બેસતા, અને કલેમા કહ્યોરે સુણાએ
તે લોકોની બલીહારી, જે દીદાર અલ્લાહકા પાએ૨૦
જે ધનધન લુણી માત પીતાકું, ધન કુટુંબ પરિવાર ભાઇ
જેણુ નબી આંખુ દેખ્યા, તે લોકોંકી બલીહારી,૨૧
નબી મોહંમદ જુગમેં આયા, અને ઇશ કલેમથી તર્યા
જો ઇમાન અલ્લાહ સું રાખીએ, ભાઇ કાફિર થઇ ના મરીએ.૨૨
કલેમા કહો અલ્લાહ રસુલના, જે કાટે જીવોના પાપ,
દુનિયા સર્વ ફના થશે, તારે રહેશે કરીમ આપ,૨૩
ભાઇ જેણે કલેમાના કહ્યો, અને નબી, ના જાણ્યારેનામ
તેના ઘોડા શિરછત્રો હોશે. તેને દોજખમાંહી નહીં ઠામ.૨૪
ભાઇ જેણુ કલેમા ના કહેયા, અને તીસમુખ દીતીઆગ.
એ કલેમાની દોસ્તી, ઉપર કહીએ દુરૂદ સફાઅત.૨૫
આગ બલે અવશકન થાએ, અને જુગમાંહે બેસી બહાત.
જેણુ મુખથી કલેમા ના કહેયા, તેને આગળ આગ સંગાત.૨૬
જન્નત ખડકી ખોલીએ, અને ઉઘડે બહેશ્તના કમાડ
મોમીન હશે તે જાણશે, ભાઇ શું જાણે ગાફિલ ગમાર.૨૭
બહેશ્ત દરવાજા ખોલવા, અને કુંચી કલેમા જાણ
જો પાંચે મંત્ર જાણીએ, ભાઈ અથર્વ વેદ માંહે નિર્માણ.૨૮
ભણેગોર ઇમામશાહ સુણો મુનીવરો, અને કલેમોકહોરે પોકાર
અથર્વવેદને વાયકેચાલીએ,ભાઇ તોપણ કલેમાવિના નહિંઠામ.૨૯

realpatidar.com

https://archive.org/details/bk099/page/n90/mode/1up

realpatidar.com

આપકે ચંદ કલામાત દેખનેસેહી માલુમ હોજાતા હય, કે આપને બીલકુલ સુફીયાના તરીકસે ઇસ્લામકી તાલીમ ઓર તલકીન કી હય, આપને અથર્વ વેદકા જો ઇશારા બતલાયા હય. વોહ પાક કલામ સેહી સરોકારો રગબત દીખાઈ હય. આપકે મીશનકી ગેરમુસ્લિમોંકો સમઝાનેકી યેહ એક આલા તરકીબ થી, કે જીસકે ઇસ્તિમાલસે બગેર લાલચો રોકટોક કે હઝારો ગેરમુસ્લિમ, ઇસ્લામકી દાવત ઓક ઓક કુબુલકર ઇસ્લામમેં દાખિલ હોતે થે.

હઝરત પીર બાકરશાહ (રેહ૦)

આપ હઝરત પીર ઇમામુદ્દીન (રેહ૦) કે શાહબઝાદે હેં. આપકા મઝાર શહેર અહેમદાબાદમેં "જુને ચાર ટોડે કે" કબ્રસ્તાનકે કરીબ હય. મઝાર શરીફકી ચારોંતર્ફ કિલ્લા હય, ઓર અંદર એક મુસાફિરખાના હય, આપકે મઝારશરીફકા તમામ કારોબાર શહેરકી મોમીન જમાઅતકે સુપુર્દ હય, આપકે ઉર્સશરીફ કે વકત શહેર અહેમદાબાદ કે બહોત લોગ જમે હોતે હેં, ઓર મજલીસો ન્યાઝ હોતી હે.

હઝરત પીર ખાલીક-શાહ (રેહ૦)

હઝરત પીર ખાલીકશાહ (રેહ.) આપભી હઝરત પીર ઇમામુદ્દીન કે સાહબઝાદે હેં આપકા મઝાર શ્રીમંત્ત ગાયકવાડ સરકાર કે મહેસાણા પ્રાંતકે પાટણ શહેરમેં હય, ઓર તમામ કારોબાર સૈયદખાની સાદાતોં કે સુપુર્દ હય, આપકા ઉર્સ રજબ મહીનેકી તા. ૧૫ વીંકો હોતા હય, જીસમેં શહેરકે હિંદુ-મુસલમાન શરીક હોતે હેં. ઓર કોમ કોમકા ઇખ્લાસો મહોબ્બતકા અચ્છા સબક મીલતા હય.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n91/mode/1up

1933-12-21 -Twarikhe Pirzada ImamShahi (99)

realpatidar.com

હઝરત પીર બાલેશાહ (રેહ૦)

હઝરત પીર બાલેશાહ (રેહ.) આપભી હઝરત પીર ઇમામુદ્દીન (રેહ.) કે શાહબઝાદે હેં એક વકત આપ અપને વાલિદ બુઝુર્ગવાર કે સાથમેં દોરેપર નીકલે થે, જબ આપકા ખંભાત મુકામ હુવા ઉસ વકત ખંભાતમેં કંઇ દિન હોનેકે બાદ એક લડકેસે આપકો દોસ્તી હોગઈ શાને ઇલ્લાહી થી કે વોહ લડકા મરગયા. ઇસલીયે ઉસકે માબાપ ઓર રીસ્તેદાર લોગ જમે હોકર માતમ કર રહે થે. આપકાભી ઉસ લડકે કે મકાનપર ગુઝર હુવા. તમામ કો માતમ કરતે હુવે દેખકર આપને ફરમાયા, કયા બાત હય ! લોગોંને અર્ઝકી, કયા આપકો નહીં માલુમ જો આપકા દોસ્ત થા વોહ મરગયા હય. ઓર ઇસિલીયે યેહ તમામ માતમ કરતે હેં.

આપકો યેહ કેફીયત માલુમ હોતેહી જઝબા આગયા, ઓર થર્રાને લગે. ઓર બે સાખ્તા લડકેકા નામ લેકર પુકારા. શાને ઇલાહીથી કે મરાહુવા લડકા ઝિંદા હોગયા. ઓર દોડકર આપકે સાથ ખેલનેકો રવાના હોગયા. યેહ કરામત દેખકર તમામ લોગ બહોતખુશ હુવે. ઓર યેહ કરામતકા શોહરા તમામ શહેરમેં બીજલીકી તરાહ ફેલગયા. આપકે વાલિદ બુઝુર્ગવારકો ખબર હોતેહી આપકો બુલવાએ. ઓર ફરમાયા કે, " **એસા કરનેસે શરીઅતમેં રખના પડતા હય** " તુમ નહીં જાનતે કે અબ ઇસ લડકેકે બદલેમેં તુમકો જાનદેના લાઝીમ હય.

આપને વાલિદ બુઝુર્ગવારકી જબ યેહ નશીહત સુની તો સોચમેં પડગએ, ઓર થોડીહી દેરમેં " અલ્લાહોઅકબર " કા નારા લગાકર કલેમા શાહાદત પઢતે હુવે, જાન અલ્લાહકે હવાલે કરદી. આપકામઝાર ખંભાતમેં " નારંગસર " તાલાબ કે કિનારેપર ઝયારતગાહ આમ હય. આપકે નઝદીક આપકી બહેન હઝરત શમ્સખાતુનકામઝાર હય.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk099/page/n92/mode/1up

realpatidar.com

હઝરત પીર નૂરમોહંમદ (રેહ.) આપભી હઝરત પીર ઈમામુદીન (રેહ.) કે બડે સાહબઝાદે હેં, આપકી
હઝરત પીર નૂરમોહંમદ વાલિદા સાહબાકા ઇશ્મગીરામી જીવનબીબી
(**રેહ.**) થા, વોહ સુલતાન હશન અફગાન કી નેક દુખ્તરથી આપ હામેલાથીં રાતકો ખાબમેં દેખા કે એક શખ્સ પુકાર કર કેહરહાહય, "અયનેક બીબી તુમકો એક ફરઝંદ બહોત બડા સાહબે કરામત પેદા હોગા."

આપકી વિલાદત હુઈ ઉસવકત તમામ મકાન ગોયા નુરસે ભરા હુવા માલુમ હોતા થા, ઓર આપ ને ફોરન મગરીબકી તર્ફ રૂખ કરકે તીન છીંક ખાઇ ઓર કલામેપાક કી કંઈ આયતેં પઢીં, ઓર અલ્લાહ ઓર રસુલ (સ૦ અ૦) કી હમદોસના બયાન કી. પેદાઈશસેહી આપકી નાફ કટી હુઇથી ઓર સુન્નતભી કી હુઇથી આપ માદરઝાદ વલી થે.

આપકે વાલિદબુઝુર્ગવાર ફરમાતે હેં કે, યેહ શાહબઝાદે કી પેદાઇશ સેહી એસી કરામતેં દેખકર બહોતસી મસ્તુરાતેં મુઝે અર્ઝ કરતીથીં કે, યેહ શાહબઝાદા એસી પાક હાલતમેં પેદા હુવા, ઓર અભીસેહી કરામતેં ઝહુરમેં આને લગી, ઇસકા કયા સબબ હોગા ? આપને ફરમાયા કે અલ્લાહપાક અપને ખાસ બંદોંકો ઇસી તરાહ પેદા કરતા હય; યેહ તમામ ઉસીકા ફઝલો કરમ હય.

આપકી ઉમ્રશરીફ જબ છે દિનકી હુઈ તો વાલિદસાહબને મુરીદોંકો આપકે દીદારકે લીયે બુલવાએ. જબ તમામ મુરીદલોગ આપકે દીદારકો આએ ઉસ વકતભી આપને કલામેપાકકી બહોતસી આયતેં પઢીં ઓર અલ્લાહ પાકકી હમ્દોસના બયાન ફરમાઈ. ઓર મુરીદોંકો હિદાયત કી. બચપનહીસે યેહ કરામત દેખકર મુરીદ લોગ બહોત ખુશ હુવે. ઓર મોતેકદ હોગએ.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n93/mode/1up

realpatidar.com

આપકે વાલિદસાહબ હી૦ સ૦ ૮૭૮ મેં મુરીદોંમેં દોરેપર ભાવનગર ગએથે. ભાવનગરમેં રાજપુત પુંજાસિંહ નામી એક બહોત મશહુર શખ્સ થા વોહ ઈસ્લામકા મુનકર થા. મગર આપકી કરામતેં દેખકર ઈમાન લાયા. ઓર આપકા મુરીદ હુવા આખિર આપકે વાલિદ સાહબને ઉસકો પોયા કાકા કા ખિતાબ દીયા. ઓર જીલ્લે ભાવનગરકી જમાઅત ઉસીકો સુપુર્દકીથી. તાકેવકફીયતકે સબબ અચ્છા કારોબાર કરે, કંઈ દિન ગુઝરજાનેકે બાદ પોયાકાકાને હઝરતપીર ઈમામુદીનસે અર્ઝ ગુઝારીશકી કે, આપકે બડે ફરઝંદ નૂરમોહંમદ કે સાથ મેરી લડકીકીં શાદી કરદો. આપકે વાલિદ-સાહબને ખલીફાકીં અર્ઝ કુબુલ ફરમાઈ ઓર આપકી યાની હઝરત નૂર મોહંમદકી શાદી ઉસ ખલીફાકી લડકીસે કરદી. જીસકા નામ પ્રેમાબીબી થા.

આપકી **અવ્વલશાદી** સુલતાન મેહમુદ બેગડાકી લડકી બુઝુર્ગખાતુનસે હુઇથી. ઓર યેહ **દુસરી** ભાવનગરવાલે ખલીફાકી લડકીસે હુઇ.

અવ્વલકી બીવી યાની બુઝુર્ગખાતુનસેદો સાહબઝાદે હુવે. (૧) હઝરત મુસ્તુફા ઓર (૨) હઝરત શાહબુદીન ઇન દોનોં હઝરાતોંકી જો અવલાદ હુઇ વોહ "**સાદાતે ઇમામશાહી**" યા પીરઝાદા લકબસે મશહુર હય, ઓર યેહ સાદાતે પીરઝાદા, **પીરાના, અહમદાબાદ, પેટલાદ, સુરત,** ઓર કાનમ જીલ્લેમેં **અચાખલ, પુનીયાદ, ઝીથરડી, વેમાર,** વગેરા વગેરામેં મવજુદ હેં.

દુસરી બીવી, યાની પ્રેમાબીબીસે હઝરત સૈયદખાન ઉર્ફે સૈફુદીન પેદા હુવે. ઇનકી અવલાદકેસાદાત "**સાદાતે સૈયદખાની**" કે લકબસે મશહુર હેં. ઓર યેહ સાદાતોં કે મકાન **(૧) અહેમદાબાદ (૨) નવસારી (૩) બહાદરપુર** (બુરહાનપુર) વગેરામેં હેં. ઓર સબકેસબ ગદીવાલે ઓર સૈયદખાની જમાઅત કે પીર હેં. ઓર ઇનકી અવલાદમેંભી પુસ્તદરપુસ્ત કરામતેં ચલી આતી હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n94/mode/1up

realpatidar.com

આપકા યાની હઝરત પીર નૂરમોહંમદ (રેહ.) કા યેહ ફાની દુનિયા છોડ જાનેકા વકત કરીબ આગયા તો આપને મુરીદોંકો જમે કીયે ઓર ફરમાયા કે "મેં અબચંદ મુદ્દતમેં યેહ ફાની દુનિયા છોડજાનેવાલા હું ઇસલીયે સૈયદખાનકો બુલાઓ કયું કે, ઇનકી મુલાકાતકી મુઝે ઝુરૂર હય."

મુરીદોંને અર્ઝકી કે વોહતો મુરીદોંમેં ગએ હેં. કયા માલુમ કોનસી જમાઅત તર્ફ ગએ હોંગે, વોહ કીસતરાહસે અભી આ સકતે હેં.

આપને ફરમાયા "સાહબે કરામત મશરીકમેં હો, ઓર ઉસકા વારિસ મગરિબમેં કયું નહો. મગર વફાતકે વકત વોહ ઝુરૂર આ મીલતા હય." તુમયાદ રખ્ખો કે સૈયદખાન આતી જુમા કે રોઝ ખેડાકી નદ્દીકે કરીબ મુકામ કરેંગે. ઓર અપને આનેકી ખબર યહાં કહેલાઇંગે.

બમુજબ આપકે ફરમાને કે હઝરત સૈયદખાન મએ મુરીદોં કે ખેડાકી નદ્દીકે કરીબ આ પહોંચે. ઓર વહાં મુકામ કરકે અપને વાલિદસાહબકી ખીદમતમેં અર્ઝ કેહલા ભેજીકે, "આપને મુઝે યાદ ફરમાયા હય, ઇસલીયે આયા હું" હુકમ હોંતો તમામકે સાથમેં આઉં વર્ના અકેલા હાઝિર હો જાઉં.

આપકે પાસ હઝરત સૈયદખાનકી તર્ફકા કાસિદ પયગામ લેકર હાઝિર હુવા. તો ઉસે આપને ફરમાયા કે સૈયદખાનકો બોલદો કે તમામ અસબાબકે સાથમેં મએ મુરીદોં કે ચલે આઓ. કાસિદને જાકર ફરમાન સુનાયા.

વાલિદ બુઝુર્ગવારકા ફરમાન સુનકર હઝરત સૈયદખાન બહોત ખુશ હુવે. ઓર તમામ અસબાબ કે સાથમેં બડી ધામધુમસે પીરાના આગએ. ઉસવકત આપકે પાસ બહોત હાથી, ઓર ઘોડેભી થે. ઓર હાથી કે ઉપર નકકારે બજતે થે. જો નકકારે અભી પીરાનામેં મવજુદ હેં.

આપ પીરાના આકર વાલિદ બુઝુર્ગવારકી ખીદમતમેં દસ્તબસ્તા હાઝિર હુવે. આપકે વાલિદ બુઝુર્ગવાર બહોત ખુશ હુવે. ઓર નસીહતો

realpatidar.com

https://archive.org/details/bk099/page/n95/mode/1up

realpatidar.com

વસીયત કે બાદ દુઆદી. કે " આજસે તાકયામત તુમારી અવલાદ કે ઘરોં કે દરવજ્જોંસે ઘોડોંકી લાદ* ન હટેગી. ઓર તુમારી અવલાદમેં કોઈ †ગોદલેગા તો ઉસકી ચાર પુશ્ત ચલકર બંધ હો જાયગી. '

આપકે ફરમાન કે મુતાબિક ગોદલેનેસે સૈયદખાની સાંદાતોં મેં દોતીન વાકેઆત (પીરાના વ બહાદરપુર) બનચુકે હેં

આપકી વફાત તા. ૨૧ માહે રજબ હી. સ. ૯૪૦ મેં બમુકામ પીરાના મેં હુઈ આપકો વાલિદ બુઝુર્ગવાર કે રોઝે મેં મદફુન કરનેમેં આએ હેં આપકેભી ચંદ કલામાત પેશ કરતા હું. જો હસ્બે ઝેલહેં

પહેલા સરજનહાર વખાણો,
અલ્લાહ નામ જપતાં શક ન આણો. ૧
જીસસે રહેગા દુજા ફેરા.
જો તુમ જાનો બહોત બોહતેરા, ૨
દુજા સત નબીકા સાચા,
જેસી કરની વેસી વાચા, ૩
જીભીયા આંખો સુરીજન ભાવા,
સચ્ચા થા શોતો કેડે ધાવા. ૪
જગ સારા જેણે ઝુઠા કરીજાણ્યા,
સો આપણે સુરીજન સાથસીધાણ્યા: ૫
સતકી બાતેં જીસને સાચીજાની;
ગેરસો અપને દીલ ન આની: ૬
અવર બિદ્દત ધાવે લાગા,
ગફલત લોકે ચોક નજાગા. ૭

---

* બહોત સુખી રહોગે. † પીસરે ગેરકો વારિસ મુકર્રર કરના.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n96/mode/1up

realpatidar.com

નવસો બરસ જગ ભયે રસુલાં,
સાચે મારગ કોઈ ન ભુલા. ૮
મોઢે દીનને દીલમાં હે ખોડી,
રસુલ ચલે સો બાટાં છોડી. ૯
સત સાંખે કેમ પારજપાઇએ,
જીસથી સત તે કેડે જાઇએ. ૧૦
સચ્ચી બાટ રસુલકી,
અને સાચા ચેહી શેરરે, ૧૧
જે કોઇ ચાલ્યા સતવિના,
સો પડયા મોટે ફેરરે. ૧૨
નબી મોહંમદ જુગમાં આએ,
તીસથી ચાંદરણા મારગ પાએ ૧૩
બાટ સીધી સો ઉન્હેં દીખલાઈ,
રીત રસમ સબ શાહકી પાઈ. ૧૪
પંથી કોઈ ખોટા ના હોવે,
ચંદરણે મારગ સબકોઇ જોવે. ૧૫
તીસ અજવાલા આગલકિના,
જે જીવ જાએ પ્રેમમાંહે ભીના. ૧૬
"સતવેણી" તીસ ધરીઆ નામ,
જીસઘર પીયુકા પાઈએ ઠામ, ૧૭
સીધક મુરશીદ આપણા,
કહેતા સો કહીઆ બોલરે. ૧૮
બાટ જો સાચી સતકી,
સો આજ દીખલાઈ બોલરે, ૧૯

realpatidar.com

https://archive.org/details/bk099/page/n97/mode/1up

realpatidar.com

હઝરત પીર સૈયદખાન (રહે.)

હઝરત પીર સૈયદખાન (રેહ.) આપ હઝરત પીર નુરમોહંમદ કે સાહબઝાદે હેં આપકી વિલાદત પીરાનામેં હુઇથી. આપકા લકબ સૈયદ સૈફુદીન થા, આપને બારા સાલકી ઉમ્રમેં અરબી, ફારસી, તમામ ઇલ્મ હાંસિલ કીયા થા ઓર કાશી જાકર સંસ્કૃતભી હાંસિલ કીયાથા. હી. સ. ૯૪૪ મેં આપ પીરાનાસે બંદરસુરતકી તર્ફ તશરીફ લેગએ. ઓર હઝારહા ગેર મુસ્લિમોંકો સચ્ચે દીન પર લાએ. ઓર મુરીદ કીએ.

ઇસી અરસેમેં આપને બુરહાન પુરકા સફરકીયા. ઓર બુરહાનપુરમેં કામિલ તીન મહિને રહે, યેહી અરસેમેં આપને કર્ણાટક ઓરચીનાપટ્ટમકે અહાતે તકભી સફર કીયા. ઓર ઇશાઅતે ઇસ્લામ મેંકામયાબી હાંસિલકી. ઇસીતરાહ પાંચ સાલ ઇશાઅતે ઇસ્લામકા કામ કરતે રહે, આખિર ગુજરાતકી મોમીન જમાઅતકી અર્ઝ ગુઝારીશ સે, આપ ગુજરાતકી તર્ફ વાપિસ આએ. મોમીન જમાઅતભી આપકે દીદારસે બહોત ખુશ હુઇ. ચંદ મુદત કે બાદમેં આપને પીરાનામેં તા. ૨૬ જમાદી ઉલ અવ્વલ હી. સ. ૯૯૬ મેં વફાત ફરમાઇ.

આપકા મઝાર હઝરત પીર ઇમામુદીન (રહે) કે મઝારકે સામને બાજુમેં હય. ઓર સૈયદખાની સાદાતોંકીં માતેહત મેં હય. આપને સંસ્કૃત તાલીમ લેને કે બાદ ગેર મુસ્લીમોંકો નશીહત કે લીયે કંઇ દફતર ઝેં દફતર લીખ્ખે હે જીસમેં સે આપકે ચંદ કલામાત હસ્બે ઝેલમેં દરજ કરતા હું.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n98/mode/1up

realpatidar.com

એજી હુંરે પ્યાસી પીયા તેરે દર્શનકી
આશા પુરાવો પીયા મોરે મનકી ૧
એજી સુનો મેરે કંથ કીયા મેરા કીજે
મુજ નારીસું અબોલા યું ના રીજે ૨
એજી જલબીના મછલી સો પીયા બીન કયું રેવે
પીયાજી કે કારણે. સો જીવડા દેવે. ૩
એજી ઝુઠીરે પ્રીત ભ્રમરકી કહીએ,
પીયાકા દર્શન યું નવ લઇએ. ૪
એજી સાચીરે પ્રીત પતંગકી કહીએ
પીયુજીકા દર્શન યું કર લઇએ. ૫
એજી હમારે પીયાપર સબહી વારીયા
પીયા મુજ દીજીએ વસંત પીયારીયા, ૬
એજી દીદારી હોવે સો એસા ચહાવે,
સાહેબકો છોડકર ઓર કો ન ધાવે, ૭
એજી યતીમદાસીસું એસા ન કીજીએ,
મારા અવગુણ હોય સો ગુણ કરી લીજીએ, ૮
એજી નહીં કુછ હોવે સો દાસી કહાવે
અપને સાહેબ કો એસાહી ભાવે ૯
એજી એક મન થઈ સાહેબસું રહીએ
હેત સો રંગ એસા લઇએ ૧૦
એજી પ્રેમતત્વ એસા ન દેખું કોઈ
સાહેબ રીઝે કરીએ ભી સોઇ ૧૧
એજી હમ ગુનાહગાર બંદાભી તેરા
સાર કરો સાહેબ મોરા સરેવા. ૧૨

realpatidar.com

https://archive.org/details/bk099/page/n99/mode/1up

realpatidar.com

હઝરત પીર સાલેહ (રેહ.)

હઝરત પીર સાલેહ (રેહ.) આપ હઝરત સૈયદખાન કે સાહબ ઝાદે હેં. આપકે વાલિદને ચીનાપટ્ટમકા સફર કીયા થા, જબ આપકી વાલિદા સાહબાભી વહીંથી. ઓર આપકી વિલાદત ચીના પટ્ટમમેં હુઇથી. આપ કમશીન હીથે ઓર આપકે વાલિદ સાહબને વફાત ફરમાઇ. આપકો કમશીન દેખકર મુરીદ લોગ સમઝે કે આપ અબ ખીલાફતકા કામ બરાબર અંજામ નહીં દે સકેંગે ઇસી ગર્ઝસે મુરીદોંને કંઇ સવાલાત (શરીઅતો તરીકતકે) પૂછે ઓર જવાબ દરયાફ્ત કરના ચાહે, આપને તમામ સવાલોં કે માકુલ જવાબ દાયે. જીસસે મુરીદોં કો માલુમ હોગયા કે શેર કે બચ્ચોં કો ઉમ્રસે કુછ કામ નહીં. છોટે હો યાં બડે, મગર શેરહી કી ખાસીયત રખતે હેં. આપકી વફ્ત તા. ૧૫ રજબ હી. સ. ૧૦૨૧ મેં પીરાનામેં હુઇ. ઓર આપકા મઝાર વાલિદ સાહબકી બાજુમેં હય.

હઝરત પીર હાસમશાહ (રહે.)

હઝરતપીર હાસમશાહ (રેહ.) આપ હઝરત પીર સાલેહ કે ફરઝંદ હેં. આપકી વિલાદત તા. ૧૫ જમાદીઉલ અવ્વલ હી. સ. ૧૦૧૦ મેં પીરાનામેં હુઇથી બચપનહી મેં અપને વાલિદ બુઝુર્ગવારસે કરામતોંસે ફેઝયાબ હુવે, આપકે દાદા હઝરત પીર સૈયદખાન (રેહ.) કા મઝારભી આપકે વકતમેંહી બનાથા, આપકે યહાં એક સાહબઝાદા પેદા હુવા જીસકા નામ મોહંમદશાહ રખ્ખા. સાહબઝાદેકી ઉમ્ર બારાસાલકી હોતેહી આપને તા. ૧૫ સવ્વાલ હી. સ. ૧૦૪૫ મેં વફાત ફરમાઇ.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n100/mode/1up

realpatidar.com

હઝરત પીર દુલા મોહંમદશાહ (રેહ.)

હઝરત પીર દુલા મોહંમદશાહ (રેહ) આપ હઝરત પીર હાસમશાહ કે સાહબઝાદે હેં, આપકી વિલાદત હી. સ. ૧૦૩૩ મેં પીરાનામેં હુઇ, આપકી ઉમ્ર બારા સાલકી હુઇ ઉસવકત આપકે વાલિદ સાહબને વફાત ફરમાઇ ઓર ખીલાફતકા બારેગીરાં આપકે ઉઠાના પડા.

આપ હંમેશાં લાલરંગકે કમખ્વાબકે કપડે પહેનાં કરતેથે. ઓર આપકા યેહ તરીકાથા કે દિનકો રોઝા રખના ઓર રાતકો બેદારી કરના. ઓર અગલે દિનકા પહેના હુવા લિબાસ દુસરે દિન ફકીરોં કો દેદીયા કરતે થે. યેહી સબબ થા કે આપકો અવામ લોગ દુલા (નૌશા) કહા કરતે થે.

આપને અવ્વલ સફર, જીલ્લે ખાનદેશકા કીયા. ઓર એક જગે યાની સુલતાનપુરા કે પાસ " **લાછોરા** " નામીં ટેકરી કે ઉપર મુકામ કીયા. ઓર ખાંદીમકો પાની લાને કે વાસ્તે ભેજા.

આપકે ફરમાન કે મુતાબિક ખાદિમ પાની લેનેકો તાલાબપર ગયા, મગર વહાંતો ગેરમુસ્લિમોંકી એક બડી જમાઅત મવજુદથી જીન્હોંને રોકટોક કી, ઓર પાની લેને નદીયા. ઇસલીયે બગેરપાની કે ખાદિમ વાપિસ આયા. ઓર તમામ કેફીયત આપસે અર્ઝ કી.

આપને તમામ કેફીયત સુનકર ખાદિમ કે હાથસે પાનીકા કટોરા લેકર ઉલટ દીયા. ઓર ઝમીનપર રખ દીયા. ઉધર પાનીકા તાલાબ ખુશ્ક હોગયા. ઓર તમામ ગેર મુસ્લિમ દેખતેહી રહે કે પાનીકા કયા હુવા, આખિર ઉનલોગોંકી સમઝમેં આ ગયા કે, જો મુસલમાન પાની લેને આયા થા, ઉસકો રોકટોક કરનેકાહી યેહ નતીજા હય, અબ તો ઉસકો મીલકર માફી માંગના ચાહીએ. વર્ના પાની બગેર અપને, ઓર બચ્ચોં કે કયા હાલ ? ઇસી તસવીસમેં ફીરતે ફીરાતે ઉન્હોંને ટેકરી કે ઉપર આપકો પાયે, ઓર

realpatidar.com

https://archive.org/details/bk099/page/n101/mode/1up

realpatidar.com

સબકે સબ જમે-હોકર આપસે અર્ઝ કરને લગે કે હઝરત હમને બડી ગલતી કી હય. હમકો માફ કરો. ઔર તાલાબ ખુશ્ક હોગયા હય, ઉસકો અસ્લીયતપર લા દો. હમારે સાથ છોટે છોટે બચ્ચેભી હેં વોહ પ્યાસસે મર જાઇંગે,

આપકો યેહ બાત સુનકર રહેમ આયા, ઔર કટોરા પલટ દીયા. જીસસે તાલાબ પાનીસે તર હોગયા. આપને ઉન લોગોંકો ફરમાયા કે, અય લોગો પાની યેહ અલ્લાહકી મીલ્કીયત હય, ઉસને યેહ મીલ્કત અપને તમામ બંદોં કો મુફ્ત તકસીમકી હય ફીર કોઇભી ઝાત હો, ફીરતુમ કયું અપના કબઝા જમાએ હુવે થે આયંદા કભી એસા ન કરના.

આપને બાદ નશીહતકે ફરમાયા તુંમ સબ લોગ કહાં જાતે હો, ઉન્હોંને અર્ઝકી કે, હમ સબ કાશીકી જાત્રાકો જા રહે હેં. આપને ફરમાયા, અગર તુમકો કાશીકી જાત્રા યહીં હો જાય તો હમારી તાબેદારી કરોગે? લોગોંને અર્ઝકી મહીનોંકી મુસાફતકા મુકામ આપ યહીં બતાદો તો ફીર કયું તાબેદારી ન કરે. આપને ફરમાયા અચ્છા કલ સબકે સબ ઇધર ચલે આના.

દુસરે રોઝ સબકે સબ આપકી ખીદમત મેં હાઝિર હુવે. આપને અપના દસ્તે મુબારિક ઉંચા કીયા, ઔર ફરમાયા કે મેરી આસ્તીનકી તર્ફ નઝર કરો. દેખતે કયા હેં કે એક બડા દરવઝા નઝર આયા. આપને ફરમાયા ઇસમેં દાખિલ હો જાઓ. ઔર અલ્લાહકી શાન દેખો. મગર એક હફ્તેસે ઝયાદા ન રહેના.

આપકે ફરમાન કે મુજબ તમામ લોગ દરવઝેમેં દાખિલ હો ગએ, ઔર કાશીકી જાત્રા અચ્છી તરાહસે કરકરાકે એક હપ્તે કે બાદ અપની જગે પર મવજુદ પાએ.

આપકી યેહ ઝબરદસ્ત કરામત દેખકર તમામ ગેર મુસ્લિમ મુતાજ્જુબ હુવે. ઔર ખ્યાલ કરને લગે કે શાયદ હમકો ખાબમેં ધોખા તો ન દીયા

realpatidar.com

https://archive.org/details/bk099/page/n102/mode/1up

realpatidar.com

હો, આપને ફરમાયા, અય બદયકીન, દીલોં મેં ક્યા સોચ રહે હો. જો બાતકા ધોખા નઝર આતા હય ઉસકી તલાસ કર સકતે હો. યેહ સુનકર વોહ બડે હેરાનો પરેશાન હો ગએ. ઓર અપને અપને મેં કેહને લગે કે અપને દીલોંકી બાતભી હઝરત જાનતે હેં.

આખિર ઉન લોગોંને એક શખ્સકો કાશી રવાના કીયા. ઓર તમામ યહીં ઠેહરે રહે. કાશીસે જબ વોહ શખ્સ રૂકકા લેકર આયા ઓર દેખા તો તમામ કેફીયત સહી માલુમ હુઇ અબ તો તમામકો આપ પર કામિલ યકીન હો ગયા. ઓર ઇસ્લામસે મુશર્રફ હોકર આપકે મુરીદ બનગએ.

આપને યહાંસે બુરહાનપુરકા સફર કીયા, જબ દરીયાએ તાપી પર પહોંચે તો બહોત લોગ જમે થે, યેહ હાલ દેખકર ખાદિમકો ફરમાયા કે દેખો યેહ ક્યા મઝમા હય. ખાદિમને તમામ હાલાત દેખકર અર્ઝકી કે યહાં "ગણેશ" કી મુર્તિ હય ઓર યેહ સબ લોગ ઉસકી પૂજા કરનેકો આએ હેં. આપ યેહ સુનકર જહાં લોગ જમે થે વહાં તશરીફ લેગએ. ઓર ગણેશકી મુર્તિ પર સવાર હોગએ ઓર ફરમાને લગે " અય પત્થર કે હાથી, તું મગરિબકી તર્ફ ચલ તાકે તેરે પૂજનેવાલે તુઝે દેખેં ઓર ઇબરત હાંસિલ કરેં " આપકા યેહ ફરમાન હોતેહી ગણેશકી મુર્તિને મશરિકસે મગરિબકી તર્ફ મુંહ ફેરા, ઓર ચલને લગી. ઓર દરીયાએ તાપી તક પહોંચકર પાની પીને લગી. આપને ઉસકો યહીં ઠેહરે રેહનેકો ફરમાયા, જો અભીભી વહાં મવજુદ હય. ઓર યેહ આપકી કરામત સમઝકર બહોતસે મુરીદ લોગ ઉસકો દેખને કો જાતે હેં.

આપકી યેહ કરામત દેખકર યહાંભી તમામ ગિરોહ ઇસ્લામસે મુશર્રફ હુવા. ઓર યેહ ખબર બુરહાનપુરકે સુબા અબ્દુર્રહીમઆશેરી કો હુઇ તો આપકો લેનેકે લીએ ખુદ આયા, ઓર આપકો બડી ઇઝ્ઝત કે સાથ શહેર મેં લે ગયા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n103/mode/1up

realpatidar.com

આપ બુરહાનપુરમેં મુકીમ હોકર રેહને લગે. ઓર તમામ મુરીદઃ લોગભી આપકે દીદારકો આને જાને લગે. યહાં તકકે આપકી કરામતેં દેખકર ઓરભી કંઇ લોગ મુરીદ હોગએ. ખુદ સુબા. અબ્દુર્રહીમનેભી અપની લડકી મિસરીબેગમકી શાદી આપકે સાથ કરદી.

શાદીકે વકત આપકો સુબેદારને તીન હાથી, ચાલીસ સવાર, ઓર તીનસો સીપાઇ દીએ. આપ હરમહીનેકી તા. ૧૦ ઓર ૧૪ કો વાઅઝ ફરમાતેથે. જીસમેં તમામ મુરીદ શરીક હોતે થે. ઓર ફેઝ હાસિલ કરતે થે. આપકો પાંચ સાહેબઝાદે ઓર એક શાહબઝાદી થી.

(૧) સૈયદ બાકરશાહ (૧) બીબી ઝેબુન્નીસાં.
(૨) સૈયદ કબીરશાહ
(૩) સૈયદ સાલેહ
(૪) સૈયદ મીરનશાહ
(૫) સૈયદ શાહજીમીયાં.

આપકી વફાત તા. ૨૫ રજબ હી. સ. ૧૦૬૦ મેં બુરહાનપુરકે કરીબ બહાદરપુરમેં હુઇ વહાં આપકા મઝાર શરીફ કાબિલે દિદ ઓર ઝયારતગાહ હય. યેહ દરગાહ સૈયદખાની સાદાતોંકી માતેહતમેં હય.

આપકે ચંદ કલામાત. ઝેલમેં દરજ હેં.

એજી ભમર ગુફારે દેખતા, ભાઇ કહો કેસા ગુન હોએ.
જગ જગ જોત જલહલે, અને વસંત નુરાની સોએ.
એજી ધીરે ધીરે રે ભાઈ મોમનો અને ધીરે તે સબ કુછ હોય
માલીરે સીંચે ચોગણા ભાઇ રૂત બીના ફલ ન હોય.
એજી શરીઅત હક કરી જાણીએ, તો તુરત તરીકત પાય
હકીકત દીલમાંહે નકશીએ તો મારફતે મીલીજાય.
એજી સૈયદ મહંમદશાહ આંખે વેનતી તમે સાંભલો રબસત્તાર
હી બન્દો ગુનાહગાર હએ સાઈઆં બકસી એ બકસણ હાર

realpatidar.com

https://archive.org/details/bk099/page/n104/mode/1up

realpatidar.com

હઝરત પીર અલી-કબીર (રહે.)

હઝરત પીર અલી કબીર (રેહ.) આપકી વિલાદત શહેર બુરહાનપુરમેં હુઈથી અપને વાલિદ હઝરત પીર હાસમશાહ (રેહ.) સે તમામ ઝાતકા ઝાહિરી વ બાતિની ઇલ્મ હાંસિલ કીયા થા.

આપ જબ નવસારી તશરીફ લાએ ઉસવકત હઝરત પીર નુરમોહંમદ (રેહ) ઉર્ફે સૈયદ સાદાતકા મઝાર સૈયદ નુરશાહ સુરત વાલોંકી માતેહતમેં થા, આપને સરકારમેં દાદ ચાહી. આખિર ઇન્સાફ હુવા કે " યેહ દરગાહ સૈયદખાની સાદાતોંકી માતેહતમેં હોના ચાહીએ." યેહ ફેસલા હોનેસે આપ નવસારીકી ગદ્દીપર મુકીમ હુવે.

આપ એક વકત દોરેપર નીકલે ઓર બારડોલી તાલુકે કે વાંકાનેર નામી ગાંવમે તશરીફ લેગએ ઇસગાંવમેં બંદરોંકા ઇતના ઝોરથા કે તમામ તુલ ખા જાતે થે. મોકા દેખકર મુરીદોંને આપસે અર્ઝ ગુઝારી કે આપ દુઆએ ખેર કરો જીસસે તમામ બંદર હમારે યહાંસે ચલે જાએં ઓર તુલ કો નુકશાન ન કરેં.

આપને ફરમાયા, " ઇન્શા અલ્લાહ બરોઝે જુમા તમામ બંદર તુમારે ખેતોંકા અહાતા છોડકર ઓર ગાંવકી તર્ફ ચલે જાઇંગે "

આપ બાદલ જુમા તમામ મુરીદોંકો સાથમેં લેકર ખેતોંકી તર્ફ ગએ ઓર તમામ બંદરભી આપકે પાસ આ આકર રૂજુ હો ગએ. આપનેં દેખા કે તમામ બંદર આ ગએ હેં, તો હરેકકો એકેક કેલા દે દીયા. ઓર ફરમાયા કે, તુમ સબ ઇન લોગોંકે ખેતોંકા અહાતા છોડકર ઓર જગે ચલે જાઓ તાકે ઈન લોગોંકી ખેતી બારીકો જરર ન પહોંચે. યેહ ફરમાન સુનતેહી સબકે સબ બંદર વહાંસે ઓર જગે ચલે ગએ, તો મુરીદ લોગ બહોત ખુશ હુવે. ઓર અલ્લાહકી શુક્ર ગુઝારી કરને લગે.

આપકી વફાત નવસારીમેં હુઇ ઓર હઝરત પીર સૈયદુરસાદાત કે પાસ મદફુન કીયે હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n105/mode/1up

realpatidar.com

હઝરત પીર અલીસગીર (રેહ)

હઝરત પીર અલી સગીર (રેહ) આપને તમામ ઇલ્મ અપને વાલિદ સાહબ હઝરતપીર અલીકબીર (રેહ) સે હાસિલ કીયાથા. આપસેભી તરાહ તરાહકી કરામતેં ઝહુર મેં આતી થીં. એક દફા આપ બારડોલી તાલુકા કે વરાડ નામીં ગાંવમેં તશરીફ લે ગએથે યેહ ગાંવકે કુંવોમેં પાની બહોત કમ હો જાતાથા, ઓર લોગોંકો બહોત તકલીફ હોતીથી. ઇસલીયે મુરીદ લોગોંને આપસે અર્ઝ કી કે હમારી યેહ મુશ્કીલ દૂર કરો. યેહ હકીકત સુનકર આપ ગાંવકે એક બડે કુંવે પર ગએ ઓર અંદર દેખને લગે. શાને ઇલાહી થી કે કુવેસે પાની ઉબલને લગા ઓર કુવા ભરગયા, સાથમેંહી ઓર કુવોંમેંભી પાનીકી બડી બરકકત હો ગઇ.

આપને ફરમાયા ઇનિશાઅલ્લા અબ તુમ પાનીકો જીસતરાહ અપને કામમેં લોગે ઇસતરાહ ઉસમેં તરકકી હોતી રહેગી. કમ નહોગા. આપકી દુઆ કે તુફેલ કુવોંકા પાની હંમેશાં ભરા હુવા રેહતા હય. કમ નહી હોતા. આપકી વફાત નવસારીમેં હુઇ ઓર આપકો હઝરત પીર સૈયદુસ્સાદાત (રેહ) કે પાસ મદફુન કરનેમેં આએ હેં.

હઝરત પીર બાલે મોહંમદશાહ (રેહ.)

હઝરત પીર બાલે મોહંમદશાહ (રેહ) હઝરત પીર શાહજી કે શાહબઝાદે હેં આપકે વાલિદ કે બારે મેં અહેમદાબાદ કે સુબા સુજાતખાંને બાદશાહે દિલ્હીકો (ઔરંગઝેબ) લીખ ભેજા થાકે, હઝરતશાહજી સાદાત હેં મગર કંઇ કામ કુફ્રકે કરતે હેં યેહી સબબથા કે આલમગીરકા ફરમાન હુવા કે સૈયદ સાહબકો હમારે પાસ ભેજ દીયે જાએ.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n106/mode/1up

realpatidar.com

યેહ ફરમાન હોતેહી સુબેદાર સુજાતખાંને આપકો પીરાનાસે અહેમદા-બાદ બુલવાએ. આપને સોચાકે ગુજરાતકે લોગ બહોત હસદ કરને વાલે હેં, ઓર કીસીને મેરે લીયે બાદશાહકો નરમ ગરમ સમઝાયા હોગા. અગર મેં નહીં જાઉંગા તોભી ઠીક નહીં હય, યેહ સોચકર આપ અહેમદાબાદ તશરીફ લાએ.

અહેમદાબાદ મેં રાતકો આપ મુકીમ થે, ઓર અલ્લાહસે અર્ઝ કરને લગે " યા બારે તઆલા મેરેસે જો કામ હોતે. હેં ઓર લોગ ઉસકો કુફ્રકા કામ માનતે હેં, વોહ તૂ બહોત ઠીક જાનતા હય, દિલ્હી જાકરભીતો એક ઇન્શાનસેહી ઇન્સાફ પાના, ઇસસે તો યેહી બેહતર હય કે તૂહી મુઝે અપને પાસ બુલવાલે " આપકે યેહ કલામ ખત્મ ન હુવેથે કે તા. ૧૦ માહે સવ્વાલ હી. સ. ૧૦૫૩ મેં આપકી રૂહ મુબારિક પરવાઝ કર ગઈ. આપકો પીરાના લે જાકર મદફુન કીયે.

આપકી વફાતકી ખબર મુરીદોંમે ઓર અવામમેં ફેલ ગઈ. ઓર રાતકી રાતમેં યેહ વાકેઆ બનનેસે તમામકો શક ગુઝરાકે સુબેદાર સુજાતખાંને કુછ ન કુછ દગા કીયા હય. ઇસલીયે સબ કે સબ મુરીદ લોગ (જીલ્લે સુરત કે) કસાસ લેનેપર આમાદા હો ગએ. ઓર ગિરોહ કે ગિરોહ જમે હોને લગે. યહાંતકકે બચ્ચોંસે લેકર બુઢોં તક તમામ લડાઇ કરને પર આમાદા હો ગએ.

માસિવા નકદ રકમકે બાકી તમામ, ચીઝોંકો છોડકર ઝબરદસ્ત તૈયા-રીકે સાથ અહેમદાબાદકી તર્ફ રવાના હુવે. ઓર દરીયાએ નર્મદા કે કરીબ ભરૂચ બંદર તક આ પહોંચે. ઓર કીસ્તીઓંમે બેઠકર સામને કીનારે ઉતર ગએ. યેહ ખબર ભરૂચકે હાકિમકો હોતે હી ઉસને રોકટોક શરૂ કર દી. મગર ફૌઝુલ. હાકિમ કામયાબ ન હુવા, ઓર મારા ગયા, ઓર કિલ્લાભી ચલા ગયા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n107/mode/1up

realpatidar.com

યેહ લોગોં કે હાથ જબ કિલ્લા ભરૂચ આગયા તો શહેર કે લોગોં કો ઝરાભી તકલીફ હોને નપાએ, યેહ ખ્યાલ રખકર કબઝા લીયા ઓર હઝરત પીર શાહજી (રેહ.) કે શાહઝાદે હઝરત પીર બાલે મોહંમદશાહ (રેહ.) કો ગદ્દીપર બીઠાકર સજ્જાદાનશીન ઝાહિર કીયા ઉસ વકત આપકી ઉમ્ર ગ્યારા સાલકી થી.

ભરૂચ કે વાકેઆકી તમામ કેફીયત બડોદા પહોંચી તો વહાંકા સિપેહ-સાલાર મએ ફૌજ કસીરકો લેકર ઇન લોગોંકો રોકને કે લીયે આ પહોંચા. મગર ઇસ વકતભી સિપેહ સાલારકોભી ફતેહ હોના દુશ્વારથા. કયું કે યેહ કિલ્લા એક આલીશાન ટેકરીકે ઉપર થા ઓર દુસરી તર્ફ દરીયાએ નર્મદા ઓર અઠારા હઝાર મુરીદ લોગોંકી તાઅદાદથી. યેહ માંમલા દેખ-કર સિપેહસાલાર વાપિસ ચલા ગયા. ઇસી તરાહ કામિલ છે મહીને નિકલ ગએ.

આખિર ગુજરાત કે કંઇ રાજે મહારાજાઓંકી મદદસે એક બડા ઝબરદસ્ત લશ્કર ચઢઆયા. ઓર બડી સફ્ફાકી કે સાથ મારકાટ ઠન ગયા. ઓર બહોતસી ખુનરેઝીકે બાદ પાંચસો મુરીદ ઓર હઝરત પીર બાલે મોહંમદશાહ (રેહ.) કો ગિરફતાર કરકે દિલ્હી ભેજ દીયે ગએ.

યેહી વજાહ હયકે આપકે મુરીદ લોગ "**મતીયા**" કેહલાતે હેં. કયું કે અપને પીર કે લીએ માલો દવલતકી પરવા ન કરકે અપને મત પર આકર પ્યારી જાને કુરબાન કરકે શહીદ હોગએ.

હઝરત પીર બાલે મોહંમદશાહ (રેહ) કો દિલ્હી ભેજ દીયે ગએ વહાં બાદશાહને આપકી બડી ઇઝ્ઝતકી ઓર આપકી ના બાલિગ ઉમ્ર દેખકર કાઝી અબ્દુલ્લાહ કે વહાં પઢને કો ભેજ દીયે. આપકે સાથમેં બાદશાહકા લડકાભી થા. ચંદ મુદત હોને કે બાદ દોનોંમેં દોસ્તી હો ગઇ. કંઇ મુદત કે બાદ બાદશાહઝાદે ને આપસે કહાકે આપતો પીરઝાદા હેં, મેરે હકમેં દુઆએ ખેર કરો તાકે મેં બાદશાહ હો જાઉં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n108/mode/1up

realpatidar.com

આપને ફરમાયા, " ઇનશાઅલ્લાહ, આજસે આઠવેં રોઝ તુમ દિલ્હીકે બાદશાહ હો જાઓગે. " શાને ઈલાહીથી કે આઠવેં રોઝ એસાહી હો ગયા. બાદશાહઝાદા ખુદબાદશાહ હો ગયા. ઓર આપકો બડી ઇજ્જતો નવાઝીશ કે સાથ પેશ આયા, ઓર આપકો અપને વતનકો પહોચા દીયે.

આપ પીરાનામેં આકર મુકીમ હુવે, જબ આપકી શાદીકી તૈયારી હોને લગી, મગર યેહી અરસેમેં આપકી સોતીલી વાલિદા સાહબા માજીરાજે તાહેરાં કે સાથ કીસી સબબસે અનબન હો ગઇ. ઓર આપને નારાઝ હોકર મુલ્ક દખ્ખનકી સીમ્ત સફર કીયા. ઓર ગુલબર્ગા (હૈદ્રાબાદ) શહેર મેં તશરીફ લે ગએ. ઓર વહાં. હી. સ. ૧૦૪૬ મેં આપને વફાત ફરમાઈ.

આપકી શાદી તો હુઇ નથી, ઇસલીયે અબ કીસકો ગદ્દી પર બીઠાના ચાહીએ, ઇસબારેમેં તકરીર હોને લગી ઉસ વકત ગુજરાતકી સૈયદખાની જમાઅત બીસ મુતવલ્લીઓંકી થી. નાઇત્તેફાકીકી વજાહસે યેહ જમાઅતકે તીન હિસ્સે હોગએ.

જો લોગ આઠ મુતવલ્લીઓંકી રાએ પર ચલે સો **આઠીયે** કહેલાએ. સાત મુતવલ્લીઓંને રાએદી કે હઝરતકી લાશકો ગુલબર્ગાસે લાકર પીરાનામેં મદફુન કરકે રોઝા બનાના ચાહીએ. ઓર ઈસી તરાહ કીયા. ઇસલીયે વોહ **સાતીયે શેખ** કેહલાએ. ઓર બાકી પાંચ મુતવલ્લીઓંને રાએદી કે, અપને તો માજીરાજેતાહેરાં કોહી માનના ચાહીએ. ઓર માનને લગે વોહ **પાંચીયે** કેહલાએ. ઓર અભીતકભી યેહ તીન જમાતેં યેહી લકબસે મશહુર હેં, ઓર આઠીયોંકી, સાતીયોંકી, ઓર પાંચીયોંકી યેહ જગાએં અભી પીરાનામેં મવજુદ હેં. ઓર સૈયદખાની સાદાતોંકી માતેહતમેં હેં, જો અપના અપના કારોબાર કરતે હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n109/mode/1up

realpatidar.com

હઝરત પીર શહાબુ-દ્દીન (રેહ૦)

હઝરત પીર શહાબુદ્દીન (રેહ૦) આપ હઝરત પીર ઇમામુદ્દીન કે પોતે હેં. ઓર હઝરત પીર નૂરમોહંમદ (રેહ) કે સાહબઝાદે હેં, આપ અપને વાલિદ બુઝુર્ગવારકે મુરીદ ઓર ખલીફા હેં આપકી અવલાદમેંભી બડે બડે સાહેબે કરામત બુઝુર્ગ ગુઝરે હેં, આપસેહી ઇમામશાહી સાદાતોમેં "**સાદાતે જલાલશાહી**" નામકા સીલસીલા જારી હય, આપકી વફાત પીરાનામેં હુઇ આપકા મઝાર અપને દાદાકે રોઝેકી બાજુમેં હય.

હઝરત પીર મુસ્તફા (રેહ૦)

હઝરત પીર મુસ્તુફા (રેહ૦) આપભી હઝરત પીર ઇમામુદ્દીન (રેહ) કે પોતે ઓર હઝરત પીર નૂરમોહમંદ (રેહ) કે સાહેબઝાદે હેં આપ બહોતસી બાતોમેં અપને વાલિદ બુઝુર્ગવારકે મુસાબા થે, આપ બહોત નરમદીલ ઓર ખુશ મીઝાજ થે. ઓર નફીલેં કસરતસે અદા કીયા કરતે થે. આપકે યહાં એક સાહેબે કરામત શાહઝાદેકી વિલાદત હુઇ. ઓર ઉસી રાતકો હુઝુર સરવરે કાએનાત હઝરત મોહંમદ મુસ્તફા (સ૦ સ૦) ને ખ્વાબમેં આપકો બશારત દી થીકે યેહ લડકા બડા સાહેબે કમાલ હોગા. ઓર ઇસકા નામ નૂરશાહ રખના. આપ સુબ્હેકે વકત બેદાર હુવે, તો માલુમ હુવા કે આપકે યહાં ફરઝંદ પેદા હુવા હય, આપને ઉસકા નામ નૂરશાહ રખ્ખા આપકી વફાત પીરાનામેં હુઇ.

હઝરત પીર નૂરશાહ (રેહ૦)

હઝરત પીર નૂરશાહ (રેહ.) આપ હઝરતપીર મુસ્તફા કે શાહેબઝાદે હેં. આપકી વિલાદતકી ખબર બશારતસે હુઝુર પુર અનવર (સ૦અ૦) ને આપકે વાલિદ બુઝુર્ગવારકો દીથી.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n110/mode/1up

realpatidar.com

આપને તમામ ઝાહિરી વ બાતિની ઇલ્મ અપને વાલિદ સાહબસે હાંસિલ કીયા થા, ઔર ઇખલાસો મોહબ્બત ઔર ઈબાદતમેં એક આલા દરજ્જે કે બુઝુર્ગ ગુઝરે હેં જો શખ્સ આપકી મુલાકાત લેતાથા વોહ ગોયા આપકો અપનાહી સમઝતાથા.

ઇમામશાહી સાદાતોંમેં જો સીલસીલા મુલકબ **"નૂરશાહી સાદાત"** કા જારી હય. વોહ આપસેહી જારી હુવા, આપકી ઝબરદસ્ત કરામતેં દેખકર બહોત લોગ આપકે મુરીદ હુવે. જીનમેંસે અભીભી અહેમદાબાદ, સુરત વગેરામેં મવજુદ હેં ઔર અપને આપકો નૂરશાહી મોમન જમાઅત કેહતે હેં બડે રોશન ખ્યાલ હેં. રોઝા, નમાઝ વગેરાકે પાબંદ હેં. ઔર બડે બડે સાહેબે માલભી હેં.

અભી કંઇ મુદતસે અહેમદાબાદવાલી મોમન જમાઅત આપકી અવલાદકે સાદાતોંકો કુછ ન કુછ ફેઝ પહોંચાને કે ખ્યાલસે બહોત અચ્છા ઈંતેઝામ કર રહી હય. યેહ જમાઅતને એક માકુલ રકમ મુકર્રર કર રખ્ખી હય, વોહ તીસરી યા પાંચવીં સાલકો " સાદાતે નૂરશાહી " કો નઝરાને કે તોર તકસીમ કરનેમેં આતી હય, કયા ખૂબ કારોબાર હય.

આપકી કરામતોં કે બારેમેં અતરાફ કે લોગ અજીબ અજીબ બાતેં બયાન કરતે હેં હુનુઝભી આપકે મઝારસે મુરાદવાલે મુરાદે પાતે હેં. આપકી વફાત પીરાનામેં હુઇ. ઔર આપકા મઝાર હઝરત પીર ઈમામુદીન (રેહ;) કે મઝારકી બાજુમેં રોનક અફરોઝ હય. આપકે ઉર્સકે વકત અહેમદાબાદસે નૂરશાહી જમાઅત કે મોમન આતે હેં. ઔર મીઠ્ઠાઇ ન્યાઝ વગેરાકા તમામ કારોબાર કરકે બહોત ખુશી મનાતે હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n111/mode/1up

realpatidar.com

હઝરત પીર ફતેહ-ઉલ્લાહ (રેહ૦)

હઝરત પીર ફતેહઉલ્લાહ (રેહ૦) આપ હઝરત પીર નુરશાહ (રેહ૦) કે સાહેબઝાદે હેં આપ બડે સાહબે કરામત ગુઝેરે હેં. આપકે ચાર ફરઝંદ થે. (૧) હઝરત પીર શાહ દરવેશ (૨) હઝરતપીર કાસિમશાહ (૩) હઝરતપીર ફઝલેઅલી ઉર્ફે બાબા મજનુ (૪) હઝરતપીર વલીયુદીન, આપકે ફરઝંદ સબકે સબ સાહેબે કરામત ગુઝરે હેં.

હઝરત પીર વલીયુ-દીન (રેહ૦)

હઝરત પીર વલીયુદ્દીન (રેહ૦) આપ હઝરત પીર ફતેઉલ્લાહ (રેહ૦) કે ફરઝંદ હેં. આપભી બડે સાહેબે કરામત ગુઝરે હેં. આપકો મુરીદ લોગ વલનશાહકે નામસેભી પહેછાનતે હેં. આપકા મઝાર અપને દાદાકે મઝાર કે સહનમેં હય.

હઝરત પીર નિઝા-મુદ્દીન (રેહ૦)

હઝરત પીર નિઝામુદીન (રેહ૦) આપ હઝરત પીર વલીયુદીનકે સાહેબઝાદે હેં, આપભી બડે સાહેબે કરામત ગુઝરે હેં.

હઝરત હાઝર બેગ (રેહ૦)

હઝરત હાઝરબેગ (રેહ૦) આપ બાદશાહઝાદે હેં. હઝરતપીર ઇમામુદીન (રેહ૦) કી કરામતેં દેખકર આપનેભી ફકીરી અખત્યાર કરલી. ઓર હઝરત કે સાથમેંહી બાકી ઝીંદગી બશર કરનેકી અર્ઝ કી. ઇસલીયે હઝરતને આપકો અપને રફીકો મદદગાર બનાકર સાથમે રખ્ખે. ઓર પીરકએ ખિલાફત દેકર ખલીફા મુકર્રર કીયા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n112/mode/1up

realpatidar.com

હઝરત પીર ઇમામુદ્દીન (રે૦) કી વફાતકા વક્ત કરીબ આગયા તો આપને હાઝર બેગ, નાયા નશીરૂદ્દીન, ભાભારામ ઔર કીકીભાઇ યેહ ચારોંકો બુલાકર ફરામાયા કે " તુમ ચારોં સાદીકુલ ઇમાન હો., ઔર ઇશાઅતે ઇસ્લામમેંભી મેરે રફીકો ગદદગાર રહે હો ઇસકા બદલા અલ્લાહ પાક તુંમકો ઝુરૂર દેગા, અબમેં ચંદ દિનોંમે યેહ ફાની દુનિયા છોડજાને વાલા હું, મગર તુમ દાવતે ઇસ્લામ કો જારી રખના, " યેહ નશીહત કે બાદ હાઝર બેગકો ફરમાયા કે તુમભી મેરી વફાત કે બાદ થોડેહી દિનોંમેં વફાત પાઓગે. ઔર મેરે મઝારસે બીસ કદમકે ફાસિલેપર સહેનમેં મદફુન કીયે જાઓગે. લેકિન કેસીભી કડાકેકી ધૂપ હોગી મગર તુમારી કબર હંમેશાં ઠંડી રહેગી. ઔર મેરે તમામ મુરીદ પેહલે તુમકો ફુલ ફાતેહા કરનેંકે બાદ પીર મેરે મઝાર પર આઇંગે.

આપકી વફાતકે બાદ થોડેહી દિનોમેં હઝરત હાઝરબેગ (રેહ૦) કી વફાત હુઈ. ઔર આપકી વસીયત કે મુતાબિક સહેનમેં મદફુન કીયે ગએ હેં. અભીભી પેહલે ફુલ ફાતેહા હઝરબેગકોહી હોતા હય, ઔર સખ્તમેં સખ્ત ગરમીકી મોસમ હોને પરભી કબર હંમેશાં ઠંડી રહેતી હય. ઔર આપકે મઝારપર લોહેકી બેડીભી પહેનાઇ જાતી હય.

હઝરત નાયા નશીરૂદ્દીન (રેહ૦)

હઝરત નાયા જાતકે ભીલથે ઔર વોહ ઝબરદસ્ત લુટેરોંકી ગિરોહકે મુકાદમ થે. હઝરત પીર ઇમામુદ્દીન (રેહ૦) અહેમદાબાદસે બેલ ગાડીમેં બેઠકર ગીરમથાકી તર્ફ તશરીફ લે જા રહે થે. ઉસી વકત યેહ મુકાદમ આપકો લુટનેકે લીયે આયા, ઔર આપકી ગાડી રોકીથી. ઉસવકત આપને ફરમાયા, " અય લુટેરોંકે મુકાદમ તૂં જો એસે ગુનાહ કર રહા હય, ઔર લોગોંકી માલો દવલત લુંટતા હય, ઇસકે ગુનાહોમેંભી તેરે ઘરવાલે હિસ્સાદાર હોનેકે લીએ કુબુલ હેં યા ખાલી

realpatidar.com

https://archive.org/details/bk099/page/n113/mode/1up

realpatidar.com

માલો દવલતસેહી રાઝી હેં " યેહ તો તલાસ કર. આપકા ફરમાન સુનકર મુકાદમ બોલા વાહ, આપ ઠીક રાસ્તા નીકાલ રહે હેં, મુઝે ઘર રવાના કરને કે બાદ આપ ખુશીસે ભાગ સકતે હેં. મગર મેં એસા બે સમજ નહીં હું, કે આપકે ધોકેમેં આ જાઉં.

આપને ફરમાયા અય લુટેરોંકા મુકાદમ તૂ ખાતિર જમા રખ, મેં અલ્લાહ ઓર ઉસકે રસુલ (સ૦ અ૦) કો ગવાહ રખકર કેહતા હું કે, તૂં ઘરસે વાપિસ નહિ આએગા વહાંતક મેં એક કદમભી આગે ન જાઉંગા..

આપકે યેહ કલામ સુનકર ઉસકો તસલ્લી હુઇ, ઓર અપને મકાન પર ગયા. ઓર ઓરત ઓર બચ્ચોંસે કેહને લગા કે, મેં જો લુટકા પેશા કરતા હું ઓર માલો દવલત લાતા હું સો તુમ ખાતે પીતે હો. અગર યેહ કામ બુરા હય. ઓર ગુનાહ હોતા હય તો ઇસ ગુનાહોમેંભી તુમ હીસ્સેદાર હો યા નહીં ? સબકે સબને યેહ જવાબ દીયા કે, હમ ગુનાહોંમેં હરગીઝ શરીક નહીં હો સકતે, તુમ, જેસી કમાઇ કરકે લાતે હો હમ ખાતે હેં વર્ના બુરા ભલા જો કરે સો પાવે.

આપકી કરામતને ઉસકો વોહ અસર કીયા, કે ઉસીવકત બુરાભલા સમઝનેકી સનાખ્ત હોગઇ. ઓર અપને કીયે આમાલોંસે શરમીંદા હોકર રંજો મલાલ કરતા હુવા આપકે પાસ આકર દસ્તા બસ્તા હાઝિર હુવા તો કયા દેખતા હય કે, આપ વાદેકે મુવાફિક બરાબર ઠેહરે હેં. યેહ દેખકર દીલહી દીલમેં કેહને લગા કે, અલ્લાહવાલોંકે નઝદીક મેરે જેસે કંઇ લુટેરે મીલકરભી જરર પહોંચાના ચાહે તો વોહ બેકાર હય. યેહી ખ્યાલ ચલ રહે. થે કે બે સાખ્તા બોલ ઉઠાકે "લાઇલાહા ઇલિલલ્લાહો મોહંમદુર્ રસુલુલ્લાહ." ઓર આપકા મુરીદ બનગયા. આખિર યેહી લુટેરા આપકી ખિદમતમેં રેહનેસે આપકા ખલીફા બન ગયા.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n114/mode/1up

realpatidar.com

મેરે દાદા ઈમામુદ્દીનકી કરામત દેખીયે.
એક આનકી આનમેં ચોરેંકો રંગ દીયે.

નાયા, ઘર ગયા. ઓર મએ અપને ઘરવાલોંકે તમામ એશો અકારીબકો આપકી ખીદમતમેં લે આયા, ઓર અર્ઝ કરને લગાકે તમામકો મુસલમાન બનાકર આપ મુરીદ બનાલો ઈસી તરાહ નાયાકા તમામ કુંબા મુસલમાન હુવા ઓર નાયાકો ઈસ્લામમેં કામિલ પાયા તો આપને ઉસકો બુઝુર્ગીવાલા કાકા કા ખિતાબ દીયા. ઓર ઉસકા નામ નશીરૂદ્દીન રખ્ખા. ઓર ફરમાયા " તુમ કાનમ જીલ્લેકે કુકસ નામીં ગાંવમેં જાવ. ઓર વહાં રેહકર ઈશાઅતે ઈસ્લામ કરો. " ઉસી વકતસે હઝરત નાયા નશીરૂદ્દીન કુકસમેં રહે આપકી વફાત મોહર્રમ કી તીસરી તારીખકો હુઈ, આપકા રોઝા કુકસ મેં હય, ભાદરવા સુદ ૨ કે રોઝ ઉર્સ ભરતા હય, કુકસકી ગદીપર નએ કાકાકો મુકર્રર કરનેકા અખ્તયાર વેમારકે સજ્જાદાનશીનકો હય, યહાંભી લંગર જારી હય, ઓર શ્રીમંત સરકાર ગાયકવાડ મહારાજા સાહબકી તર્ફસે ચિરાગી કે લીએ જીલ્લે કાનમમેં કરીબ ૭૦૦ વીઘાં ઝમીન પલતી હય.

હઝરત ભાભારામ (રેહ૦)

હઝરત ભાભારામકા અસલનામ રામજી હય યેહ સાહબ કસ્બે પેટલાદકે રેહનેવાલે હેં ઓર ઝાતકે પાટીદાર હેં. એક રોઝ હઝરત પીર ઈમામુદીન (રે૦) કી કરામતોંકી તારીફ સુનકર, ખીદમતમેં હાઝિર હુવે. ઓર અર્ઝ કરને લગે કે " યા વલીઅલ્લાહમેં બઝરીએ આપકે, અલ્લાહકી દરગાહમેં મકબુલ હોના ચાહતા.હું" યેહ અર્ઝ કર કલેમા પઢકર મુસલમાન હુવે ઓર આપકે મુરીદ હુવે.

આપને ફરમાયા, " તુમ અલ્લાહપાકસે ઉમ્મીદ રખ્ખો વોહ રહીમો કરીમ હય, ઉસકા ફઝલો કરમ હોતે દેર નહીં લગતી, તુંમારી ઉમ્મીદ પુરી હોગી. "

realpatidar.com

https://archive.org/details/bk099/page/n115/mode/1up

realpatidar.com

આપકી ખીદમતમેં રેહનેસે થોડેહી દિનોંમે ભાભારામકી રૂહાનીતાકત ઝલક ઉઠી. ઔર આપને જબ દેખા કે અબ ભાભારામ કુછ બનગયા તો અપના ખલીફા બનાકર ખીરકએ ખીલાફત અતા ફરમાયા, ઔર ઉનકો ચરોતર જીલ્લેમેં ઈશાઅતે ઈસ્લામકે લીયે મુકર્રર કીયા ભાભારામ નડીયાદ તાલુકે કે દેવાનામી ગાંવમેં ગએ ઔર વહાં રેહકર હઝરતકે ફરમાન કે મુંતાબિક ઇશાઅતે ઈસ્લામ કરતે રહે ઔર દેવામેંહી વફાતભી ફરમાઈ. યહાંભી લંગર જારી હય, ઔર યેહ ગદીભી **પીરાનાકી આલીશાન ગદીકી શાખ** ગીની જાતી હય ઔર માતેહતમેંભી હય.

હઝરત કીકીબાઈ સાહબા આપ ભાભારામ સાહબકી બહેન હય,

હઝરત કીકીબાઈ સાહબા.

ભાભારામકી નશીહતોંસે જો લોગ ઇસ્લામ લાએ ઉસમેં આપ અવ્વલ દરજ્જેમેં ઇમાન લાઇથીં. કંઇ દિનોંકે બાદ આપકો હઝરતપીર ઈમામુદીન (રેહ.) કી ખીદમતમેં હાઝિર હોનેકા શોક હુવા. ઇસલીયે ભાભારામ કે સાથ પીરાના ગઇ ઔર હઝરત કે દીદારસે મુશર્રફ ફેઝયાબ હુઇ. તો હઝરતને ફરમાયા જાવ, તુમ એક નયા ગાંવ બસાકર વહાં રહો ઔર ઇશાઅતે ઇસ્લામ કરો.

પીરાનાસે આકર આપને **રોણ** નાંમી ગાંવ બસાયા, ઔર તાલીમો તલકીન કરના શરૂ કરદી ઇનકી તાલીમો તલકીનકા અસર અકસર કરકે ઔરતોંમેં ઝયાદા હુવા. ઔર ઔરતેં ઝોક ઝોક ઈસ્લામમેં આને લગીં.

આપને રોણમેં વફાત ફરમાઇ, યહાંભી લંગર જારી હય, યેહ જગેભી પીરાનાકી માતેહતમેં હય ઔર **પીરાનાકી ગદીકી શાખ** ગીની જાતી હય.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n116/mode/1up

realpatidar.com

નવસારીકી દરગાહ શરીફ કે સજ્જાદાનશીન કે કુછ હાલાત.

સૈયદખાની સાદાતોંમેંસે નવસારીકે ગદીનશીન સજ્જાદાનશીન સૈયદ હાશમશાહને અપને વક્તમેં મુરીદોંમેં ઓર દરગાહ શરીફમેં બહોતસી આબાદી કી હય, મઝારપર હંમેશાં તરોતાઝા ફુલ ચઢાએ જાએં ઈસ ગર્ઝસે આપને થોડીસી ઝમીન લેકર બગીચા લગાયા હય, જો અભી મવજુદ હય.

આપને અપને વકતમેંહી, દરગાહશરીફકી આમદની કે મામલેમેં ખેશો અકારીબકી તર્ફ કે હિસ્સે, બખ્શીસેં, વગેરા હમાંકી તર્ફ સખ્ત નારાઝગી ઓર ઉઝરે અઝીમ બતાકર ફૈંસલા કરા દીયા હય, જીસસે દરગાહ શરીફકો કોઇ બાતકા અંદેશા રેહને ન પાએ. આપકી વફાત તા. ૧ જમાદીઉલ આખર હી. સ. ૧૩૧૯ મેં હુઇ, આપકી કબરપર મુરીદોંને ખુશનુમા રોઝા બનાયા હય, આપકે દો સાહબઝાદે હેં (૧) સૈયદ પ્યારે સાહબ. (૨) સૈયદ સદરૂદ્દીન. આપકી વફાત કે બાદ તા. ૨૫-૯-૧૯૦૧ ઈસ્વીમેં આપકે બડે સાહબ ઝાદા સૈયદ પ્યારે સાહબ સજ્જાદાનશીન કેહલાએ. જો અભી મવજુદ હેં.

મવજુદા સજ્જાદાનશીન સૈયદ પ્યારેસાહબને રીઝમાને કે મુવાફિક થોડી બહોત તમામ તાલીમ લી હય, મુરીદોંમેં ઓર અવામમેં, આપકી બડી ઇઝ્ઝત હય, આપકો ઇઝ્ઝતકે લિહાઝસે નવસારી કે મુસલમાનું ભાઇઓંનેભી **"અનજુમને ઇસ્લામ નવસારી"** કે પ્રેસીડેન્ટ બનાએથેહેં ઇસીતરાહ આપ શહેરકી મ્યુનિસિપાલીટી કે ચેરમેન, ઓર **ઓનરરીકી મેજીસ્ટ્રેટભી** હો ચુકે હેં, **અભી બરોડા સ્ટેટકી** જંથોંમેં **મુકીમ કૌન્સીલર હેં.** યહાંતકકે શ્રીમંત સરકાર ગાયકવાડ મ.લ, (૨) મલાવ રિયાસતમેંભી આપકો ઇઝ્ઝતકી નઝરોંસે દેખે જાતે હેં.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n117/mode/1up

realpatidar.com

સૈયદ સદરૂદીન સાહબ, આપ મવજુદા સજ્જાદાનશીન કે છોટેભાઈ હેં.

સૈયદ સદરૂદીન સાહબ. આપ અપને ખેશો અકારીબ કે ઇલાવા અવામ-લોગોંકોભી ફેઝ પહોંચાનેકી આરઝુ રખતે હેં. મુતરજ્જીમને ઇન હઝરતકી કંઈદફા મુલાકાત લી, જીસસે માલુમ હુવા કે, આપ બડે પરહેઝગાર, ઓર અલ્લાહીપર કામિલ યકીન રખને વાલોંમેંસે હેં, આપકે પાસ હિંદુ, મુસલમાન, પારસી વગેરા હરેક કોમકે લોગ આતે હેં ઓર ખુશ હોકર જાતે હેં. આપ ગોયા કે મુલાકાત કરનેવાલોં કે દીલોંમેં અપના ઘર કર લેતે હેં આપકા તરીકાભી ફકીરાની હય, સફફાફ મગર જાડે મોટે કપડે પહેનતે હેં, એશોઅશરત બહોત કમ, ઓર હિંદુ-મુસલમાન-પારસી વગેરા તમામભી અલ્લાહકે બંદે હેં. યેહ ખ્યાલ આપમેં બડા મઝબુત પાયા જાતા હય.

ગુફતગુ કરનેસે માલુમ હુવા કે ઇ. સ. ૧૯૩૦ સે આપને તમામ ઝાહિરી (દુનિયાકો દીખાને કે) કામ તરક કરદીયે હેં. ઓર મુરીદોંકી તાલીમો ઇસ્લાહકી તર્ફ તવજ્જો ફરમાઇ હય, આપને મુરીદોંકે લીએ દો કિતાબેં લીખના શુરૂ કી હેં. ઓર ઇસ કિતાબોંમેંભી મુરીદોંકી ઇસ્લાહકા ખ્યાલ મદ્દેનઝર રખ્ખા હય, અલ્લાહપાક આપકો ઇસકામમેં કતેયાબ કરે.

આપસે રૂહાની ફેઝભી જારી હય, બહોતસે લોગ તાવીજ વગેરા સે ફેઝ પાતે હેં. આપમેં ઇલ્મકા ઝખીરાભી ઠીક પાયા જાતા હય, ઓર આપને ભી બડી કંઇક કિતાબેંભી તસનીફ કી હેં. જેસી કે, હમારે નબીકી પાક ઉર્ફે શહીદે કર બલા, તવારીખે પીર, હઝરતઅલીકી નશી-આપને કીતાબેં ગુજરાતી ઝબાનમેં તસનીફકી હેં. તાકે હરેક

realpatidar.com

પીરાનાકી મ

https://archive.org/details/bk099/page/n118/mode/1up

realpatidar.com

બડોદા મુસ્લીમ કોન્ફરન્સ કી દાગબેલ ડાલનેમેં ભી આપહીકી કોશીષથી. યેહી વજાહસે પેહલે નવસારીમેં **" યંગમેન્સ મહોમેડન એશોસીએશન"** કાયમ હુઇ. ઓર ઉસીકે બઝરીયે મુસ્લીમ કોન્ફરન્સકા પહેલા જુલુસ બમુકામે નવસારીમેં હુવા. નવસારીકી મ્યુનિસિપાલીટીમેં ભી આપ ચેરમેન ઓર પ્રેસીડેન્ટ હો ચુકે હેં. ઓર યેહ ઓહ્દેપર રેહકર આપને નવસારીકે હિંદુ-મુસલમાન ઓર પારસી તમામ ભાઇઓંકી અચ્છી ખીદમત બજાઈ હય, ઓર નાંમવરી હાંસિલકી હય.

ઈ.સ. ૧૯૨૧–૨૨ મેં શુદ્ધિસંગઠનકી ચલવલમેં મુરીદોંકો આર્યસમાજી લીડરોંને બેહકા દીયાથા; મગર આપને આર્યસમાજીઓંકો માકુલ સવાલો જવાબ દેકર કાઇલ કીએ. ઈસીતરાહસે આપને ઇમામશાહી સાદાતોંકી ખીદમત બજાઇ હય.

આપકી યેહ કોશીષો ઈખ્લાસ કે સબબ સૈયદખાની નહીં બલકે તમામ સાદાતે ઈમામશાહીકોભી નાઝ હય ઇસિમેં કુછ શક નહીં.

આપકી મવજુદા અવલાદમેં સાત ફરઝંદ હેં.

(૧) સૈયદ અલીસગીર	(૫) તાહેરાબીબી
(૨) સૈયદ ઇમામુદ્દીન	(૬) મહંમદીબીબી
(૩) સૈયદ નુરૂદ્દીન	(૭) મુમતાઝબીબી
(૪) સૈયદ મશીહ	

અલ્લાહ પાકકા બડા ફઝલો કરમહય, ઓર બુઝુર્ગોંકા તુફૈલ હય.

કસ્બે પેટલાદ કે ઈમામશાહી " નૂરશાહી " સાદાતોં પર એક નઝર

કે જહાં જહાં ઇમામશાહી સાદાત હેં વહાં વહાં બડે સુખચેનસે ઝીંદગી બસર કર રહે હેં કસ્બે પેટલાદ મેંભી ઇમામશાહી સાદાતોંકી ઠીક તઆદાદ હય, ઓર તીન જથોંમેં મુકીમ હય; (૧) પઠાનવાડ ભાગલ, (૨) મલાવ ભાગલ ઓર (૩) જથા દેવકુવા ભાગલ.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n119/mode/1up

realpatidar.com

પઠાનવાડ ભાગલમેં જનાબ સૈયદ આબિદઅલી અલીમીયાં મશહુર થે. આપ જાગીરદાર થે ઓનરરી મેજીસ્ટ્રેટ, ઓર બરોડા સ્ટેટકી ધારાસભા કે કૌન્સીલરભી હો ચુકે થે. ઓર બહોત રોશન ખ્યાલ થે અભી આપકી વફાત હુઈ હય અલ્લાહ પાક આપકો જન્નત નશીન કરે.

મલાવ ભાગલમેં જનાબ સૈયદ અહેમદ હુસેન મશહુરથે. ઉનકી વફાતકે બાદ આપકે દોનોં સાહબઝાદોંને અચ્છી નામવરી મીલાઇ હય. (૧) જનાબ સૈયદ બાકરઅલી ઓર (૨) સૈયદ મીર સાહેબ દોનોં ઝમીનદાર હેં તિજારતમેંભી ઇમામશાહી જમાઅતમેં અવ્વલ દરજેકે હેં. આપકે છોટેભાઇ સૈયદ મીર સાહેબ બડે અકલમંદ ઓર મિલનસાર હેં બડે બડે અમલદારોં મેંભી ઇઝતકી નઝરોંસે દેખે જાતે હેં. આપને ઝુરૂરી અરબી, ઉર્દુ, અંગ્રેજી વગેરાં તાલીમ લીહય,

દેવકુવા ભાગલમેં જનાબ સૈયદ અબ્દુલ્લામીયાં મશહુર હેં. આપકે બડે સાહબઝાદે જનાબ. સૈયદ અબ્બાસઅલી સાહેબને બી.એ. કી ઉંચી ડીગ્રી મીલાઈ હય, ઇમામશાહી જમાઅતમેં આપ અવ્વલ નંબર કે ગ્રેજ્યુએટ હેં. બલ્કે બરોડાસ્ટેટ કે મુસલમાનોં મેંભી શાયદ કે દુસરા નંબર હો ફીલહાલ આપ બરોડાસ્ટેટમેં ઉર્દુ ઇન્સ્પેકટર કે (મરતબે વાલે) દરજે પર કામ કર રહે હેં, ઓર અપની કમાલીયતો ઇખ્લાસ કે સબબ છોટે બડે તમામ અમલદારોં મેં ઇઝ્ઝત પાએ હેં. યહાંતક કે અભી બરોડા-સ્ટેટમેં હિંદી ઝબાનકા ઇમ્તેહાન ઓકટોબ્બર ૧૯૩૩ ઇસ્વીમેં લીયા ગયા વોહભી આપકી કમાલિયત દેખકર સરકાર તર્ફસે આપકોહી સુપુર્દ કીયા ગયા, આપકે રોશન ઓર આલા ખ્યાલકી યેહી દલીલ કાફી હય.realpatidar.com

https://archive.org/details/bk099/page/n120/mode/1up

realpatidar.com

જનાબ સૈયદ સાદિક અલી.

જનાબ સૈયદ સાદિકઅલી વલદે બાપુમીયાં સાહબ, યેહ નાચીઝ મુતરજ્જીમ કે બડેભાઇ હેં, જીન્હોંને બચપનહીસે મહેનતો કોશીશ કરકે, દીનો દુન્યામેં કીસતરાહસે ઉરૂજ કરના ઉસકા અચ્છા સબક દીખાદીયા હય. આપ બારાહી સાલકી ઉમ્રસે ખાનગી મુલાઝેમતમેં જારી હો ગએ થે ઓર ઝુરૂરી ઈલ્મભી હાંસિલ કરતે રહે. યહાંતક કે અભી બહોત અચ્છી તનખાસે શહેર મુંબઇ મેં મુલાઝીમ હેં, અલ્લાહ ઓર ઉસકે હબીબ (સ. અ.) કી ખુશનુદી કે, "બઝરીયે એરાતો નેક ચલનકે " મુસ્તાક હેં અલ્લાહ પાક આપકો ઓરભી નેક કામ કરનેકી તવફીકઅતા ફરમાએ.

ઈસ તવારીખકો શાયેં કરને કે લીયેભી મુઝે બારબાર આપ ફરમાયા કરતે થે. જીસકો મોકા આને પર બુઝુર્ગાને દીન કે તુફેલ અંજામ દે સકા. આપ અભીભી અપને નઝદીકકે રિસ્તેદારોંકે હુકુક અદા કરનેમેં ઓર ઉનકી બેહતરી કે ખ્યાલ મેં રહેતે હેં અલ્લાહપાક આપકો તુલો તવીલ ઉમ્ર બંખ્શે. આમીન.

માસિવા ઇન હઝરાતોંકે ઓરભી ઇમામશાહી સાદાત કયા તિજારતમેં કયા સરકારી મુલાઝેમતમેં હરેક જગે બખુબી કામ કર રહે હેં.

તઝકેરતુલ અવલીયા હીસ્સા ૪ થા ઓર ઈમામશાહી સાદાતોંકે મુતાલ્લીક એતેરાઝાત કે જવાબ

તઝકેરતુલ અવલીયા હીસ્સા ૪ થા ઉર્દુ ઝબાન ઓરગુજરાતી હુરૂફોંમેં, "દીન" પેપર કે એડીટર સાહેબ જનાબ નિજામુદ્દીન એ. કુરેશીનેસાએં કીયા હય. ઉસમેં હઝરત પીર ઇમામુદ્દીન (૨૯૦) કે મુતાલ્લીકભી હકીકત લીખ્ખી હય. જીસમેં બાઝ બાઝ જગે દિલ શિકની ઓર ગલ્ત ફેમી નઝર આતી હય. ઇલાંવા ઇસ કે અગર યેહી બાત ઉનકી કીતાબમેં

realpatidar.com

https://archive.org/details/bk099/page/n121/mode/1up

realpatidar.com

કાયમ રેહ જાએ. ઔર કોઇ દલીલ ઇસકે ખુલાસેમેં લેખી મવજુદ ન મીલે તો. આયંદા કે લીએ એક ગિરોહ સાદાતે ઇમામશાહી પર બદનામી કી દલીલ રેહ જાને પાએ. શિર્ફ યેહી ગર્ઝસે કુછ કુછ ફકરે લેકર જવાબ દેના ઠીક સમઝકર યેહ ઇબારત ઇસ તવારીખમેં લેનેકી ઝુરૂરત પડી હય.

(૧) " આપકે ફરઝંદોંને મુરીદોંકી તાલીફે કુલુબ કે વાસ્તે અકસર રૂસુમાત કુફ્રકી જાયઝ રખ્ખી હેં ઇસી બિનાપર અહેમદાબાદકે સાદાત સૈયદ ઇમામુદ્દીનકી અવલાદ કે સાથ ઝયાદા મેલ જોલ નહીં રખતે. બલ્કે યહાંકી મજલીસ ઔર ઉસમેં ભી કમ શરીક હોતે હેં. "

આજતક હમને કોઇ પીર ન એસા દેખા ન સુના કે જીસને કુફ્રકી રૂસુમાત જાયઝ રખ્ખી હોં, મગર પીર ખુદ ઇસ વકતમેં મુરીદોંસે ઝયાદા દુરસ્તીકી ઉમ્મીદ બતોરે સખ્તી કે નહીં રખ સકતે. આહિસ્તા સમઝાવટ સેહી કામ લેનેસે કામયાબ હો સકતે હેં, વર્ના તરાહ તરાહ કે બોહતાનોંમે ફસ જાતે હેં. ઔર એસાહી મામલા હરેક ગિરોહકા હય.

કોઇભી ગિરોહ કે મુરીદ આપ એસે નહીં બતા સકોગે. કે સબકેસબ શહી શરીઅત કે પાબંદ ઔર માનને વાલે હોં. અગર કોઇ ગિરોહકે કોઇ મુરીદોંમેં કુછ રૂસુમે કુફ્ર નઝરભી આ જાએ તો ઉસકો પીરોંનેહી જાયઝ રખ્ખા હય, યેહ કેહના મહઝ ગલ્ત ફહેમી હય, ઔર અહેમદાબાદકે સાદાત મજલીસો મેં શરીક હોં યા નહોં ઉન્હે અખ્ત્યાર હય. અગર શિર્ફ ઉન્હીં કે શરીક હોનેસેહી રૂસુમાતે કુફ્રકા જાયઝ હોનેકા એતેરાઝ મીટ જાતા હય, તો પીરાના કે સાદાતોંકો ચાહીએ કે ઉનકી ખુશામદ કીયા કરે. જીસસે એતેરાઝ મીટ જાએ. પીરાના કે સાદાતોં કે લીયે ખુદ હઝરત ખ્વાજા હશન નિઝામી સાહેબ, " ફાતમી દાવતે ઇસ્લામમેં " લીખતે હેં, કે " હમને પીરાના કે સાદાતોંકો બહોત રોશન ખ્યાલ પાયા, " ફીર એતેરાઝ કયા બીના પર હે વોહતો અલ્લાહ જાને.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n122/mode/1up

realpatidar.com

(૨) " અસલ ઇસકી યેહ હય કે અધુરોંકે લીયે સૈયદ ઇમામુદ્દીન સાહ-બકી અવલાદને ખુદભી રસુમે કુફ્રો શિર્કો બિદઅત અખત્યાર કરલી હેં ઓર સબકે સબ જાહિલો અનપઢે હેં. "

ઉપર લીખ્ખી હુઇ ઇબારત હસદ ઓર મહઝ ગલતીકા ઇઝહાર કરા રહી હય હાં અગર આપકે કેહને કે બમુજબ સબકે સબ સાદાતે ઇમામશાહી જાહિલો અનપઢે હોં તો ઝુરૂર યેહ બાતેં સચ્ચી માની જાએ. લેકિન આપકી યેહ દલીલ રોશન ચિરાગોં કે સામને એક સાઅતભી ઠહેર નહીં સકતી.

ઇમામ શાહી સાદાતોંમેં બડે બડે તાલીમ યાફતા ઓર દાનીશમંદ શખ્સભી મવજુદ હેં; કોઇતો બરોડાસ્ટેટમેં ધારાસભામેં કૌન્સીલર કરાર પાએ હેં. કોઇ ઓફીસર હેં, કોઇ ઓનરરી મેજીસ્ટ્રેટ હેં. ઓર યું તો છોટે છોટે ઓહ્દોં પર તો બહોતસે ઇમામશાહી બખુબી કામ કર રહે હેં આપકો તવારીખ મેંભી દેખનેસે ઝુરૂર માલુમ હો જાયગા કે ઇમામશાહી સાદાત કે જો પીરઝાદા કેહલાતે હેં. જાહિલો અનપઢે નહીં બલ્કે ઇનકા સાની ગિરોહ મીલના મુશ્કીલ હય, તિજારતમેંભી યેહ ગિરોહ કે પીરઝાદે મવજુદ હેં, ઓર ઉસમેંભી કામયાબી હાંસિલ કી હય.

ઉપર બતાઇ હુઇ બાબતેં જાહિલો અનપઢોંમેં નહીં પાઇ જાતીં. ઓર અગર યેહ બાતેં પાઇ જાએં તો વોહ જાહિલો અનપઢે કેસે કહેલા સકતે હેં. યેહ લિખનાભી સિર્ફ ગલ્ત ફ્હેમીકા ઇઝહાર કરા રહા હય.

(૩) " પીરઝાદે ગુમ સુમ બુતકી તરાહ દેખા કરતે હેં, ન ઉનકી તરબીઅત હોતી હય, ન ઇસ્લામકી તાલીમ દી જાતી હય. "

વાહ, વાહ, પીરઝાદે તો ઇન્સાન હેં ઓર ઇન્સાન તો અસ્રફુલમખલુ કાત હય, જીસકો આપ બુત બનાદેતે હેં, ખેર ઇસમેંભી આપકો પીરઝાદોંકી ખેરખ્વાહી કાહીખ્યાલ હોગા કયું કે એસા કેહને સેભી રસુમે કુફ્રો, શિર્કો

https://archive.org/details/bk099/page/n123/mode/1up

realpatidar.com

બિદઅત છોડદેં, ઔર ઇસ્લામકે પાબંદ હો જાએં. મગર આપકી બતાઈ હુઇ રસુમે હમેં તો બીલકુલ નઝર નહીં આતીં.

આપ મુરીદોંકી તાલીમો તરબીયત કે લીયે લીખતે હેં, કે નહી હોતી. જરાસી તકલીફ ઉઠાકર આપને તલાસ કી હોતી તો માલુમ હોતા કે શહેર અહેમદાબાદકે મોમીન કે સિવા જીલ્લે કાનમમેં અવાખલ વગેરા ગાંવકે મોમીનભી રોઝ બરોઝ રોઝા, નમાઝ કે પાબંદ હોતે ચલે જાતે હેં. ઇલાવા જીલ્લે ખાનદેશ મેંભી યેહી હાલ હય, ફીર યેહ બાતેં બગેર તાલીમો તરબીયત કે કેસે હો શકતી હેં યેહ તો બતાઓ.

ઇમામશાહી સાદાતોં મેં કંઇ તો એસે હેં કે દાવતે ઇસ્લામ મેં કમાલ દરજજેકા કામ કર રહે હેં. ખુદ ઇસ્લામકે ઉપર આર્ય સમાજીષ્ટોને બેહુંદા હુમલે (કલમસે લીખકર, ઔર ભાષણ કરકે) કરના શરૂ કરદીયેથે, બડોદા ઔર દુસરી જગાહોં સેભી રીસાલે છપ રહે થે. જીસમેં ઇસ્લામ કે ઉપર એતેરાઝ બતાએ ગએથે. ઉનમેંસે બહોતસે એતેરાઝોંકા ખુલ્લે ખુલ્લા મુકાબલા કરને વાલેભી ઇમામશાહી ગિરોહ કે પીરઝાદા હીથે. યેહ તમામ એતેરાઝકે જવાબ આપહી કે "દીનપેપર" મેં દરજ હુવે થે. ઉનકા નામ પોશીદા નથા ફીરભી મેં આપકો યાદ દીલાતા હું કે વોહ પીરઝાદા ઔર કોઇ નહીં. બલ્કે આપકે સાથ દોસ્તાના તઆલ્લુક રખને વાલે જનાબ સૈયદ સદરૂદ્દીન એચ. દરગાહ વાલે સાહબથે. જીનકા ગુજરાત કે તમામ મુસલમાન જાનતે હેં.

(૪) " સૈયદ ઇમાદુદ્દીન સાહેબને હિંદુઓં કે બહોત બડે ગિરોહકો મુસલમાન કિયા, મગર અધુરા શાયદ આપકો તાલીમો તરબીયતકા ઝમાના નમિલા હોગા. "

realpatidar.com

https://archive.org/details/bk099/page/n124/mode/1up

realpatidar.com

યેહ નોટ પરભી ગોર કરનેકી ઝુરૂરત હય, આજભી મુલ્ક ગુજરાતમેં કંઈ હઝારકી તઆદાદમેં હઝરતપીર ઇમામુદ્દીન (રેહ૦) કે મુરીદ પાએ જાતે હેં. જો પંજવકતા નમાઝ અદા કરતે હેં, માલદાર હેં સો હજકી પેશી કરતે હેં. રોઝા ઓર કલેમા કે આશિક હેં. યેહ તમામ નેઅમતેં ઉનકા હઝરતપીર ઇમામુદ્દીન સાહબકી નશીહત ઓર કલામે કુદસીએ હાસિલ હુઇ હેં. મુઝે ઉમ્મીદ હય કે ઇસકી વકફીયત આપકો આપકે દોસ્ત મી. વલીમોહંમદ મોમીન અહેમદાબાદી (પ્રાયવેટ સેક્રેટરી માણાવદર સ્ટેટ) અચ્છી તરાહ દે સકતે હેં.

તઝકે રતુલ અવલીયા હીસ્સા ૪ થા છપકર તૈયાર હોગયા, તો મેંનેભી એક કોપી મંગાકર દેખીતો ઉપર લીખખે હુવે એતે રાઝાત કે બારેમેં જનાબ નિજામુદીન એ૦ કુરેશી સાહબકો ખતલીખા. જીસકા જવાબ જનાબકી તર્ફસે આયા; વોહ હસ્બે ઝેલ હય.

અહેમદાબાદ. તા. ૧૯-૨-૩૩

માનવંતા જનાબ સૈયદ આબિદઅલી સાહેબ

સલામ. આપનો પત્ર હું દીલ્લીથી કાલે આવ્યો ત્યારે મળ્યો

હઝરત સૈયદ ઈમામુદ્દીન (રહે૦) નું વર્ણન મીરાતે અહમદી નામની કલમી કિતાબમાંથી લેવામાં આવેલું છે. એક શબ્દ પણ મારી તરફનો નથી. આપ જોવા ચાહો તો હું બતાવી શકું છું. બસ્સો વર્ષ પહેલાં આ કિતાબ લખાઈ છે. અને તેના લેખક પાદશાહી દીવાનના વડવા છે. મારા તરફથી કોઈપણ વખતે આવા વાકય નીકળી શકે જ નહીં મારો આ ખુલાસો આપ માન્ય રાખશો. એ બાબે આપને જે પગલાં ભરવાં હોય તે ભરી શકો છો. પણ મીરાતે અહમદીમાં જે લખાયું છે તે મટી શકતું નથી.

આપનો.

લી. નિઝામુદ્દીન એ. કુરેશી.

realpatidar.com

https://archive.org/details/bk099/page/n125/mode/1up

realpatidar.com

મેરા કેહના, ઓર કુછ કુછ મુખ્તેસર ખુલાસા કરનાભી યેહી ગર્ઝસે હય, કે જો બાત લીખ્ખી ગઈ સો ટલતી નહીં. ઓર ઇસ બાબતકો જનાબ નિજામુદ્દીન સાહબનેભી ઈકરાર કીયા હય, જો આપકે ખતકી ઇબારતસે સુબુત હોતા હય. "કે મીરાતે અહમદીમેં જો લીખ્ખા ગયા હય, વોહ મીટ નહીં સકતા," ઈસી તરાહસે ઝમાના ગુઝરનેકે બાદ હો સકતા હય કે તઝ કે રતુલ અવલીયા હી. ૪ થામેં જો લીખ્ખા ગયા હય વોહ મીટ નહી સકતા. ઇસિલીયે મુઝેભી અપને અપને કુતુબખાનેમેં યેહ એતેરાઝ ફુઝુલ હેં, યેહદલીલકે તોર રખનેકી ઝુરૂર પડી. તાકે ઝમાના ગુઝરજાને કે બાદ આપકે એતેરાઝ કાયમોદાયમ રેહને નપાએ.

અબ મુખ્તેસર યેહ બાત કેહેનેકી ઝુરૂરત હય કે દોસો સાલ પર મીરાતે અહમદી કે મુસન્નિફ સાહબને એસા કયું લીખ્ખા હોગા ? કયા સબબ હોગા ? અભી કીસ તરાહસે હય ? અવ્વલ યેહી લીખ્ખી હુઈ હાલાત સહીથીયા તો હાસીદોંસે સુનકરહી સચ માનકર લીખલીયા હોગા યેહ બાતે, તલાસ કરને કે બાદ નઈ તવારીખોંવાલોંકો લીખનેકી ઝુરૂરત હય, યેહ કેહનેકી ઝુરૂરત નહીં.

મગર એસી બાતોંસે "સાદાતે પીરઝાદા" ઓર ઉનકે મુરીદ લોગ ઓર ઇન્સાફ પુરસ્ત ઓર લોગોંકી દિલશિકની હોતી હય. ઓર બેલા ઉઝર કીસી ઇન્સાનકી દિલશિકની કરના ગોયા અર્શકો હિલાના હય. ઇસલીયે હરેક બાતકો ઝુરૂરી ખોજ કરનેકે બાદ લીખ્ખી જાએ તો બહોત ખૂબ. આપકો આખિરી મેરી યેહ અર્ઝ હય, કે મેંને આપકો તશીહકે તોર યેહ બાતેં નહીં લીખ્ખીં સિર્ફ યેહી ગર્ઝસે કે યેહ નાચીઝભી હઝરતપીર ઇમામુદ્દીન (રેહ૦) કી અવલાદસે હોનેકા દાવા રખતા હય. ઇસલીયે ખિલાફ બાતોંકો કુબુલ કર સબર કરને કે એવઝ આપકી ઓર અવામકી ખિદમતમેં ઝાહિર કરનાહી ઠીક સમઝતા હય. અબ આપકો અખ્તયાર હય ચાહે ઇસ્લાહ કરો યા ન કરો. ફકત

realpatidar.com

https://archive.org/details/bk099/page/n126/mode/1up

realpatidar.com

" નસબનામા હાલાતે નઝમી "
પીરઝાદા ઇમામશાહી.

મુસન્નિફ જનાબ વકીલ સૈયદ કાઝમઅલી મુસ્તુફાઅલી સાહબ
મુ. ગોઠડા (સાવલી)

કિસસે અદા હો, તેરી હમ્દોસના અય ખાલિકે અરઝોસમા.
તેરા વસ્ફ કરનેકે લીયે કિસી વાસિફકો હય ઇમકાં કહાં. ૧
પાદશાહે આલલ અતલાક હયતૂ ઝાહિરો બાતિન હયતૂ સિર્રોંઅયાં
ખાલી નહીં તેરે સીવા કોઇ જગે અર્શ કુરસી લોહો કલમ બાગે જીનાં ૨
કાયમહયતૂ દાયમહયતૂ તૂહયકદીમ, અવ્વલહયતૂ આખિરહયતૂ
રબ્બે દો જહાં
હાઝિર હય તૂ નાઝિરહયતૂ અય ઝીલકરમ બેમિસ્લ બેમાનીન્દહય
અયરાઝદાં ૩
તૂને અપને ફઝલસે પેદા કીયા સૈયદુલ મુરસલીં શહે લવલાકકો
અહેમદ મુજતબા મોહંમદ મુસ્તફા કુલ કાએનાત ઓર ખાકકો ૪
બહરે ઝખ્ખારે નબીસે ચશ્મ હાએ બે અદદ પેદા કીયે
અપને ખઝાને ગેબસે લાખોં મરાતબ ઉનકો દીયે ૫
મવલા અલીકો ઇમામત સુજાઅત વિલાયતકી અતા
ક્યું કે અખીયે ફિદુનિયા વલ આખેરા થે શાહે લા ફતા, ૬
બિન્તે રસુલે અરબીકે શોહરથે શાહ ઝુલ્ફિકાર
સાકીએ કવસર ખયબર શીકન નબીકે બાગકે મુખ્તાર ૭
ઇબ્ને રસુલુલ્લાહકી તારીફમેં કયા તહરીર હો
જીન્કી શાનમેં કુરઆનસે આયતેં તતહીર હો. ૮

realpatidar.com

realpatidar.com

હસન મુજતબા **ઓર હુસેન**[૨] **કરબલાકે** ઝાહિર શહીદ
મવલાકે લાલ ફરઝંદે ફાતિમા પાએ શહાદત દોનોં સઈદ. ૯

યેહ પાંચ તન મઆસૂમ હેં પંજતન હય જીનકા લકબ
આલી મરાતબ આલી ખાનદાન હાશમી હય જીનકા નસબ. ૧

જીન્નો ઇન્સ હુરો મલક સારી ખુદાઇ કુરબાન હય
ઇન્કી મહોબ્બતકે દોસ્ત ઓર દુશ્મનોંકો અરમાન હય, ૧૧

કરબલાકે જંગમેં ખેશો અકારિબ અનસારો યાર
જાને અપની દે ચુકે રાહી હુવે સૂએ જીનાં વોહશોહ સવાર. ૧૨

ફરઝંદે દિલબંદ બાકી રહે **ઇમામે ઝેનુલ**[૩] **એબા.**
આલે નબીકા પીર લકબ હો ગયા આલે એબા ૧૩

ઇનકે પીસર **બાકર**[૪] બાવફા હો ગયે ગદ્દીનશીન.
લાયકો મુમતાઝો બાકરામતથે વોહ હશીન. ૧૪

બાદ ઇનકે દિલબર **ઇમામ જાફરે**[૫] **સાદિક** હુવે
દોનોં જહાંમે ઇઝ્ઝુતો હુરમતમેં વોહ ફાયક હુવે. ૧૫

ઇન હઝરતકી વલદીયતમેં પેદા હુવે હેં શશઇમામ
ઉન સભોં પર મોમીનો ભેજો દુરૂદો સલામ, ૧૬

પાકતન બાકરામત ફેઝ બખ્શો ફેઝરસાં **ઇસ્માઇલ**[૬] થે.
પીસરે નેક ખલીકો, ફસીહો, હશીનો શકીલ થે. ૧૭

ઇન હઝરતસે ચશ્માજો નિકલા પુર બહાર બેગુમાં
કંઇ કંઇ તરાહકે શજરો ગુલ શાખેં ઉઠી સિરેંઆયાં ૧૮

realpatidar.com

https://archive.org/details/bk099/page/n128/mode/1up

realpatidar.com

ફરઝંદ દિલબંદ **નૂરમોહંમદ**[૭] સૈયદુસ્સાદાત હય,
દરગાહે આલી આજતક નવસારીમેં આબાદ હય, ૧૯
ઉસ ઝમાં પટ્ટનમેં હુકુમતથી રાજા સિદ્ધરાજકી.
દેખકર ઇન હઝરતકી કરામત શિકલ બની મોહતાજકી. ૨૦
ઇનકે ફીસર **સૈયદ ઇસ્માઇલ**[૮] નુરૂનઅલા નૂર થે.
સજ્જાદાનશીં ઇન હઝરત કે **મોહંમદ**[૯] **મન્સુર** થે. ૨૧
શાહ તાલીબ[૧૦] જીસકો હરગીઝ તલબ દુનિયાકી નથી.
ઉકબાકી તલબમેં અપની સબ ગુઝારી ઝીંદગી. ૨૨
અબ્દુલમજીદ[૧૧] ઓર બાદ ઉનકે **સૈયદ મુસ્તફા**[૧૨]
બસરકી અવકાત સબ બીચ તબ્લીગે દીને હોદા, ૨૩
અહંમદેહાદીને[૧૩] હિદાયતકી રાહ બતાઇ બેદીનકો
ઇસ્લામકી શમે રોશન દિખાકર બઢાયા દીનકો, ૨૪
સૈયદ હાશમકી[૧૪] હશમતકા નહીં યારો કુછભી શુમાર
બાદ ઉનકે **મોહંમદ**[૧૫], **મહેમુદ**[૧૬], ઓર **ખાલીદ**[૧૭] બાવિકાર ૨૫
ખલીલુદીન કે લકબસે ખાલીદ જાબજા મશહુર થે
સૈયદ મોમીન[૧૮] વ **ઇસ્લામુદીન**[૧૯] દુનિયાસે વોહ દુર થે. ૨૬
સલાહુદ્દીન[૨૦] ઓર **શમ્સુદીન**[૨૧] ઇશ્કે હકીકીમેં ફનાકર ચુકેથે આપકે
હઝરત નશીરૂદીનકી[૨૨] નુસરત હુઇ ઇસ્લામકો ૨૭
છોડ કર દુનીયા કે એશો આરામ કો
ફેઝ બખ્શા હિંદુ-મુસલમાં ખાશો આમકો ૨૮

realpatidar.com

https://archive.org/details/bk099/page/n129/mode/1up

realpatidar.com

બાદ સજ્જાદાનશી કીયે, **શાહબુદીન**[૨૩] ઓર **સદરૂદીન**[૨૪] નેકકો,
હુસ્ન ખુબી ઈલ્મો અમલમેં **હશન કબીરૂદીન**[૨૫] એક થે. ૨૯

હઝરત ઈમામુદીનકી[૨૬] કરશ્મા કરામતકા જો ડંકા બજા.
ઈમામશાહી ગિરોહકા હિંદમેં તબ આગાઝ હુવા. ૩૦

ગુજરાત ઓર દખ્ખનમેં ઈઝહાર હુવા યેહ રીવાજ
કબઝેમેં લીયાથા રૂહાની તસલ્લતકા રાજ ૩૧

બનીયેં, બ્રહ્મન, રાજપૂતમેં ઓર કોમે દીગર
શોરાથા ઈનકા કરીયા વ શહેરમેં દર બદર. ૩૨

ક્યા કશીશથી ઈન હઝરતકી કરામતકી બહાર
જીન્કે તર્ફ દેખા કંઠી ઓર જનોઈ દી ઉતાર. ૩૩

ઈસ્લામકે ઝુમરેમેં વોહ દાખિલ હુવે એક આનમેં
શેખ ઓર મોમીન લકબ દે દીયા ઉનકી શાનમેં ૩૪

હાં મગર અપનીહી કરાબતમેં વોહ કાયમ રહે
ઈસ્લામકે અરકાન પર બેશક દાયમ રહે. ૩૫

વહેદાનીયત ઓર પંજતનપે ફરેફ્તા હો ગએ
આલે નબી સાદાત પર જાનોમાલ સદકે કીયે. ૩૬

પીરાનામેં ઇન હઝરતકી દરગાહ મવજુદ હય,
ઈમામશાહી ગિરોહકા તરીકા જીન્કે તર્ફ મનસુબ હય, ૩૭

આલા ખાનકા બની હય, બહોત શવકત કે સાથ
આતે હેં ઝયારત કે લીયે સબ ઈઝ્ઝતકે સાથ, ૩૮

realpatidar.com

https://archive.org/details/bk099/page/n130/mode/1up

realpatidar.com

ઇનકે પીસર **નુરમોહંમદ**[૨૭] દુનિયાસે જો આઝાદ થે
ઇસ્લામ ઓર ઇમાનમેં કામિલ, વલી માદરઝાદ થે. ૩૯

મુસ્તફા[૨૮] એહલે શફાથે ઇનિ હઝરત કે પીસર
વસલતે મવલામેં હમેશાં **નુરશાહથે**[૨૯] બાવકર. ૪૦

બાદઅઝ **ફતેહુલ્લાહ**[૩૦] ઇનકે હુવે કાયમ મકામ
સજ્જાદાનશીં પીરબને **વલીયુદીન**[૩૧] હય જીનકા નામ. ૪૧

દીનકો રોશન કીયા પીર શાહ **નિજામુદીન**[૩૨] હય.
પીટલાદમેં શાકીન રહે વોહ હઝરત **તાજુદીન**[૩૩] હય, ૪૨

શોરાથા ઇનકા ગુજરાતમેં હરજગે ઓર જાબજા.
સૈયદ [૩૪]**અલીજાનશીંથે** બાદ ઇનકે બા હયા ૪૩
બાપુમીયાંથે[૩૫] કમસુખન ઇનિ સાહબકી અવલાદમેં
સૈયદ હુસેન[૩૬] વારિસ હુવે બાપુમીયાં કે બાદમેં. ૪૪

શાદીકા જશનથા પીરઝાદોંમેં, જીસકો રોકાથા નાગરોંકી નાતને
નામ લે કર હયદરે કર્રારકા મુશ્કીલકો દફા કીથીઆપને ૪૫
મહેરઅલીસે[૩૭] **બાપુમીયાંકા**[૩૮] હુવા હય પીરઝહુર
સાદિકો[૧] **આબિદ**[૨] અલી હેં નુરૂન અલા નૂર ૪૬
સજ્જાદો[૩] **અલી**[૪] હુસેન ચારોં બીરાદર બાશઉર
કાઝમઅલીકી યેહ દુઆ હય, હકકી રહેમતહો ઇનપે મામુર. ૪૭

(તમામ શુદ)

તા. ૩ માહે રમદાન સને ૧૩૫૨ હીજરી, મુતાબિક તા. ૨૧-૧૨-૩૩ } **સૈયદ આબિદઅલી બાપુમીયાં પીરઝાદા.**

realpatidar.com